

બહુયરાજુ રેલ કોર્પોરેશન લીમિટેડ

દ્વિતીય વાર્ષિક અહેવાલ - નાણાંકીય વર્ષ ૨૦૧૬-૨૦ ના વિલંબના કારણો

નાણાંકીય વર્ષ ૨૦૧૬-૨૦ ના વાર્ષિક હિસાબો અને અહેવાલ કંપની ધારા, ૨૦૧૩ મુજબ તૈયાર કરી કંપની ધારા મુજબ ઓડીટ કરાવવાના થાય છે. ત્યારબાદ, એકાઉન્ટન્ટ જનરલની કચેરી દ્વારા ઓડીટ થાય છે.

કંપનીનો દ્વિતીય વાર્ષિક અહેવાલ ડિસેમ્બર - ૨૦૨૦ માં વાર્ષિક સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવેલ ત્યારબાદ, કોવિડ-૧૯ ની મહામારીને ધ્યાને લઇ, કચેરીઓ તથા અન્ય વાણીજ્યક પ્રવૃત્તિ નહીંવત ચાલુ હતી, જે કારણે વાર્ષિક અહેવાલ પ્રીન્ટ થઇ શકેલ નહીં.

આમ, ઉપરોક્ત વહીવટી તથા અન્ય કારણોસર દ્વિતીય વાર્ષિક અહેવાલ હવે, સપ્ટેમ્બર-૨૦૨૧ ના વિધાનસભાસત્રમાં રજુ કરેલ છે.


 મુજબ કારોબારી અધિકારી,
 બહુયરાજુ રેલ કોર્પોરેશન લીમિટેડ
 (બી.આર.સી.એલ.)


 નાર્મદા પટેલ
 ડાયોગ અને ખાણ વિભાગ
 સાચિવાલય, ગાંધીનગર,

ઉદ્યોગ અને ખાતું વિભાગ
 કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૩૮૪(૨) અન્વયે
 બહુચરાજુ રેલ કોર્પોરેશન લિમિટેડનો હિવ્ટીય વહીવટી અહેવાલ
 (નાણાંકિય વર્ષ ૨૦૧૯-૨૦)

બહુચરાજુ રેલ કોર્પોરેશન લિમિટેડ (BRCL) કંપની ધારા, ૨૦૧૩ હેઠળ નોંધાયેલ ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને માર્ગતી સુઝુકી ઈન્ડીયા લિમિટેડ સાથેની જોઈન્ટ વેન્ચર સરકારી કંપની છે. જેની સ્થાપના તારીખ ૧૨.૨૦૧૮ ના રોજ થયેલ છે.

આ કંપનીની રચના ગુજરાત રાજ્યના કટોસાણ રોડ-બેચરાજુ-ચાણસ્મા-રાશુંજ (૬૫ કીમી) લાઈનના ગેજ કન્વર્જન માટે પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવો, ધીરાણીકરણ, આયોજન અને અમલીકરણ અથે થયેલ છે.

ચાલુ વર્ષ દરમાન કંપનીએ નીચે મુજબની પ્રોજેક્ટની ગતિવિધિઓ હાથ ધરેલ છે :

એ) પ્રોજેક્ટની વિવિધ ગતિવિધિઓ માટે ટેન્ડરની પ્રક્રિયા કરવી અને ટેન્ડર ફાળવણીની કામગીરી એટલે કે ટ્રાન્ઝેક્શન એડવાઈઝરની કામગીરી જી-રાઇડને સૌંપવામાં આવેલ છે.

બી) ફિલ્ડ સુપરવિઝન અને કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્સી એજન્સીની નિમાણંક કરવામાં આવી છે.

સી) અન્ય રોજંદા કામકાજો પ્રોજેક્ટના સરળ પ્રગતિ માટે હાથ ધરેલ છે.


ડી) પ્રોજેક્ટને લગતી જમીન સંપાદનની પ્રક્રિયા માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટ કચેરી સાથે સંકલન પ્રગતિમાં છે.

ઇ) પ્રોજેક્ટની વિવિધ ગતિવિધિઓની પ્રગતિનું દેખરેખ રાખવામાં આવેલ છે.

એફ) પ્રોજેક્ટને લગતા વિવિધ મુદ્દાઓ માટે રેલવે અને રાજ્ય સરકાર સાથે સંકલન પ્રગતિમાં છે.

કંપની મેનેજમેન્ટ આશાવાદી છે કે, કંપનીની દરેક ગતિવિધિઓને વેગ આપશે અને આવનારા વર્ષોમાં પ્રોજેક્ટનું અમલીકરણ ઝડપી કરશે.

કંપનીના રીપોર્ટિંગ સમયગાળા દરમાન રૂ. ૧૦,૮૩,૪૭૧/- ની ખોટ થયેલ છે.





બહુચરાજુ રેલ કોપરિશન લિમિટેડ

સીઆઈએન : યુઝપ્રોફિલ નંબર : ૨૦૧૮૭૯૮૪૩૨૦૫૬૦૨

બીજો વાર્ષિક અહેવાલ (નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦)

તારીખ : ૨૨/૦૯/૨૦૨૦

સમય : ૧૨:૩૦ કલાકે

સ્થળ : બ્લોક નં. ૬, ૭ મો માળ, ઉધોગ ભવન,
સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧,
ગુજરાત.

: રજીસ્ટર્ડ ઓફિસ :

બહુચરાજુ રેલ કોપરિશન લિમિટેડ

બ્લોક નં. ૬, ૭ મો માળ, ઉધોગ ભવન, સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧
ફોન : ૦૭૯-૨૩૨-૩૨૭૨૮ / ૨૯, ઈ-મેલ : info@brcl.org.in



બીજો વાર્ષિક અહેવાલ (નાણાંકીય વર્ષ ૨૦૧૯ - ૨૦૨૦)

બહુચરાજુ રેલ કોપરિશન લિમિટેડ

સીઆઈએન : યુ૪૫૧૦૧જે૨૦૧૮એસજી૧૦૫૬૦૨

અનુક્રમણીકા

ક્રમ	વિગત	પાના નં.
૧.	બોર્ડના નિયામકો	૪
૨.	બીજો વાર્ષિક સામાન્ય સભાની નોટીસ	૫
૩.	સંચાલક મંડળનો અહેવાલ	૮
૪.	ઓડીટરનો સ્વતંત્ર અહેવાલ	૨૫
૫.	સરવૈયુ	૩૭
૬.	નફા નુકશાનનો હિસાબ	૩૮
૭.	કેશ ફલો પત્રક	૪૧
૮.	નાણાંકીય પત્રકોની નોંધો	૪૪

બહુચરાજુ રેલ કોર્પોરેશન લિમિટેડ

સીઆઈએન : યુરેનિયાન્ડ્રાઇવ્સ એસ્ટેટ્સ નંબર ૧૦૫૬૦૨

સંચાલક મંડળ

ક્રમ	ડિરેક્ટરનું નામ અને ડિઅસ્ટ્રિક્શન	છોદો
૧.	શ્રી અશ્વિનીકુમાર રાજેન્દ્રપ્રસાદ યાદવ - ૦૯૪૮૧૭૫૩	ચેરમેન
૨.	શ્રી બજરંગ વર્લી છગનભાઈ - ૦૭૧૩૩૮૪૨	નિયામક
૩.	શ્રી સંતોષ કુમાર - ૦૭૮૫૪૧૭૮	નિયામક
૪.	શ્રી ધર્મેશ નરહરીભાઈ બ્રહ્મભટ્ટ - ૦૮૨૬૮૫૫૮	નિયામક
૫.	શ્રી બચ્યુ વેનુગોપાલ - ૦૮૩૦૩૬૮૭	નિયામક
૬.	શ્રી રાજ સ્વરૂપ કપુર - ૦૮૩૦૩૬૮૮	નિયામક
૭.	શ્રી જૈગમ અલી ખાન - ૦૭૬૫૫૫૭૬૦	નિયામક

ધૈદાનિક ઓડિટર

મેસર્સ શાહ એન્ડ દલાલ,
ચાર્ટર્ડ એક્ઝાઉન્ટન્ટ,
અમદાવાદ.

બેન્કસ

યસ બેન્ક,
ગાંધીનગર

નોંધાયેલ કચેરી

બ્લોક નં. ૬, ૭ મો માળ,
ઉદ્યોગ ભવન, સેક્ટર - ૧૧,
ગાંધીનગર - ૩૮૨૦૧૧.

બીજો વાર્ષિક સામાન્ય સભાની નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે કંપની બહુચરાજુ રેલ કોર્પોરેશન લીમીટેડની બીજો વાર્ષિક સામાન્ય સભાની બેઠક મંગળવારે, બાવીસમી સ્પટેમ્બર, ૨૦૨૦ ના રોજ ૧૨.૩૦ કલાકે (શૉર્ટ નોટીસમાં) વીડીયો કોન્ફરન્સીઝ / ઓએવીએમ મોડ દ્વારા બ્લોક નંબર ૬, ૭ મા માળે, ઉઘોગ ભવન, સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧ ખાતે રાખવામાં આવેલ છે અને તેમાં નીચે મુજબની કાર્યવાહીઓ હાથ ધરવા માટે રાખવામાં આવેલ છે.

સામાન્ય કાર્યવાહી:-

૧. ત૧ મી માર્ચ, ૨૦૨૦ ના રોજ પૂર્ણ થતી આ કંપનીની ઓડીટેડ નાણાંકીય પત્રકોને પ્રાપ્ત કરવા, ચકાસવા અને મંજુર કરવા અને તેની સાથો સાથ બોર્ડ ઓફ ડિરેક્ટર અને ઓડીટરોના રીપોર્ટ અને કમ્પ્રોલર અને ઓડીટર જનરલ ઓફ ઇન્ડીયાની ટીપ્પણીઓ બાબતે ઘટતું કરવા સારુ.
૨. શ્રી બજરંગ છગનભાઈ વરલી (ડીઆઈએન : ૦૭૧૩૮૮૪૨) કે જેઓ નિયામક તરીકે રોટેશનથી નિવૃત્ત થાય છે તેઓને તેમની લાયકાતને ધ્યાને રાખી તેઓએ ફરીથી નિયુક્તી માટે પોતાને પ્રસ્તુત કરેલ હોય જેથી તેઓને નિયામક તરીકે નિયુક્ત કરવા સારુ.
૩. શ્રી રાજ સ્વરૂપ કપુર (ડીઆઈએન : ૦૮૩૦૩૬૮૮) કે જેઓ નિયામક તરીકે રોટેશનથી નિવૃત્ત થાય છે અને તેઓને અને તેમની લાયકાતને ધ્યાને રાખી તેઓએ ફરીથી નિયુક્તી માટે પોતાને પ્રસ્તુત કરેલ હોય જેથી તેઓને નિયામક તરીકે નિયુક્ત કરવા સારુ.
૪. કંપનીના નિયામકોના બોર્ડને કંપનીના વર્ષ ૨૦૨૦-૨૧ ના વર્ષના હિસાબોના ઓડીટ માટે ભારતના સીએજી દ્વારા નિયુક્ત કરવામાં આવેલ સ્ટેચ્યુટરી ઓડીટરોના પગાર / ભથ્થા નક્કી કરવા માટે પરવાનગી આપવા સારુ.

ખાસ કાર્યવાહી:-

૫. જો યોગ્ય લાગે તો નીચે દર્શાવેલ ઠરાવને ખાસ ઠરાવ તરીકે ફેરબદલી સાથે કે તેના વગર પસાર કરવા સારુ.

સામાન્ય ઠરાવ

આથી ઠરાવવામાં આવે છે કે કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૮ અને ૧૫૨ અને શેડ્યુલ ૪ ને વંચાણે લેતા અને અન્ય લાગુ પડતી ધારાઓને ધ્યાને રાખી કંપની (નિયામકોના નિયામન અને લાયકાત) નિયમો, ૨૦૧૪ (જેમાં સ્ટેચ્યુટરી સુધારાઓ કે ફેર સુધારાઓ કે જે સમયે સમયેમાં કરવામાં આવેલ છે) તેના અનુસંધાને મીસ કવીતા શેઠ (શાહ) (ડીઆઈએન : ૦૮૨૬૮૫૫૮) કે જેઓને કંપનીના એડીશનલ ડાયરેક્ટર તરીકે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા ૬ ટી ફેબ્રુઆરી, ૨૦૨૦ થી કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૬૧ (૧) મુજબ નિમવામાં આવેલ છે અને તેઓએ કંપનીના આર્ટિકલ ઓફ એસોસીયેશનથી વાર્ષિક સામાન્ય સભાની મીટિંગની તારીખ સુધી કામગીરી સંભાળેલ છે તેઓને હવે કંપનીના વુમન

ડાયરેક્ટર તરીકે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જાઈડીસી) દ્વારા નિયમન કરવામાં આવેલ છે.

નોંધાયેલ ઓફિસ:- બોર્ડના નિયામકોના હુકમ મુજબ

બ્લોક નં. ૬, ૭ મો માળ,

ઉદ્યોગ ભવન,

સેક્ટર - ૧૧,

ગાંધીનગર - ૩૮૨૦૧૧.

તારીખ: ૨૨-૦૬-૨૦૨૦

સહી/-

ચેરમેન/નિયામક

નોંધ:-

- આ અહેવાલના કોઈ પણ ભાગને લગત માહિતી મેળવવા ઈચ્છુક કોઈ પણ શેર ધારકે આ બાબતે કંપનીને અગાઉથી જ લેખિતમાં જાણ કરવી જોથી કે મેનેજમેન્ટ દ્વારા જરૂરી માહિતી સમયસર તૈયાર કરી શકાય.

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૦૨ (૧) અનુયે સ્પષ્ટીકરણ નિવેદન

ખાસ કાર્યવાહી

વિગત નં. ૫

મીસ કવીતા શેઠ (શાહ) (ડીઆઈએન : ૦૮૨૬૮૫૫૮) ને કાચમી કરવા બાબત

મીસ કવીતા શેઠ (શાહ) (ડીઆઈએન : ૦૮૨૬૮૫૫૮), કે જેઓને કંપનીના વધારાના નિયામક તરીકે કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૬૧ (૧) મુજબ હ ઠી ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ નિયમન કરવામાં આવેલ છે અને તેઓએ વાર્ષિક સામાન્ય બેઠકની તારીખે ખુરશી સંભાળેલ છે અને તેઓ કંપનીના વુમન ડાયરેક્ટર તરીકે નિયમન પામવા લાયકાત ધરાવે છે તેઓને ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જારી રીતે) દ્વારા નિયમન આપવામાં આવે છે.

કંપનીના નિયામક બોર્ડ તમારી મંજુરી માટે સામાન્ય દરાવ સૂચવેલ છે.

કંપનીના બોર્ડ ના નિયામક અથવા કોઈપણ ખાસ મેનેજરીયલ પર્સોનેલ (જેમાં નિયામકો અને ખાસ મેનેજરીયલ પર્સોનેલના સબંધીઓનો સમાવેશ થાય છે) નો આ દરાવમાં કોઈ પણ જાતનો સંબંધ કે રૂચી નાણાંકીય કે અન્ય કોઈપણ રીતે રહેલ નથી.

બહુચરાજુ રેલ કોર્પોરેશન લિમિટેડ

સીઆઈએન : યુઝપ્રોજેક્ટ્સલિમિટેડ

રજીસ્ટર્ડ ઓફિસ: બ્લોક નં. ૬, ૭ મો માળ, ઉધોગ ભવન, સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧

સંચાલક મંડળનો અહેવાલ

પ્રતિ,

સભ્યો,

બહુચરાજુ રેલ કોર્પોરેશન લિમિટેડ,

ગાંધીનગર, ગુજરાત

તમારા નિયામકોને બહુચરાજુ રેલ કોર્પોરેશન લિમિટેડ ("કંપની")ની કામગીરી અને ધંધા બાબતે અને ૩૧ મી માર્ચ, ૨૦૨૦ અંતિતના હિસાબોનો બીજો વાર્ષિક અહેવાલ આપની સમક્ષ પ્રસ્તુત કરતા ખૂબ જ આનંદ થાય છે.

૧. નાણાંકીય વિગતો અથવા કંપનીની કામગીરીને લગત અગત્યની બાબતો:-

૩૧ મી માર્ચ, ૨૦૨૦ અંતિતના સમયગાળા માટે કંપનીની નાણાંકીય સ્થિતી નીચે મુજબ છે.

(રકમ રૂ.)

વિગત	૨૦૧૯-૨૦	૨૦૧૮-૧૯
ઓપરેશનસમાંથી આવક	૦	૦
અન્ય આવક	૧૭,૫૮,૪૭૦	૮,૪૦૦
કુલ આવક	૧૭,૫૮૪૭૦	૮,૪૦૦
ઓછા : કુલ ખર્ચ	(૨,૨૮,૪૨,૮૪૧)	(૧,૬૧,૨૦,૧૩૫)
નફો / (નુકશાન) ટેક્ષ પહેલા	(૨,૧૦,૮૩,૪૭૧)	(૧,૬૧,૧૧,૭૩૫)
ઓછા : ટેક્ષ ખર્ચ	૦	૨૨૦૦
નફો / (નુકશાન) ટેક્ષ બાદ	(૨,૧૦,૮૩,૪૭૧)	(૧,૬૧,૧૩,૬૩૫)

૨. આ સમયગાળા દરમ્યાન કંપનીની કામગીરીની ટૂંકમાં વિગતો:-

કંપની દ્વારા નીચે મુજબની ધંધાકીય કામગીરીઓ હાથ ધરવામાં આવેલ છે.

- એ) ટ્રાન્સેક્શન સલાહકારની કામગીરી જીઆરઆઈડીઇ ને પ્રોજેક્ટના ટેન્ડરોને ફાળવવા અને પ્રોસેસ કરવા માટે સોપવામાં આવેલ છે. પ્રોજેક્ટ માટે ઈ.પી.સી. કોન્ટ્રાક્ટરની નિમણું કથ્યેલ છે.

- બી) ફીલ્ડ સુપરવીઝન અને કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્સી એજન્સીને નક્કિ કરવામાં આવેલ છે.
- સી) કંપનીદ્વારા રોજબરોજના ઈનહાઉસ કામગીરીના સુચારુ અમલીકરણ માટે આયોજન કરવામાં આવેલ છે.
- ડી) રાજ્ય સરકાર અને જલ્દીવટ દ્વારા પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે.
- ઇ) જુદી જુદી કામગીરીઓ માટે પ્રોજેક્ટના પ્રોગ્રેસને ચકાસવામાં આવી રહેલ છે.
- એફ) પ્રોજેક્ટની તમામ બાબતો માટે રેલ્વે અને રાજ્ય સરકાર વચ્ચે લાઈઝન કરવામાં આવી રહેલ છે.
મેનેજમેન્ટને એવી આશા છે કે તેઓ કામગીરીમાં વેગ લાવી શકશે અને આવનાર વર્ષોમાં પ્રોજેક્ટના અમલીકરણમાં ગતી લાવી શકશે.

૩. કોવીડ - ૧૯ ની અસરો:-

નોવલ કોરોના વાયરસ (કોવીડ - ૧૯) સમગ્ર દુનીયામાં ખૂબજ તીવ્ર ગતિએ ફેલાઈ રહેલ છે. આ વાયરસનો માનવ જીવન પર તો અસર થયેલ છે અને તેના ઉપરાંત ધંધાઓ ઉપર અને નાણાંકીય બજારો પર પણ અસર કરેલ છે અને તેનો વ્યાપ હાલ સમજી શકાય તેમ નથી. બધા પાસાઓને ધ્યાને લઈ અને પરીસ્થિતીની અસરો અને તેના પરીણામોને સમજી નાણાંકીય પત્રકોનો અદાજ લેવો જરૂરી છે. કંપની દ્વારા ખૂબજ બારીક રીતે કોઈપણ પરીવર્તનો કે જેઓ ભવિષ્યની નાણાંકીય પરીસ્થિતી અને તેની કામગીરી પર થઈ રહેલ અસરોની ચકાસડી કરશે.

૪. ધંધામાં ફેરફારો જો કોઈ હોય તો:-

હાલના રિવ્યુના સમયગાળામાં કંપનીના ધંધામાં કોઈ પણ જાતના ફેરફારો થયેલ નથી.

૫. ડીવીડન્ડ:-

હાલના રિવ્યુના સમયગાળા દરમ્યાન બોર્ડના નિયામકોએ કંપનીના ઈક્વીટી શેરોમાં કોઈપણ પ્રકારનો ડીવીડન્ડ સૂચયેલ નથી.

૬. રીઝર્વમાં તબદિલ:-

હાલના રિવ્યુના સમયગાળા માટે કંપનીએ કોઈ પણ રકમને જનરલ રીઝર્વમાં ટ્રાન્સફર કરેલ નથી.

૭. કંપનીની શેર કેપીટલ અને શેર કેપીટલમાં જો કોઈ ફેરફાર હોય તો :-

કંપનીએ સબસ્કાઈબરોના મેમોરેન્ડમ ઓફ એસોસીયેશનમાં રૂ. ૧૦/- ના ૧૦,૦૦,૦૦૦ ઈક્વીટી શેર ફાળવેલ છે.

કંપનીનું ત૧ મી માર્ચ, ૨૦૨૦ અંતિત ઓથોરાઈઝ, બહાર પાડેલ, સબસ્કાઈબડ અને પેડ અપ શેર બંડોળ નીચે મુજબ છે.

શેર ભંડોળની રૂપરેખા	
ઓથોરાઇઝ શેર કેપીટલ ★	રૂ.૨,૨૫,૦૦,૦૦,૦૦૦/- (રૂપીયા બસ્સો પચીસ કરોડ પૂરા) ના રૂ.૧૦ ના ૨૨,૫૦,૦૦,૦૦૦ ઈક્વીટી શેરોમાં વિભાજીત કરવામાં આવેલ છે.
ઈશ્યુ, સબસ્કાઈબ અને પેઈડ અપ શેર કેપીટલ ★★	રૂ. ૧,૦૦,૦૦,૦૦૦/- (રૂપીયા એક કરોડ પૂરા) ને રૂ. ૧૦ ના ૧૦,૦૦,૦૦૦ ઈક્વીટી શેરોમાં વિભાજીત કરવામાં આવેલ છે.

- ★ હાલના નાણાંકીય વર્ષ કે જે ચકાસણીમાં છે તેમાં કંપનીના ઓથોરાઇઝ શેર કેપીટલમાં રૂ. ૧,૦૦,૦૦,૦૦૦ (રૂપીયા એક કરોડ પૂરાનો) વધારો થયેલ છે અને તેને ૧૦,૦૦,૦૦૦ (દસ લાખ) રૂ. ૧૦/- ના ઈક્વીટી શેર કે જે રૂ. ૨૨૫,૦૦,૦૦,૦૦૦ (રૂપીયા બસ્સો પચીસ કરોડ પૂરાના) ના છે તેને ૨૨,૫૦,૦૦૦ (બાબીસ કરોડ પચાસ લાખ) ના રૂ. ૧૦/- ના ઈક્વીટી શેરમાં વિભાજીત કરવામાં આવેલ છે.
- ★★ કંપનીના દરેક ઈક્વીટી શેર ધારકને રૂ. ૧૦/- (દસ) ના ૮,૨૫,૮૦,૦૦૦ (આઠ કરોડ પચીસ લાખ ઔંશી હજાર) રાઈટ બેઝીસ પર ફાળવવામાં આવેલ છે, જે ૨૪ મી જુલાઈ, ૨૦૨૦ ના રોજના અસરથી હાલના શેર ધારકોને પારી પાસુની અસરથી ફાળવવામાં આવેલ છે.

૮. સાબસીડ્રીઓ, સંયુક્ત ઉદ્યોગો અને એશોસીએટ્સ કંપનીઓ:-

કંપની ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન અને મારુતી સુજુકી ઈન્ડીયા લીમીટેડનું એક સંયુક્ત સાહસ છે. તેથી શેર હોલ્ડિંગ પદ્ધતિ અનુસાર કંપની જે. વી. પાર્ટનર્સની એક એશોસીએટ કંપની છે.

૯. ફેરબદલીના હક્કો સાથે ઈક્વીટી શેરો બાબતેના ખુલાસાઓ:-

આ સમયગાળા દરમ્યાન કંપનીએ ડીફરન્શયલ વોટીગ હક્કો સાથે કોઈ પણ ઈક્વીટી શેરો ઈશ્યુ કરેલ નથી અને તેથી કંપનીને કંપનીઝ (શેર કેપીટલ એન્ડ ડિબેન્ચર) નીયમો, ૨૦૧૪ ના નીયમ ૪ (૪) મુજબ કોઈ પણ પ્રકારના ખુલાસા કરવાના રહેતા નથી.

૧૦. સ્વેટ ઈક્વીટી શેરો બાબતેના ખુલાસાઓ:-

આ સમયગાળા દરમ્યાન કંપનીએ કોઈ સ્વેટ ઈક્વીટી શેરો બહાર પાડેલ નથી અને તેથી કંપનીએ કંપનીઝ (શેર કેપીટલ એન્ડ ડિબેન્ચર) નીયમો, ૨૦૧૪ ના નીયમ ૮ (૧૩) મુજબ કોઈ પણ પ્રકારના ખુલાસા કરવાના રહેતા નથી.

૧૧. કર્મચારી સ્ટોક વિકલ્પ બાબતેના ખુલાસાઓ:-

આ સમયગાળા દરમ્યાન કંપનીએ કર્મચારી સ્ટોક વિકલ્પ સ્કીમ અંતરગત કોઈ શેરો બહાર પાડેલ નથી તેથી કંપનીને કંપનીઝ (શેર કેપીટલ એન્ડ ડિબેન્ચર) નીયમો, ૨૦૧૪ ના નીયમ ૧૨ (૯) મુજબ કોઈ પણ પ્રકારના ખુલાસા કરવાના રહેતા નથી.

૧૨. કર્મચારીઓની વિગતો:-

બહુચરાજુ રેલ કોર્પોરેશન લીમિટેડ એક લીસ્ટેડ કંપની ન હોવાથી કલમ ૧૮૭ (૧૨) અને કંપનીઝ (એપોઈન્ટમેન્ટ એન્ડ રીમ્યુનરેશન ઓફ મેનેજેનીયલ પર્સનન્લ) નીયમો, ૨૦૧૪ મુજબ કર્મચારીઓના વિગતની બાબત કંપનીને લાગુ પડતી નથી.

૧૩. નિયામકો અને ખાસ મેનેજેરીયલ અધિકારીઓ:-

હાલના રીવ્યુના નાણાંકીય વર્ષમાં રીપોર્ટની તારીખે બોર્ડ ઓફ ડાયરેક્ટરોમાં નીચે મુજબના ફેરફાર કરવામાં આવેલ છે:-

શ્રી જાઈગામ અલી ખાન (ડીઆઈએન : ૦૭૬૫૫૭૬૦) એ બદલી થવાથી નિયામક પદમાંથી રાજીનામુ આપેલ છે. શ્રી ધર્મેશ નરહરીભાઈ બ્રહ્મભટુ (ડીઆઈએન : ૦૮૨૬૮૫૫૮) એ નિયામક પદમાંથી રાજીનામુ આપેલ છે અને તેમની જગ્યાએ મીસ કવીતા શેઠ (શાહ) (ડીઆઈએન : ૦૮૨૬૮૫૫૮) ને શ્રી નિયામક તરીકે જીઆઈડીસીના પ્રતિનિધી તરીકે નિમણુંક આપવામાં આવેલ છે.

મીસ કવીતા શેઠ (શાહ) (ડીઆઈએન : ૦૮૨૬૮૫૫૮) કે જેઓને વધારાના શ્રી નિયામક તરીકે હાલની સાલમાં નિમણુંક આપવામાં આવેલ છે તેઓ હવે નિયામક તરીકે થનાર વાર્ષિક સામાન્ય સભામા રહેતા નથી અને તેઓને કંપનીના કાયમી શ્રી નિયામક તરીકે નિમવામાં આવેલ છે.

૧૪. મેનેજેરીયલ રીમ્યુનરેશનાઃ-

આ કંપનીએ મેનેજેરીયલ રીમ્યુનરેશન બાબતે કંપનીઝ (એપોઈન્ટમેન્ટ એન્ડ રીમ્યુનરેશન ઓફ મેનેજેરીયલ પર્સનન્લ), નીયમ, ૨૦૧૪ ના નિયમ ૫ મુજબ ખુલાસો કરવાનો રહેતો નથી કારણ કે કંપની એક અનલીસ્ટેડ કંપની છે.

૧૫. રોટેશન મુજબ નિવૃત્ત થનાર નિયામકો:-

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૫૨(૬) મુજબ શ્રી બજરંગ વર્લી (ડીઆઈએન : ૦૭૧૩૩૮૪૨) અને શ્રી રાજ સ્વરૂપ કપુર (ડીઆઈએન : ૦૮૩૦૩૬૮૮) કંપનીના એજાએમ ખાતે રોટેશનથી નિવૃત્ત થવાના છે અને લાયકાત હોવાથી તેઓએ પોતાને ફરી - નિયુક્તી માટે પ્રસ્તુત કરેલ છે.

કંપનીને ફોર્મ ડીઆઈઆર - ૮ મુજબના ખુલાસા મળેલ છે જેમા દર્શાવેલ છે કે તેઓ કંપનીની વાર્ષિક સામાન્ય બેઠક દરમ્યાન ફરી નિયુક્ત માટે લાયકાત ધરાવે છે.

૧૬. ડીપોર્જીટાની વિગતો:-

રીવ્યુના હાલના સમયગાળા દરમ્યાન કંપનીએ પંબીક પાસેથી કોઈપણ પ્રકારની ડીપોર્જીટ મેળવેલ નથી અને તેથી કંપનીને કંપની (એકાઉન્ટ) નીયમો, ૨૦૧૪ લાગુ પડતુનથી.

૧૭. બોર્ડની બેઠક:-

બેઠકની નોટીસ તૈયાર કરવામાં આવેલ છે અને તે અગાઉથી ૪ નિયામકોને સેક્રેટરીયલ ધોરણો મુજબ પાઠવવામાં આવેલ છે. હાલના વર્ષ દરમ્યાન ચાર બોર્ડની બેઠકોનું આયોજન કરવામાં આવેલ છે અને તે ૦૮/૦૫/૨૦૧૯, ૧૫/૦૭/૨૦૧૯, ૧૪/૧૧/૨૦૧૯ અને ૦૫/૦૧/૨૦૨૦ ના રોજ યોજવામાં આવેલ છે.

૧૮. બોર્ડનું દ્વારા દિલ્હી એસેન્સીનું સંયુક્ત સાહસ દ્વારા આપેલ પત્રની જાહેરી અને પેટા કલમ (૩) લાશુ પડતો નથી.**૧૯. ઓડીટરોનું દ્વારા આપેલ પત્રની જાહેરી અને પેટા કલમ (૩) લાશુ પડતો નથી.**

કમ્પ્ટોલર ઓડીટર જનરલ ઓફ ઇન્ડીયા દ્વારા તેઓના પત્ર કુમાંક નં. સીએ.વી/સીઓવાય/ગુજરાત, બીઆરસીએલ(૧)/૨૦૨૦ તા. ૧૪/૦૮/૨૦૨૦ થી નાણાંકીય વર્ષ ૨૦૨૦ - ૨૦૨૧ માટે કંપનીના સ્ટેચુટરી ઓડીટર તરીકે મેસર્સ શાહ એન્ડ દલાલ (એફઆરએન : ૧૦૮૪૭૨૫૬૫), ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અમદાવાદનાઓની નિમણુંક કરેલ છે.

૨૦. ઓડીટરોનો અહેવાલ:-

ઓડીટરોના અહેવાલમાં કોઈ પણ પ્રકારની ખામીઓનો સમાવેશ કરવામાં આવેલ નથી. તેઓના અહેવાલના એકાઉન્ટ અને ઓડીટરના નોટ સ્વયંમ સ્પષ્ટ છે અને તે બાબતે વધુ કોઈ ટીપ્પણી આપવાની રહેતી નથી.

૨૧. કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૬) (બી) મુજબ કોમ્પ્ટોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડીયાની ટીપ્પણીઓ:-

કંપનીને પત્ર કુમાંક નં. એ.એમ.જી. ૧/એકાઉન્ટ/બીઆરસીએલ/૨૦૧૯-૨૦/ઓડબલ્યુ.૫૮ તારીખ ૪ થી સપ્ટેમ્બર, ૨૦૨૦ નો પત્ર કમ્પ્ટોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડીયા પાસેથી પ્રાપ્ત થયેલ છે અને તે કંપનીના ૩૧/૦૩/૨૦૨૦ અંતિતના ઓડીટેડ હિસાબો બાબતેનો છે અને તેમા જણાવેલ છે કે એવી કોઈ પણ બાબત ધ્યાન પર આવેલ નથી કે જેથી કરીને સી એન્ડ એજ્ઞ ના સ્ટેચુટરી ઓડીટર્સ રીપોર્ટ પર કોઈ ખાસ ટીપ્પણી કરવાની જરૂર રહેલ છે.

૨૨. વાર્ષિક રીટર્નની વિગતો:-

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૮૨(૩) અને કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમીનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૧૨ (૧) ના અનુસંધાને આ વાર્ષિક અહેવાલ સાથે વાર્ષિક રીટર્નના એક ભાગ રૂપે ફોર્મ - એમજાટી ૮ અનેક્ષર - ૨ તરીકે સામેલ રાખેલ છે.

૨૩. આતરિક ઓડીટ અને કન્ટ્રોલ:-

એમ/એસ ટક્કર ધવલ આર. એન્ડ એસોસીયેટ્સ ને નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે આંતરીક ઓડીટર તરીકે

નિયુક્ત કરવામાં આવેલ છે. કંપની દ્વારા આવનાર વર્ષો માટે આતંરીક ઓડિટરોના નિમણુંક માટે તેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે.

૨૪. કોર્પોરેટ સામાજુક જવાબદારી (સીઓસઆર):-

ચકાસણીના સમયગાળા દરમ્યાન કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૫ મુજબ કોર્પોરેટ સામાજુક જવાબદારીની કલમ કંપનીને લાગુ પડતુનથી.

૨૫. રીસ્ક મેનેજમેન્ટ પોલીસી:-

બીઆરસીએલ દ્વારા તેઓના ધંધાને લગત ખતરાઓને શોધી કાઢશે અને તેઓ એક રીસ્ક મેનેજમેન્ટ રૂપરેખાને લાગુ કરશે કે જેથી આવા ખતરાઓનો સામનો કરી શકે જેથી કે ધંધાના ઉદ્દેશ્યોને કોઈ જાતના અડજણ સીવાય પૂર્ણ કરી શકાય. બીઆરસીએલ દ્વારા આવા ખતરાઓને તેઓના એક્શનોશર નિયંત્રિત કરી અને ધંધાને થનાર નુકશાનને ઘટાડશે.

૨૬. ઉર્જનો બચાવ, ટેકનોલોજીની સ્વીકૃતિ અને વિદેશી નાણા પ્રાપ્ત કરવા ચૂકવવા સારા:-

કંપની દ્વારા એવી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી કે જે ઉર્જના બચાવ, ટેકનોલોજીની સ્વીકૃતી બાબતે ખુલાસો કરવાની જરૂરીયાત રહેલ છે કારણે કે તે ઉત્પાદન કરતી કંપની નથી. રીવ્યુના સમયગાળા દરમ્યાન કંપનીએ કોઈ પણ પ્રકારના વિદેશી નાણાં પ્રાપ્ત કરેલ નથી, કે ચૂકવેલ નથી.

૨૭. સમયગાળાના અંત અને અહેવાલની તારીખ દરમ્યાન થયેલ કોઈપણ પ્રકારના મટીરીયલ ફેરફારો કે કમીટમેન્ટ્સ કે જેથી નાણાકીય સ્થિતીમાં કોઈ ફેરફાર થઈ શકે:-

સમયગાળાના અંતે અને અહેવાલની તારીખ સુધીમાં ઉપર રીપોર્ટમાં જણાવ્યા સિવાય કોઈપણ પ્રકારના મટીરીયલ ફેરફાર થયેલ નથી કે જેથી કંપનીના નાણાંકીય સ્થિતીને કોઈ પણ પ્રકારની અસર થઈ શકે.

૨૮. કંપનીની હાલની પરિસ્થિતિ કે ભવિષ્યની કામગીરીને અસર કરે તેવા કોઈ મટીરીયલ હુકમો જો કોઈ રેઝ્યુલેટરો કે અદાલતો કે ટ્રીબ્યુનલો દ્વારા એવા કોઈ પણ ખાસ મટીરીયલ હુકમ પસાર કરવામાં આવેલ નથી કે જેથી કંપનીની હાલની પરિસ્થિતિ કે ભવિષ્યની કામગીરીઓ ઉપર કોઈપણ પ્રકારની અસર થઈ શકે.

કોઈપણ રેઝ્યુલેટરો કે અદાલતો કે ટ્રીબ્યુનલો દ્વારા એવા કોઈ પણ ખાસ મટીરીયલ હુકમ પસાર કરવામાં આવેલ નથી કે જેથી કંપનીની હાલની પરિસ્થિતિ કે ભવિષ્યની કામગીરીઓ ઉપર કોઈપણ પ્રકારની અસર થઈ શકે.

૨૯. દ સેક્શ્યુલ હેરેસમેન્ટ ઓફ વુમેન એટ વર્ક્પ્લેસ (પ્રીવેન્શન, પ્રોહિબીશન એન્ડ રીડ્રેસલ) એકટ, ૨૦૧૩ અન્વયે કંપનીની રહેલ જવાબદારીઓ:-

કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતીય સત્તામણી અટકાવવા માટે એક નવો કાયદો દ સેક્શ્યુલ હેરેસમેન્ટ ઓફ વુમેન એટ વર્ક્પ્લેસ (પ્રીવેન્શન, પ્રોહિબીશન એન્ડ રીડ્રેસલ) એકટ, ૨૦૧૩ તા.૮ મી રીસેમ્બર, ૨૦૧૩ ના રોજ પસાર કરવામાં આવેલ છે. આ કાયદા હેઠળ દરેક કંપનીએ એક આંતરીક ફરીયાદ સમિતીની રચના કરવી જરૂરી છે કે જે કોઈ પણ સ્ત્રી કર્મચારીદ્વારા તેઓ સાથે કામકાજના સ્થળે થયેલ જાતીય સત્તામણી બાબતેના ફરીયાદો કરી શકે.

કંપની દ્વારા ભવિષ્યમાં એવી નીતી અપનાવશે કે જેથી સીઓ સાથે નોકરીના સ્થળે જાતીય સત્તામણ ન થાય અને આ નીતી લાગુ કરવા માટે એક સમિતિની પણ રચના કરશે. આ રીવ્યુના સમયગાળા દરમ્યાન કંપનીને સત્તામણી બાબતે કોઈ પણ ફરિયાદ મળેલ નથી.

૩૦. લોન, ગેરેન્ટી અને રોકાણની વિગતો:-

હાલના રીવ્યુના સમયગાળામાં કંપનીએ કોઈ પણ પ્રકારની લોન આપેલ નથી કે કોઈ પણ પ્રકારના રોકાણો કે કોઈ લોન પર ગેરેન્ટી આપેલ નથી, કે જે કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૪ (૩) (જ) હેઠળ આવેલ છે અને તેથી કંપનીએ આ બાબતે કોઈપણ પ્રકારનો ખુલાસો કરવાનો રહેતો નથી.

૩૧. સંબંધીત પક્ષકારોને લગત કરારો અને વ્યવસ્થાની વિગતો:-

હાલના રીવ્યુના સમયગાળા દરમ્યાન કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૮૮(૧) અન્વયે કંપની દ્વારા સંબંધિત પક્ષકારો સાથે કરવામાં આવેલ રીવ્યુ, કરારો અને વ્યવસ્થાઓની વિગતો કંપનીના ઓડીટ થયેલ બેલેન્સ શીટમાં દર્શાવવામાં આવેલ છે.

૩૨. ઓડીટ સમિતિ:-

હાલના રીવ્યુના સમયગાળા દરમ્યાન કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૭૮ અને કંપનીઝ (મીટિંગ ઓફ બોર્ડ એન્ડ ઇટ્સ પાવર્સ) નિયમો, ૨૦૧૪ ના નિયમ (૬) હેઠળ ઓડીટ સમિતિના સંદર્ભે કોઈપણ બાબતો કંપનીને લાગુ પડતી નથી.

૩૩. નોમીનેશન અને રીમ્યુનરેશન સમિતિ:-

હાલના રીવ્યુના સમયગાળા દરમ્યાન કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૭૮ અને કંપનીઝ (મીટિંગ ઓફ બોર્ડ એન્ડ ઇટ્સ પાવર) નિયમો, ૨૦૧૪ ના નિયમ (૬) ના અનુસંધાને નોમીનેશન અને રીમ્યુનરેશન સમિતિને લગત બાબતો કંપનીને લાગુ પડતી નથી.

૩૪. નિયામકોની જવાબદારી બાબતેનો ખુલાસો:-

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૪ ના પેટા કલમ (૩) ના કલોઝ (સી) અન્વયેના નિયામકોની જવાબદારી બાબતેનો ખુલાસો નીચે મુજબ છે.

- (એ) વાર્ષિક હિસાબો તૈયાર કરવા બાબતે, લાગુ પડતા હિસાબી સીધ્યાન્તોનું પાલન કરવામાં આવેલ છે અને મટીરીયલ રીપાર્ચર બાબતે જરૂરી ખુલાસા પણ આપવામાં આવેલ છે.
- (બી) નિયામકોએ હિસાબી પોલીસીને પસંદ કરેલ છે અને તેને સત્તપણે લાગુ પણ કરેલ છે અને જરૂરી ચુકાદાઓ અને અદાજો પણ કરેલ છે કે જે યોગ્ય અને બરાબર છે કે જેથી કંપનીને લગત લાગુ પડતા સમયગાળાની ચોઘ્યી પરિસ્થિતી દર્શાવી શકાય અને કંપનીના નફાનુકશાન બાબતે પણ જરૂરી સમજણ પ્રામ કરી શકાય.
- (સી) નિયામકોએ હિસાબી રેકર્ડ જાળવતી વખતે ઉપર દર્શાવેશ ધારાના અનુસંધાને જરૂરી કાળજી અને સાવચેતી

રાહેલ છે કે જેથી કંપનીના હિતોને જાળવી શકાય અને કોઈપણ પ્રકારના ફોડ અને ગેરરીતીઓને દૂર કરી શકાય.

- (ઝ) કંપનીના નિયામકોએ વાર્ષિક હિસાબોને કંપની સતત કાર્યરત રહેશે તે મુજબ તૈયાર કરેલ છે.
- (ઝ) નિયામકોએ પ્રોપર સીસ્ટમ શોધી કાઢેલ છે કે જેથી લાગુ પડતા હાલના નિયમોને ધ્યાને રાખી શકાય અને સીસ્ટમ સારી રીતે અને કાર્યક્ષમ રીતે કામ કરે.

૩૫. સેકેટેરીયલ ઓડીટ અહેવાલ:-

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૨૦૪ કે જે સેકેટેરીયલ ઓડીટને લગતું છે તે કંપનીને લાગુ પડતું નથી. આથી કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૨૦૪ (૧) અને કંપનીઝ (એપોઇન્ટમેન્ટ એન્ડ રેમ્યુનરેશન ઓફ મેનેજેરીયલ પર્સનલ) નિયમ, ૨૦૧૪ ના નિયમ (૮) મુજબ કંપનીએ સેકેટેરીયલ ઓડીટ અહેવાલનું ફોર્મ નં. એમઆર - ઉ પ્રામ કરવું જરૂરી નથી.

૩૬. રકમોને એડયુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં ટ્રાન્સફર કરવા ભાબતા:-

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૨૪ અને ઈન્વેસ્ટર એડયુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ એથોરીટી (એકાઉન્ટીંગ, ઓડીટ, ટ્રાન્સફર એન્ડ રીફંડ) નિયમો, ૨૦૧૬ અન્વયે સાત વર્ષ કે તેથી વધારે સમયગાળા માટે ડિવીડન્ટની ફાળવણી માટે કંપનીના શેરો કલેમ થયા વગર કે ચૂકવણા થયા વગર બાકી રહેલ હોય તો તેને કંપની દ્વારા ભારત સરકારના ઈન્વેસ્ટર એડયુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (આઈઈપીએફ) માં ટ્રાન્સફર કરવું જરૂરી છે. આવા કોઈ પણ કિસ્સાઓ નથી કે જેમાં અમલીકરણ બાકી રહેલ છે.

૩૭. અકનોલેજેમન્ટ:-

કંપનીના નિયામકો રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ, કમ્પ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડીયાને અને સ્ટેચ્યુટરી ઓડીટરોને તેઓ ધારા આપવામાં આવેલ સહકાર બાબતે આભાર પ્રકટ કરે છે. કંપનીના નિયામકો ગુજરાત સરકાર, જીઆઈડીસી, એમએસઆઈએલ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓને તેઓ દ્વારા આપવામાં આવેલ સહકાર અને સતત ટેકા બદલ આભાર પ્રકટ કરે છે.

**બોર્ડ ઓફ ડાયેરેક્ટરોના વતી અને તેમના દ્વારા
બહુચરાજુ રેલ કોર્પોરેશન લિમિટેડ**

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૨૨/૦૮/૨૦૨૦

સહી/-
અધ્યાત્મિક રાજેન્ડ્રપ્રસાદ યાદવ
અધ્યક્ષ,
ડીઆઈએન : ૦૯૪૮૧૭૫૭

જોડાણ - ૧**પ્રિન્સીપલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડીટ) - ૨, ગુજરાત**

નં. એએમજી-૧ / એકાઉન્ટસ / બીઆરસીએલ / ૨૦૧૯-૨૦ / ૦ ડબલ્યુપૈલ / ૦૪.૦૮.૨૦૨૦

પ્રતિ,

મેનેજ્મેન્ટ ડિરેક્ટર,

બહુચરાજુ રેલ કોર્પોરેશન લીમીટેડ,

૭ મો માળ, બ્લોક નં. ૬, ઉદ્ઘોગ ભવન,

સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧.

વિષય:- કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૬) (બી) હેઠળ ૩૧ મી માર્ચ, ૨૦૨૦ અંતિતના બહુચરાજુ રેલ કોર્પોરેશન લીમીટેડના નાણાંકીય પત્રકો પર કમ્પ્ટોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડીયાની ટીયાણીઓ.

સાહેબશ્રી,

આ સાથે ૩૧ મી માર્ચ, ૨૦૨૦ અંતિત કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૬) (બી) હેઠળનું બહુચરાજુ રેલ કોર્પોરેશન લીમીટેડના નાણાંકીય પત્રકોને લગત ભારતના કમ્પ્ટોલર અને ઓડીટર જનરલની ટીયાણીઓ બાબતે નીલ કમેન્ટ પ્રમાણપત્ર કંપનીના વાર્ષિક સામાન્ય બેઠકમાં રજુઆત સારું સામેલ રાખેલ છે.

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૬) અન્વયે કંપની દ્વારા ભારતના કમ્પ્ટોલર અને ઓડીટર જનરલની ટીયાણીઓ દરેક વ્યક્તિઓને મોકલવી જરૂરી છે કે જેઓને કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૬ (૧) મુજબ ઓડીટ નાણાંકીય પત્રકો મોકલવામાં આવે છે, અને તેજ સમયે તે રીપોર્ટને કંપનીના સેટયુટરી ઓડીટર રોપોર્ટમા દર્શાવેલ હોય તેજ પ્રમાણે તેને કંપનીના વાર્ષિક સામાન્ય બેઠકમાં પણ પ્રસ્તુત કરવું જરૂરી છે. ભારતના કમ્પ્ટોલર અને ઓડીટર જનરલના અહેવાલને વાર્ષિક સામાન્ય બેઠકમાં રજુ કરતી તારીખ આ ઓફિસને અગાઉથી જાણ કરવી જરૂરી છે.

છાપેલા હિસાબોની છ નકલો ઓફિસમાં કામકાજ અને રેકોર્ડ માટે મોકલવી જરૂરી છે.

આ પત્ર અને તેના સલાન જોડાણો મળ્યા બાબતે જરૂરી રસીદ આપવા વિનંતી છે.

આપનો વિશ્વાસુ

સીનીયર ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ (એએમજી-૧)

બીડાણ:- ઉપર મુજબ

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૬) (બી) અન્વયે ૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત બહુયરાજુ રેલ કોર્પોરેશન લીમીટેડના નાણાંકીય પત્રકો અન્વયે ભારતના કંમ્પટ્રોલર અને એકાઉન્ટન્ટ જનરલની ટીઘણીઓ

કંપની ધારા, ૨૦૧૩ અન્વયે ૩૧ મી માર્ચ, ૨૦૨૦ અંતિત નાણાંકીય સિધ્ધાન્તો મુજબ બહુયરાજુ રેલ કોર્પોરેશન લીમીટેડના નાણાંકીય પત્રકો તૈયાર કરવાની જવાબદારી કંપનીના મેનેજમેન્ટની છે. ભારતના કોમ્પટ્રોલર અને ઓડીટર જનરલ દ્વારા નિયુક્ત કરેલ સ્ટેચ્યુરી ઓડીટરોએ તે ધારાની કલમ ૧૩૮ (૫) અને કલમ ૧૪૩ મુજબ આ નાણાંકીય પત્રકો પર તેઓનો સ્વતંત્ર અભિપ્રાય આપવો જરૂરી છે અને તેનો આધાર તે ધારાની કલમ ૧૪૩ (૧૦) માં દર્શાવેલ ઓડીટીગના સિધ્ધાન્તો મુજબ થવી જોઈએ. તેઓએ દ્વારા તેમ કરવામાં આવેલ છે તેવું તેઓના તારીખ ૪ જુલાઈ, ૨૦૨૦ થી સ્પષ્ટ કરેલ છે.

ભારતના કંમ્પટ્રોલર અને ઓડીટર જનરલ વતી બહુયરાજુ રેલ કોર્પોરેશન લિ. નું તા. ૩૧-૦૩-૨૦૨૦ના પૂરા થતા વર્ષના નાણાંકીય પત્રકોનું કંપની ધારા ૧૪૩(૬)(અ) અન્વયે સપ્લીમેન્ટ ઓડીટ કરેલ છે. આ સપ્લીમેન્ટરી ઓડીટ સ્ટેચ્યુટરી ઓડિટર્સના કરેલ કાર્યને ધ્યાને લીધા સિવાય સ્વતંત્ર રીતે કરેલ છે અને સ્ટેચ્યુટરી ઓડીટરીની તપાસ અને કંપનીના કર્મચારીઓના અને અમુક હિસાબ રોકડની ચકાસણી પર આધારિત છે.

અમારા ઓડીટ મુજબ કોઈ એવી બાબત માલુમ પડેલ નથી કે જેથી સ્ટેચ્યુટરી ઓડીટરના રીપોર્ટ પર કોઈ ટીઘણી કરી શકાય કે કોઈ સપ્લીમેન્ટ કરી શકાય.

તેમના દ્વારા અને તેમના વતી

ભારતના કંમ્પટ્રોલર અને ઓડીટર જનરલ

સહી/-

(અચ. કે. ધર્માંદશી)

પ્રિન્સીપલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડીટ - ૨), ગુજરાત

સ્થળ:- અમદાવાદ

તારીખ:-૦૪-૦૬-૨૦૨૦

જોડાણ - બ
ફોર્મ નં. એમજુટી ૬
વાર્ષિક વળતરની તારીખ
તા. ૩૧/૦૩/૨૦૨૦ ના રોજ પુરા થતા નાણાંકીય વર્ષની સ્થિતિએ
**કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૬૨ (૩) અને કંપની (મેનેજમેન્ટ એન્ડ એડમીનિસ્ટ્રેશન) નિયમો,
૨૦૧૪ ના નિયમ ૧૨ (૧) મુજબ**
૧. નોંધણી અને અન્ય વિગતો :

૧	સીઆઈએન	યુઝ્પ્રોજીઓફિલીસ્ટીન્સ્ટ્રીટ નાણાંકીય વર્ષ ૨૦૧૮
૨	નોંધણી તારીખ	૧૩/૧૨/૨૦૧૮
૩	કંપનીનું નામ	બહુચાળ રેલ કોર્પોરેશન લીમીટેડ
૪	કેટેગરી/સબ કેટેગરી કંપની	શેર દ્વારા લીમીટેડ / રાજ્ય સરકાર કંપની
૫	નોંધાયેલ કચેરીનું સરનામું અને સંપર્ક વિગત	બ્લોક નં. ૬, ૭મો માળ, ઉઘોગ ભવન, સેક્ટર - ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૧
૬	જો કંપની લીસ્ટેડ કરવામાં આવી હોય	ના
૭	રજીસ્ટર અને ટ્રાન્સફર એજન્ટનું નામ સરનામું અને સંપર્ક વિગત જો હોય તો	લાગુ પડતું નથી

૨. કંપનીની મુખ્ય વ્યવસાય પ્રવૃત્તિઓ :

(તેવી તમામ કંપનીની કામગીરીઓ કે જેની આવકમાં ૧૦% કે તેનાથી વધારે ભાગ ધરાવે છે તેને દર્શાવવું)

ક્રમ	મુખ્ય ઉત્પાદન / સેવાઓના નામ અને વર્ણન	મુખ્ય ઉત્પાદન / સેવાઓનો એન. આઈ.સી. કોડ	કંપનીના કુલ ટર્નારોવર સામે ટકાવારી
શૂન્ય			

૩. હોલિંગા, નિયંત્રિત અને સાથી કંપનીઓની વિગતો

ક્રમ	કંપનીનું નામ અને સરનામું	સીઆઈએન / જીએલએન	હોલિંગા / નિયંત્રીત / સાથી	ધારણકરેલ શેરની ટકાવારી	લાગુ વિભાગ
૧.	ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લી.	યુઝ્પ્રોજીઓફિલીસ્ટીન્સ્ટ્રીટ નાણાંકીય વર્ષ ૨૦૧૮	સહયોગી	૪૧.૦૦	૨(૬)
૨.	ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન	લાગુ પડતું નથી	સહયોગી	૨૬.૦૦	૨(૬)
૩.	મારુતી સુજુકી ઈન્ડિયા લી.	એલઉઠીનીએલીન્સ્ટ્રીટ પીએલસીન્સ્ટ્રીટ	સહયોગી	૩૩.૦૦	૨(૬)

૪. શેર હોલ્ડિંગ પેટર્ન (ઈકવીટી શેરોનું વિભાજન કુલ ઈકવીટીની ટકાવારી અનુસાર)
૫. કેટેગરી પ્રમાણે શેરહોલ્ડિંગ્સ

શેર હોલ્ડરનો પ્રકાર	વર્ષની શરૂઆતમાં ધારણ કરેલ શેરોની સંખ્યા (૧ ઓપ્રિલ, ૨૦૧૯ મુજબ)				વર્ષના અંતે ધારણ કરેલ શેરોની સંખ્યા (૩૧મી માર્ચ, ૨૦૨૦ મુજબ)				વર્ષ દરમિયાન ટકાવારીમાં ફેરફાર
	ડીમેટ	લોટિક	કુલ	કુલ શેરની ટકાવારી	ડીમેટ	લોટિક	કુલ	કુલ શેરની ટકાવારી	
ક. પ્રમોટરો									
(૧) ભારતીય									
ક) વ્યક્તિગત / ડિ.એ.ફ્.	-	-	-	-	-	-	-	-	-
ખ) કેન્દ્ર સરકાર	-	-	-	-	-	-	-	-	-
ગ) રાજ્ય સરકાર	-	-	-	-	-	-	-	-	-
ધ) નિગમિત સંસ્થા	-	-	-	-	-	-	-	-	-
ય) બેંક/ના.સ.	-	-	-	-	-	-	-	-	-
છ) અન્ય કોઈ સંસ્થા	-	૧૦,૦૦,૦૦૦	૧૦,૦૦,૦૦૦	૧૦૦	-	૧૦,૦૦,૦૦૦	૧૦,૦૦,૦૦૦	૧૦૦	-
સબ ટોટલ (અ) (૧)	-	-	-	-	-	-	-	-	-
(૨) વિદેશી	-	-	-	-	-	-	-	-	-
ક) એન.આર.આઈ / વ્યક્તિગત	-	-	-	-	-	-	-	-	-
ખ) અન્ય વ્યક્તિગત	-	-	-	-	-	-	-	-	-
ગ) નિગમિત સંસ્થા	-	-	-	-	-	-	-	-	-
ધ) બેંક/ના.સ.	-	-	-	-	-	-	-	-	-
ય) અન્ય કોઈ	-	-	-	-	-	-	-	-	-
સબ ટોટલ (અ) (૨)	-	-	-	-	-	-	-	-	-
(૨) પ્રમોટોનું કુલ શેરહોલ્ડિંગા									
અ = (અ) (૧) + (અ) (૨)	-	-	-	-	-	-	-	-	-
ખ. જાહેર શેરહોલ્ડિંગા									
૧) સંસ્થાઓ	-	-	-	-	-	-	-	-	-
ક) મુખ્યાલ ફંડ	-	-	-	-	-	-	-	-	-
ખ) બેંક/ના.સ.	-	-	-	-	-	-	-	-	-
ગ) કેન્દ્ર સરકાર	-	-	-	-	-	-	-	-	-
ધ) રાજ્ય સરકાર	-	-	-	-	-	-	-	-	-
ય) સાહસ મૂરી ભંડોળ	-	-	-	-	-	-	-	-	-
છ) વિમાન કંપનીઓ	-	-	-	-	-	-	-	-	-
જ) એફઆઈઆઈ	-	-	-	-	-	-	-	-	-
ઝ) વિદેશી સાહસ મૂરી ભંડોળ	-	-	-	-	-	-	-	-	-
૨) અન્ય (નિર્દિષ્ટ કરો)	-	-	-	-	-	-	-	-	-
સબ ટોટલ (ખ)(૧)	-	-	-	-	-	-	-	-	-
૨. નિન સંસ્થા									
ક) નિગમિત સંસ્થા	-	-	-	-	-	-	-	-	-
૧) ભારતીય	-	-	-	-	-	-	-	-	-
૨) દીર્ઘા પાર	-	-	-	-	-	-	-	-	-
૩) વ્યક્તિત્વો	-	-	-	-	-	-	-	-	-
૧) રૂ. ૧ લાખની અંકિત શેરમૂરી ધારણ કરનાર વ્યક્તિગત શેર હોલ્ડરો	-	-	-	-	-	-	-	-	-
૨) રૂ. ૧ લાખથી વધુ અંકિત શેરમૂરી ધારણ કરનાર વ્યક્તિગત શેર હોલ્ડરો	-	-	-	-	-	-	-	-	-
૩) અન્ય (નિર્દિષ્ટ કરો)	-	-	-	-	-	-	-	-	-
સબ ટોટલ (ખ)(૨)	-	-	-	-	-	-	-	-	-
કુલ જાહેર શેર હોલ્ડિંગ (ખ)=(ખ)(૧) + (ખ)(૨)	-	-	-	-	-	-	-	-	-
ગ. જુડીઆરથેસ અને એડીઆરથેસ કસ્ટોડિયને ધારણ કરેલા શેર એકંદર કુલ	-	-	-	-	-	-	-	-	-
એકંદર કુલ (ક+ખ+ગ)	-	૧૦,૦૦,૦૦૦	૧૦,૦૦,૦૦૦	૧૦૦	-	૧૦,૦૦,૦૦૦	૧૦,૦૦,૦૦૦	૧૦૦	-

ખ. પ્રમોટરોનું શેર હોલિંગા

ક્રમ	શેર હોલડરનું નામ	વર્ષની શરૂઆતમાં શેર હોલીંગા તા. ૦૧-૦૪-૨૦૧૯ ના રોજ મુજબ			વર્ષની અંતે શેર હોલિંગા તા. ૩૧-૩-૨૦૨૦ ના રોજ મુજબ			વર્ષ દરમિયાન હોલિંગમાં ટકાવારી ફેરફાર
		શેરની સંખ્યા	કંપનીના કુલ શેરની ટકાવારી	કુલ શેર સામે ગીરો મુકેલા/ બોજો કરેલા શેરની ટકાવારી	શેરની સંખ્યા	કંપનીના કુલ શેરની ટકાવારી	કુલ શેર સામે ગીરો મુકેલા/ બોજો કરેલા શેરની ટકાવારી	
૧	શ્રી અંધ્રનીકુમાર રાજેન્દ્રપ્રસાદ યાદવ (આઈ.આ.એસ.) ગુજરાત રેલ ઈન્ઝાસ્ટ્રીક્યુર વિકાસ નિગમ લિ. (જી-રાઈડ) વતી	૪,૦૮,૮૮૮	૪૧.૦૦	-	૪,૦૮,૮૮૮	૪૧.૦૦	-	-
૨	શ્રી તેંગમ અલી ખાન (આઈ.આર.આ.એસ.) ગુજરાત રેલ ઈન્ઝાસ્ટ્રીક્યુર વિકાસ નિગમ લિ. (જી-રાઈડ) ના નામાંકિત	૧	૦૦.૦૦	-	૧	૦૦.૦૦	-	-
૩	શ્રી સંતોષકુમાર (આઈ.આર.આ.એસ.ઈ.) ગુજરાત રેલ ઈન્ઝાસ્ટ્રીક્યુર વિકાસ નિગમ લિ. (જી-રાઈડ) ના નામાંકિત	૧	૦૦.૦૦	-	૧	૦૦.૦૦	-	-
૪	શ્રી બજરંગ છગનભાઈ વલી ગુજરાત ઔદ્યોગીક વિકાસ નિગમ લિ. (જીઆઈડીસી) વતી	૨,૫૮,૮૮૮	૨૬.૦૦	-	૨,૫૮,૮૮૮	૨૬.૦૦	-	-
૫	શ્રી ધર્મેશ નરહરીભાઈબ્રહ્મભં ગુજરાત ઔદ્યોગીક વિકાસ નિગમ લિ. (જીઆઈડીસી) ના નામાંકિત	૧	૦૦.૦૦	-	૧	૦૦.૦૦	-	-
૬	શ્રી સંજીવ ઓવર મારૂતિ સુજુકી ઈન્ડિયા લી વતી	૩,૨૮,૮૮૮	૩૩.૦૦	-	૩,૨૮,૮૮૮	૩૩.૦૦	-	-
૭	શ્રી રાજ સ્વરૂપ કપુર મારૂતિ સુજુકી ઈન્ડિયા લી ના નામાંકિત	૧	૦૦.૦૦	-	૧	૦૦.૦૦	-	-
	કુલ	૧૦,૦૦,૦૦૦	૧૦૦.૦૦	-	૧૦,૦૦,૦૦૦	૧૦૦.૦૦	-	-

ગ. પ્રમોટ્રોના શેર ધારણામાં ફેરફારો (જો ફેરફાર હોય તો જણાવો) - કોઈ ફેરફાર નથી

ક્રમ	વિગત	વર્ષની શરૂઆતમાં શેર હોલ્ડિંગ તા. ૦૧-૦૪-૨૦૧૯ ના રોજ		વર્ષ દરમિયાન સંચિત શેર હોલ્ડિંગ	
		શેરની સંખ્યા	કંપનીના કુલ શેરની ટકાવારી	શેરની સંખ્યા	કંપનીના કુલ શેરની ટકાવારી
	વર્ષની શરૂઆતમાં	-	-	-	-
	કોઈ ફેરફાર નહિ	-	-	-	-
	વર્ષના અંતમાં	-	-	-	-

ઘ. પ્રથમ ૧૦ શેર ધારકોના શેરહોલ્ડિંગનું પેટર્ન (નિયામક), પ્રમોટર તથા જી.ડી.આર અને એ.ડી.આરના હોલ્ડરો સિવાય):- લાગુ પડતું નથી

ક્રમ	દરેક પ્રકારના ટોપ દસ શેર હોલ્ડર	વર્ષની શરૂઆતમાં શેર હોલ્ડિંગ તા. ૦૧-૦૪-૨૦૧૯ ના રોજ		વર્ષ દરમિયાન સંચિત શેર હોલ્ડિંગ	
		શેરની સંખ્યા	કંપનીના કુલ શેરની ટકાવારી	શેરની સંખ્યા	કંપનીના કુલ શેરની ટકાવારી
	વર્ષની શરૂઆતમાં	-	-	-	-
	કોઈ ફેરફાર નહિ	-	-	-	-
	વર્ષના અંતમાં	-	-	-	-

ચ. નિયામકો અને મહત્વના વ્યવસ્થાકીય કર્મચારીઓનું શેર હોલ્ડીંગાઃ-

ક્રમ	વિગત	વર્ષની શરૂઆતમાં શેર હોલ્ડીંગ તા. ૦૧-૦૪-૨૦૧૯ ના રોજ		વર્ષ દરમિયાન સંચિત શેર હોલ્ડીંગ	
		શેરની સંખ્યા	કંપનીના કુલ શેરની ટકાવારી	શેરની સંખ્યા	કંપનીના કુલ શેરની ટકાવારી
૧	શ્રી અશ્વિનીકુમાર રાજેન્ડ્રપ્રસાદ યાદવ (આઈ.એ.એસ.) ગુજરાત રેલ ઈન્ફાસ્ટ્રક્ચર વિકાસ નિગમ લિ. (જી.ર્એડ) વતી				
	વર્ષની શરૂઆતમાં	૪,૦૮,૬૬૮	૪૧.૦૦	-	-
	કોઈ ફેરફાર નહિ	-	-	-	-
	વર્ષના અંતમાં	૪,૦૮,૬૬૮	૪૧.૦૦	૪,૦૮,૬૬૮	૪૧.૦૦
૨	શ્રી બજરંગ છગનભાઈ વર્લી ગુજરાત ઓફોઝીક વિકાસ નિગમ લિ. (જી.આઈ.ડી.સી.) વતી				
	વર્ષની શરૂઆતમાં	૨,૫૮,૬૬૮	૨૬.૦૦	-	-
	કોઈ ફેરફાર નહિ	-	-	-	-
	વર્ષના અંતમાં	૨,૫૮,૬૬૮	૨૬.૦૦	૨,૫૮,૬૬૮	૨૬.૦૦
૩	શ્રી સંતોષકુમાર (આઈ.આર.એસ.ઈ.) ગુજરાત રેલ ઈન્ફાસ્ટ્રક્ચર વિકાસ નિગમ લિ. (જી.ર્એડ) ના નામાંકિત				
	વર્ષની શરૂઆતમાં	૧	૦.૦૦	-	-
	કોઈ ફેરફાર નહિ	-	-	-	-
	વર્ષના અંતમાં	૧	૦.૦૦	૧	૦.૦૦
૪	શ્રી ધર્મેશ નરહરીલાઈ ઘ્રણભાઈ ગુજરાત ઓફોઝીક વિકાસ નિગમ લિ. (જી.આઈ.ડી.સી.) ના નામાંકિત				
	વર્ષની શરૂઆતમાં	૧	૦.૦૦	-	-
	કોઈ ફેરફાર નહિ	-	-	-	-
	વર્ષના અંતમાં	૧	૦.૦૦	૧	૦.૦૦
૫	શ્રી બચ્યુ વેનુગોપાલ				
	વર્ષની શરૂઆતમાં	-	-	-	-
	કોઈ ફેરફાર નહિ	-	-	-	-

	વર્ષના અંતમાં	-	-	-	-
૬	શ્રી રાજ સ્થાપક કપુર મારતિ સુશુકિ ઇન્ડિયા લી. ના નામાંકિત				
	વર્ષની શરૂઆતમાં	૧	૦.૦૦	-	-
	કોઈ ફેરફાર નહિ	-	-	-	-
	વર્ષના અંતમાં	૧	૦.૦૦	૧	૦.૦૦
૭	શ્રીમતી કવિતા રાહેશકુમાર શાહ ગુજરાત ઓદ્યોગીક વિકાસ નિગમ લિ. (જુઆઈડીસી) ના નામાંકિત				
	વર્ષની શરૂઆતમાં	-	-	-	-
	કોઈ ફેરફાર નહિ	-	-	-	-
	વર્ષના અંતમાં	-	-	-	-

૭. દેવાદારી - વ્યાજ બાકી/ ઉપાજીત થયેલ પરંતુ ચૂકવણી માટે પાત્ર ન થયું હોય.

નાણાંકીય વર્ષની શરૂઆતમાં દેવાદારી	થાપણો સિવાય તારણ વાળી લોન	તારણ વિનાની લોન	થાપણો	કુલ દેવાદારી
ક) મુદ્દલ રકમ	<input type="radio"/>	<input type="radio"/>	<input type="radio"/>	<input type="radio"/>
ખ) વ્યાજ લેણું થયું પરંતુ ચૂકવ્યું નહીં	<input type="radio"/>	<input type="radio"/>	<input type="radio"/>	<input type="radio"/>
ગ) વ્યાજ ઉપાજીત થયું પરંતુ ચૂકવણી પાત્ર ન થયું.	<input type="radio"/>	<input type="radio"/>	<input type="radio"/>	<input type="radio"/>
કુલ ક+ખ+ગ	<input type="radio"/>	<input type="radio"/>	<input type="radio"/>	<input type="radio"/>
નાણાંકીય વર્ષ દરમિયાન દેવાદારીમાં ફેરફાર				
- ઉમેરો	<input type="radio"/>	૧૪,૩૬,૮૬,૫૬૭	<input type="radio"/>	૧૪,૩૬,૮૬,૫૬૭
- ઘટાડો	<input type="radio"/>	<input type="radio"/>	<input type="radio"/>	<input type="radio"/>
ચોખ્ખો ફેરફાર	<input type="radio"/>	૧૪,૩૬,૮૬,૫૬૭	<input type="radio"/>	૧૪,૩૬,૮૬,૫૬૭
નાણાંકીય વર્ષના અંતે દેવાદારીમાં ફેરફાર				
ક) મુદ્દલ રકમ	<input type="radio"/>	૧૪,૩૧,૨૭,,૮૫૫	<input type="radio"/>	૧૪,૩૧,૨૭,,૮૫૫
ખ) વ્યાજ લેણું થયું પરંતુ ચૂકવ્યું નહીં	<input type="radio"/>	૫,૫૮,૭૧૨	<input type="radio"/>	૫,૫૮,૭૧૨
ગ) વ્યાજ ઉપાજીત થયું પરંતુ ચૂકવણી પાત્ર ન થયું.	<input type="radio"/>	<input type="radio"/>	<input type="radio"/>	<input type="radio"/>
કુલ ક+ખ+ગ	<input type="radio"/>	૧૪,૩૬૮૬,૫૬૭	<input type="radio"/>	૧૪,૩૬૮૬,૫૬૭

જ. નિયામકો અને મહત્વના વ્યવસ્થાકીય કર્મચારીઓનું મહેનતાનુઃ

- એ) મેનેજુગ ડીરેક્ટર, પૂર્ણ સમયના ડીરેક્ટર કે મેનેજરના મહેનતાણાઃ- લાગુ પડતું નથી.
- બી) અન્ય નિયામકો પગારઃ- લાગુ પડતું નથી.
- સી) એમડી / મેનેજર / ડબલ્યુટીડી સિવાયના અન્ય ખાસ મેનેજેરીયલ પર્સનલોનો પગારઃ- લાગુ પડતું નથી.

ગ. દંડ / સજા / અન્ય ગુણ્ણાઓને લગતઃ- લાગુ પડતું નથી.

બોર્ડ ઓફ ડીરેક્ટરોના વતી અને તેમના દ્વારા
બહુચરાજુ રેલ કોર્પોરેશન લિમિટેડ

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૨૨/૦૬/૨૦૨૦

સહી/-

અશ્વિનીકુમાર રાજેન્દ્રપ્રસાદ યાદવ
ચેરમેન

ડિઝાઇન નંબર : ૦૬૫૮૧૭૫૩

**શાહ એન્ડ દલાલ
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ**

ઓડીટરોનો સ્વતંત્ર અહેવાલ

બહુચરાજુ રેલ કોર્પોરેશન લીમીટેડના

સભ્યોને

નાણાંકીય પત્રકો પર અહેવાલ

અભિપ્રાય:-

અમોએ ઉ૧ મી માર્ચ, ૨૦૨૦ અંતિત બહુચરાજુ રેલ કોર્પોરેશન લીમીટેડના (કંપનીના) બેલેન્શ શીટની ચકાસણી કરેલ છે અને તેમાં વર્ષ અંતિત નફા અને નુકશાનના પત્રકો, વર્ષ અંતીત કેશ ફલોના પત્રકો, વર્ષ અંતિત ઈક્વીટીમાં ફેરફારના પત્રકો અને નાણાંકિય પત્રકોના નોંધોનો સમાવેશ થાય છે અને તે ઉપરાંત તેમાં અગત્યના હિસાબી પદ્ધતિઓ અને અન્ય સમજણોનો સમાવેશ થાય છે.

અમારા મત અનુસાર અને અમને આપવામાં આવેલ માહિતી અનુસાર ઉપર જણાવેલ નાણાંકીય પત્રકો ધારાના જરૂરી કલમો અનુસારની માહિતી આપે છે અને તે એક સાચો અને ખરો ચિત્ર દર્શાવે છે કે જે ભારતમાં ચાલતા હિસાબી પદ્ધતિઓ અનુસાર છે અને તેમાં ઈન્ડીયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનું સમાવેશ થાય છે અને ઉ૧ મી માર્ચ, ૨૦૨૦ અંતિત કંપનીની સ્થિતી દર્શાવે છે અને કંપનીની નાણાંકિય કામગીરી અને કેશ ફલો અને વર્ષના અંતે રહેલ ઈક્વીટીમાં ફેરફાર દર્શાવે છે.

અભિપ્રાય:-

કંપની ધારા, ૨૦૧ ઉ ની કલમ ૧૪૩ (૧૦) માં દર્શાવેલ ઓડીટીગની પદ્ધતિ (એસએ) મુજબ અમોએ ઓડીટ કરેલ છે. તે પદ્ધતિ અનુસારની અમારી જવાબદારીઓને અમારા રીપોર્ટમાં દર્શાવેલ ઓડીટના નાણાંકીય પત્રકોમાં ઓડીટરની જવાબદારીઓમાં વધુ સારી રીતે દર્શાવેલ છે. અમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડીયાના કોડ ઓફ એથીક્સમાં દર્શાવ્યા મુજબ કંપનીથી સ્વતંત્ર છીએ અને અમારા એથીક્લ જવાબદારીઓ અનુસાર કે જે અમારા દ્વારા કરવામાં આવેલ નાણાંકીય પત્રકોના ઓડીટ ને લગત છે તેનું પાલન અમોએ કંપની ધારા, ૨૦૧ ઉ મુજબ કરેલ છે અને તેના નીયમોનું પાલન કરેલ છે અને કોડ ઓફ એથીક્સ મુજબની તમામ એથીક્લ જવાબદારીઓ પૂર્ણ કરેલ છે. અમો માનીયે છીએ કે જે ઓડીટને લગત પૂરાવાઓ અમોને પ્રામ થયેલ છે તે અમારા સ્ટેન્ડએલોન નાણાંકીય પત્રકોને લગત અમારા દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય માટે બરોખર છે.

સ્ટેન્ડ એલોન નાણાંકીય પત્રકો માટે મેનેજમેન્ટની જવાબદારીઓ:-

કંપની ધારા, ૨૦૧૩ (ધારા) ની કલમ ૧૩૪ (૫) માં દર્શાવેલ બાબતેની જવાબદારી કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરોની છે કે તે તૈયાર કરવામાં આવેલ નાણાંકીય પત્રકો કે જે નાણાંકીય સ્થિતી, નાણાંકીય કામગીરી અને કંપનીના કેશ ફ્લોનો સાચો ચિત્ર દર્શાવે છે તે ભારતમાં ચાલતા હિસાબી સિધ્યાંતોને અનુરૂપ હોવો જોઈએ અને તેમાં ભારતીય હિસાબી પદ્ધતિ (ઈન્ડ એએસ) કે જે તે ધારાની કલમ ૧૩૩, કે જે નીયમ ૭ મુજબ હોવી જોઈએ કે જે કંપની (એકાઉન્ટ્સ) નિયમો, ૨૦૧૪ માં દર્શાવેલ છે.

જવાબદારીઓમાં જરૂરી હિસાબો રેકૉર્ડની જાળવણી કે જે ધારાના પ્રાવધાન મુજબ હોવી જોઈએ કે જેથી કંપનીના મીલકતોની સુરક્ષા જાળવાઈ રહે અને ગેરરીતી અને છેતરપીનીને અટકાવી શકાય, જરૂરી હિસાબી પદ્ધતિઓનું અમલીકરણ કરી શકાય, તેવા નિર્ણયો કરી શકાય કે જે વ્યાજબી અને બરોબર હોય અને જરૂરી આંતરિક નાણાંકીય નિયંત્રણો લાગુ કરી શકાય તે માટે જરૂરી વ્યવસ્થા તૈયાર કરી તેનું અમલીકરણ કરી શકાય અને નાણાંકીય રેકર્ડોની ચોક્સાઈ અને પૂર્ણતા પણ જાળવી શકાય અને સાચા અને ખરા નાણાંકીય ચિત્રની પ્રાપ્તી માટે નાણાંકીય પત્રકો તૈયાર કરી શકાય જેથી ભુલ કે છેતરપીનીથી ખોટા પત્રકો તૈયાર કરવામાં ન આવે.

નાણાંકીય પત્રકો તૈયાર કરતા સમયે, તે મેનેજમેન્ટની જવાબદારી છે કે તે કંપનીના કામગીરીની ક્ષમતાની ચકાસણી કરે અને કંપનીને ચાલુ રાખવા માટે લગતા મુદ્દાઓનો અભ્યાસ કરે જે મેનેજમેન્ટ કંપનીને લીક્વીડેટ કરવાન માંગતી હોય તો તેની કામગીરીઓ બંધ કરવાન માંગતી હોય તો કંપનીને ચાલુ રાખવા માટે લગત હિસાબી બાબતોને સ્પષ્ટપણે દર્શાવવી જરૂરી છે.

કંપનીના નાણાંકીય પ્રગતિની વિગતોની ચકાસવાની જવાબદારીઓ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરોની રહેલ છે.

નાણાંકીય પત્રકોના ઓડીટ બાબતે ઓડીટરની જવાબદારી:-

અમારો ઉદ્દેશ્ય એ છે કે તે બાબતે ખાતરી કરવી કે નાણાંકીય પત્રકોમાં ઉચાપત કે ભૂલને કારણે કોઈ ખોટી મુખ્ય રજૂઆતથી મુક્ત છે કે કેમ. વ્યાજબી ખામીપણું એક ઉચ્ચ સ્તરની ખાત્રી છે, પરંતુ તે એ બાબતની ગેરેન્ટી નથી કે એસએ મુજબ કરવામાં આવેલ ઓડીટ હુંમેશા રહેલ મટીરીયલ ગેરરીતીને હુંમેશા ઓળખી બતાવે. ખોટી રજૂઆતો અને ઉચાપત કે ભૂલ જો કોઈ થયેલ હોય તો તેને ધ્યાને લીધેલ છે અને વ્યક્તિગત રીતે કે એગ્રીગેટમાં નાણાંકીય સ્ટેટમેન્ટ ઉપર યુઝર દ્વારા લેવામાં આવેલ નાણાંકીય નિર્ણયો પરની અસરને પણ ધ્યાને લીધેલ છે.

એસએ મુજબના ઓડીટના ભાગરૂપે, અમોએ પ્રોફેશનલ જજમેન્ટ રાખેલ છે અને ઓડીટમાં પ્રોફેશનલ સ્કેપ્ટીસમ પણ રાખેલ છે. ઉપરાંત અમોએ:-

- નાણાંકીય પત્રકોમાં રહેલ મટીરીયલ મીસસ્ટેટમેન્ટને ઓળખી તેની ચકાસણી કરેલ છે કે જે કોઈ પણ ગેરરીતી કે ભૂલ, ડીજાઈનને કારણે થયેલ હોય અને ખતરાઓને લગત ઓડીટ પદ્ધતિઓનું પાલન કરેલ છે અને અમારા અભિપ્રાય આપવા માટે જરૂરી ઓડીટ પૂરવાઓ પ્રાપ્ત કરેલ છે.

- આંતરિક નિયંત્રણને લગતી બાબતોની સમજણ પ્રામ કરેલ છે કે જેની મદદથી પરીસ્થિતી અનુસાર ઓડીટ પધ્યતિઓ તૈયાર કરી શકાય. કંપની ધારા, ૨૦૧૭ ની કલમ ૧૪૩(૩)(૧) મુજબ અમારા જવાબદારી છે કે અમો તેવો અભિપ્રાય આપીએ કે શું કંપની પાસે જરૂરી આંતરીક નાણાંકીય નિયંત્રણ વ્યવસ્થા રહેલ છે અને તેની કામગીરી આવી વ્યવસ્થાને અનુરૂપ છે.
- ઉપયોગ લેવામાં આવેલ હિસાબી પધ્યતિઓના વ્યાજબીપણાને ચકાસવી અને હિસાબ અંદાજોની યોગ્યતા ચકાસવી અને મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલ ખૂલાસાની ચકાસણી કરવી.
- ગોઈંગ કન્સર્નના આધારે મેનેજમેન્ટના દ્વારા કરવામા આવેલ તેના ઉપયોગને ચકાસવી અને ઓડીટના પૂરવાના આધારે ઈવેન્ટ અને કંન્ડીશનોને લગત મટીરીયલ અનીશ્વિતા રહેલ છે કે કેમ તે ચકાસવી કે જે કંપનીના ચાલુ રહેવાની ક્ષમતા પર અસર કરી શકે. જો અમોને તેમ જણાઈ આવે કે મટીરીયલ અનીશ્વિતા રહેલ છે તો નાણાંકીય પત્રકોના અમારા ઓડીટ રીપોર્ટમાં અમારે તે બાબતે ધ્યાન દોરવાની રહે અને જો આવા ખૂલાસાઓ બરોબર ન હોય તો અમારા અભિપ્રાયમાં પરીવર્તન લાવવું. અમારા તારણો ઓડીટ કરેલ તારીખ સુધી ઓડિટ એવિડન્સના આધારે છે. છતાં ભવિષ્યની એવી ઘટના અને પરિસ્થિતિના આધારે કંપનીની ચાલુ રહેવાની શક્યતા ઉપર ખતરો ઉભો થાય.
- અમોએ નાણાંકીય પત્રકોને લગત તમામ પ્રેઝેન્ટેશન, સ્ટ્રક્ચર અને વિગતોને ચકાસેલ છે અને તેમા ખૂલાસાઓને સમાવેશ થાય છે કે જેમાં નાણાંકીય પત્રકો લેવડ ડેવડો દર્શાવતી હોય અને એક સાચો પ્રેઝેન્ટેશન દર્શાવે છે.
- અમોએ ધારાની કલમ ૧૪૩ (૧૦) માં દર્શાવેલ ઓડીટીગની પધ્યતિઓ અનુસાર ઓડીટ કરેલ છે. આ પધ્યતિઓ મુજબ અમારે એથીકલ જરૂરીયાતોનું પાલન કરવું જોઈએ અને પાલન કરી ઓડીટ કરવી જોઈએ કે જેથી તેવી સામાન્ય ચોકસાઈ પ્રામ થાય કે નાણાંકીય પત્રકોમાં કોઈ મટીરીયલ મીસસ્ટેટમેન્ટ રહેલ નથી.

વહીવટ કરનાર વ્યક્તિઓનો અમોએ સંપર્ક કરેલ છે અને તેમની પાસે અન્ય બાબતો ઉપરાંત ઓડીટમાં પ્રામ થયેલ વિગતો બાબતે ચર્ચા કરેલ છે અને તેમાં આંતરીક નિયંત્રણમાં રહેલ ખામીઓ કે જે અમારા ઓડીટમાં જણાઈ આવેલ છે તેની પણ ચર્ચા કરેલ છે.

તેના ઉપરાંત વહીવટમાં રહેલ વ્યક્તિઓને અમોએ એવો પત્રક આપેલ છે કે અમોએ અમારી એથીકલ જરૂરીયાતો કે જે સ્વતંત્રતાને લગત છે તેનું પાલન કરેલ છે અને તેઓને તમામ સંબંધો બાબતે અને અન્ય બાબતે માહિતી આપેલ છે કે જે અમારા ઓડીટની સ્વતંત્રતાને લગત અને તેના સેફગાર્ડને લગત છે.

વહીવટમાં રહેલ વ્યક્તિઓને આપેલ બાબતોમાં અમોએ નાણાંકીય પત્રકોને લગત સૌથી વધારે અગત્યની બાબતો નક્કી કરેલ છે કે જે હાલના સમયગાળાને લગત છે અને ખાસ ઓડીટ બાબતોને લગત છે. અમારા ઓડીટ રીપોર્ટમાં તમામ બાબતો દર્શાવેલ છે સીવાય કે પદ્ધતીક ડીસકલોશરને લગત બાબતો કે જે રોજબરોજની ન હોય અને અમારા દ્વારા કઈ બાબતો રીપોર્ટમાં દર્શાવવાની છે તે નક્કી કરવામાં આવેલ છે કારણે કે જો તેમન કરવામા આવે તેના વિપરીત પરીણામો આવી શકે અને

તેના કારણે પબ્લિક ઈન્ટરેસ્ટ પર ખોટી અસર થઈ શકે.

અન્ય કાયદાકીય અને રેગ્યુલેટરી જરૂરીયાતો પરનો અહેવાલ:-

૧. કંપનીની (ઓડીટર અહેવાલ) ઓડર, ૨૦૧૯ (ધી ઓડર) મુજબની કંપનીની જરૂરીયાતો કે જે ભારત સરકાર દ્વારા ધારાની કલમ ૧૪૩ ની પેટા કલમ (૧૧) મુજબ છે તેના અનુસંધાને અમો એનેક્ષર - એ આપીયે છીએ કે જે ઓડર મુજબ એક સ્ટેટમેન્ટ છે અને તે ફકરા ઉઅને ૪ માં દર્શાવેલ છે.
૨. ધારાની કલમ ૧૪૩ (૫) મુજબ અમો અમારો અહેવાલ રજૂ કરીએ છીએ, અને તેનો આધાર કંપનીના ચોપડા અને રેકર્ડની ચકાસણી છે જે અમોએ જરૂરી સમજેલ છે અને તે અમોને આપવામાં આવેલ માહિતી અને સમજણ મુજબ છે જે એનેક્ષર - બી માં દર્શાવેલ છે જે ભારતના કમ્પટ્રોલર અને ઓડીટર જનરલ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ અને પેટા સૂચનાઓએ આધિન છે.
- ૩) ધારાની કલમ ૧૪૩ (૩) મુજબ અમો જણાવીએ છીએ કે:-
 - એ) અમારી જરૂરીયાત પ્રમાણે અમોએ ઓડીટને લગતી તમામ માહિતી અને સ્પષ્ટિકારણો પ્રાપ્ત કરેલ છે.
 - બી) અમારા મત પ્રમાણે ચોપડાઓની ચકાસણીથી જણાઈ આવેલ છે કે કંપની દ્વારા હાલના કાયદા પ્રમાણે હિસાબોના ચોપડાઓ ખરી રીતે નિભાવવામાં આવેલ છે.
 - સી) આ રીપોર્ટને લગતા બેલેન્સ શીટ, નફા નુકશાનના પત્રકો અને કેશ ફલો પત્રકો હિસાબી ચોપડા પ્રમાણે નિભાવવામાં આવેલ છે.
 - ડી) અમારા મત પ્રમાણે, ઉપર જણાવેલ નાણાક્રિય પત્રકોની જાળવણી કરતી વખતે ધારાની કલમ ૧૩૩ અને કંપની (એકાઉન્ટસ) રૂલ્સ, ૨૦૧૪ ના નીયમ ૭ નું પાલન કરવામાં આવેલ છે.
 - ઇ) આ કંપની એક સરકારી કંપની હોવાથી માનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના તારીખ ૫ મી જૂન, ૨૦૧૫ ના ઠરાવ નં. જ.એસ.આર.૪૬૩ (૬) મુજબ કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૬૪ની પેટા કલમ ૨ લાગુ પડતી નથી.
 - એફ) અમારા કંપનીના નાણાક્રિય રીપોર્ટિંગને લગત આંતરીક નાણાક્રિય નિયંત્રણની જરૂરીયાત મુજબ અને નિયંત્રણના ઓપરેટીંગ ક્ષમતા મુજબની વિગતો અમોએ અલગ અહેવાલથી એનેક્ષર સી માં રજૂ કરેલ છે.
 - ગ) ઓડીટર અહેવાલની અન્ય બાબતો કે જે કંપનીઝ (ઓડીટ એન્ડ ઓડીટસ) રૂલ્સ, ૨૦૧૪ ના નીયમ ૧૧ ને લગત છે તે વિષે જણાવવાનું કે અમારી માહિતી અને તેના અનુસંધાને મળેલ સ્પષ્ટીકરણ મુજબની વિગત નીચે પ્રમાણે છે.
 - ૧) તા. ૩૧ મી માર્ચ, ૨૦૨૦ અંતીતના બેલેન્સ શીટ સમયે કોઈ પ્રકારના દાવાઓ બાકી રહેલ નથી.

- ૨) કંપનીએ લાભા સમયના કરાર કે જેમાં ડીરીવેટીવ કરારોનો સમાવેશ થાય છે તેના અનુસંધાને હાલના નિયમો અને હિસાબી પદ્ધતિઓ મુજબ જરૂરી પ્રાવધાનો કરેલ છે.
- ૩) કંપની દ્વારા ઈન્વેસ્ટર એડયુકેશન અને પ્રોટેક્શન ફંડમાં નાણા ટ્રાન્સફર કરવામાં કે ટ્રાન્સફર કરવાની જરૂરીયાતમાં કોઈપણ પ્રકારનો વિલંબ કરેલ નથી.

શાહ એન્ડ દલાલ વતી
ચાર્ડર એકાઉન્ટસ
એફઆરએન : ૧૦૮૪૭૨૫૭૫૫૫૫

સ્થળ:- અમદાવાદ
તારીખ:- ૦૪/૦૭/૨૦૨૦

સહી/-
મલય દલાલ
ભાગીદાર
સભ્ય. નં. ૦૩૬૭૭૬

ઓડીટરના સ્વતંત્ર અહેવાલને લગત એનેક્ષર - અ

૩૧ મી માર્ચ, ૨૦૨૦ અંતિતના નાણાંકીય પત્રકો અમારા દ્વારા બહુચરાજુ રેલ કોર્પોરેશન લીમીટેડના સભ્યોને આથી સમર્પિત

(કાયદાકીય અને રેગ્યુલેટરી જરૂરીયાતોના રીપોર્ટના ફકરા નંબર - ૧ ના અનુસંધાને)

કંપનીના નાણાંકીય પત્રકોના સાચા અને ખરા ચિત્રને પ્રામ કરવા માટે અમારા દ્વારા કરવામાં આવેલ ઓડીટ પધ્થતિના આધારે અને અમને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતાઓ મુજબ અમારા દ્વારા ચકાસવામાં આવેલ હિસાબી ચોપડાઓ અને અન્ય રેકર્ડ મુજબ અમોનીયે મુજબ રીપોર્ટ કરીએ છીએ:-

૧. કંપની ની ફીક્સ એસેટ ના સંદર્ભમાં.

કંપની પાસે કોઈ ફીક્સ એસેટ નથી અને તેથી આ કલમ લાગુ પડતું નથી. પરંતુ કંપની પાસે કેપીટલ એસેસની કામગીરી હાલ પ્રગતિમાં છે અને તે નાણાંકીય પત્રકોમાં દર્શાવેલ છે.

૨. કંપની પાસે કોઈપણ પ્રકારની ઈન્વેન્ટરી નથી અને તેથી આ કલમ લાગુ પડતું નથી.

૩. કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૮૮ મુજબ જાળવેલ રજીસ્ટરમાં દર્શાવેલ છે. કે કંપની એ અન્ય કંપની, પેઢી, લિમીટેડ લાયબલીટી પાર્ટનરશીપ કે અન્ય પાર્ટને તારણવાણી કે તારણવગરની લોન આપેલ નથી.

૪. અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા મુજબ કંપનીએ કોઈપણ લોન, રોકાણ, ગેરેન્ટી કે સેક્યુરીટી કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૮૫ અને ૧૮૬ મુજબ આપેલ નથી. તેથી સીએઆરઓ, ૨૦૧૬ ના કલોઝ (૪) મુજબ કોઈ રીપોર્ટિંગ કંપનીએ કરવાનું રહેતું નથી.

૫. કંપનીએ આપેલ માહિતી અને સ્પષ્ટતા મુજબ કંપનીએ કોઈપણ જાતનું નિવેશ પણ્ણીક પાસેથી સ્વીકારેલ નથી કે જે ધારાની કલમ ૭૩ થી ૭૬ માં દર્શાવેલ છે અને તેના નીચેના નિયમોમાં દર્શાવેલ છે અને તેથી સીએઆરો, ૨૦૧૬ ની કલમ (૫) મુજબ કંપનીએ કોઈ રીપોર્ટિંગ કરવાનું રહેતું નથી.

૬. કેન્દ્ર સરકાર દ્વારા કંપની ધારા, ૨૦૧૩ ના કલમ ૧૪૮ ના પેટા કલમ (૧) માં જણાવેલ કોસ્ટ રેકર્ડની જાળવણી કંપનીને લાગુ પડતું નથી. આથી સીએઆરઓ, ૨૦૧૬ ની કલમ (૬) કંપનીને લાગુ પડતું નથી.

૭. અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ સેટ્યુટરી લેણાની માહિતી નીચે મુજબ છે:-

અ) કંપની અનડીસ્પુટેડ સેટ્યુટરી લેણા ભરવામાં નિયમિત છે જેમાં ઈન્કમ ટેક્ષ, ગુડમ અને સર્વિસ ટેક્ષ, તથા અન્ય કાયદાકીય કર નો સમાવેશ થાય કે લાગતી વળગતી સત્તાઓને ચૂકવવાના હોય છે.

બી) કોઈપણ પ્રકારની ડયુટી કે ટેક્ષ બાબતે કોઈપણ રેવન્યુ સત્તા સાથે કોઈ પણ પ્રકારની તકરારો હાલમાં ચાલુ નથી.

૮. અમોને આપવામાં આવેલ માહિતી મુજબ કંપની દ્વારા કોઈ પણ નાણાંકીય સંસ્થા કે બેન્કને ચૂકવવા પાત્ર નાણાં ચૂકવવામાં ચૂક કરેલ નથી.

૯. અમારી જાણ મુજબ અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા મુજબ કંપનીએ આ વર્ષમાં પ્રારંભીક પદ્ધીક ઓફર કે અન્ય પદ્ધીક ઓફર (જેમાં ડેઝ ઈસ્ટમેન્ટનો સમાવેશ થાય છે) થી કોઈ નાણાં એકત્ર કરેલ નથી. તેથી આ કલમ લાગુ પડતી નથી.
૧૦. અમારી જાણ મુજબ અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા મુજબ આસમયગાળા દરમ્યાન કંપનીએ છેતરપીંડી કરેલ નથી કે તેના અધિકારીઓએ કે કર્મચારીઓએ કંપની સાથે કોઈ પણ પ્રકારની છેતરપીંડી કરેલ નથી તેમ જણાઈ આવેલ છે.
૧૧. અમારા મતે અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કંપનીને મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના તારીખ ૫ મી જૂન, ૨૦૧૫ ના દરાવ નં. જીએસઆર ૪૬૩(૬) મુજબ કલમ ૧૮૭ ના પ્રાવધાનોથી મુક્ત કરવામાં આવે છે કારણ કે તે એક સરકારી કંપની છે. આથી સીએસઆરઓ, ૨૦૧૬ ની કલમ ૧૧ ના પ્રાવધાનો અત્રે લાગુ પડતા નથી.
૧૨. કંપની એક નીધી કંપની નથી અને તેથી સીએઆરઓ, ૨૦૧૬ ના કલમ (૧૨) હેઠળ કંપનીએ રીપોર્ટિંગ કરવાનું રહેતું નથી.
૧૩. આરા મતે અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા મુજબ કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૮૮ અને ૧૭૭ નું જે સ્થાને લાગુ પડે ત્યાં કંપની પાલન કરે છે. લાગતા વળગતા પાર્ટીઓના તમામ લેવડટેવડ અને પક્ષકારોના લેવડટેવડની વિગતો નાણાંકીય પત્રકોમાં દર્શાવેલ છે કે જે ભારતીય હિસાબી સિધ્ધાતોમાં દર્શાવેલ છે.
૧૪. ચાલુ સાલે કંપનીએ કોઈપણ પ્રીફરેન્શીયલ એલોટમેન્ટ કે શેરોના પ્રાઇવેટ પ્લેસમેન્ટ કે ફુલ્લી કે પાર્શ્વીયલ કન્વર્ટબીલ ડિબેન્ચરો ઈસ્યુ કરેલ નથી. જેથી સીએઆરઓ ની કલમ (૧૪) અત્રે લાગુ પડતી નથી.
૧૫. અમારા મતે અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટતા મુજબ હાલના સમયગાળામાં કંપનીએ કોઈ પણ પ્રકારના નોન - કેશ લેવડટેવડ તેઓના નિયામકો કે અન્ય વ્યક્તિઓ સાથે કરેલ નથી અને તેથી કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૮૨ અત્રે લાગુ પડતું નથી.
૧૬. કંપનીને રીજર્વ બેન્ક ઓફ ઈન્ડીયા ધારા, ૧૯૩૪ ની કલમ ૪૫ IA એ અંતર્ગત કોઈ નોંધણી કરવાની જરૂરીયાત રહેલ નથી.

શાહ અન્ડ દલાલ વતી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
એફઆરએન : ૧૦૮૪૩૨૯૮૮૫૪

સ્થળ:- અમદાવાદ
 તારીખ:- ૦૪/૦૭/૨૦૨૦

સહી/-
મલય દલાલ
 ભાગીદાર
 સભ્ય નં. ૦૩૬૭૭૬

ઓડીટરના સ્વતંત્ર અહેવાલને લગત એનેક્ષર - બી

૩૧ મી માર્ચ, ૨૦૨૦ અંતિતના નાણાંકીય પત્રકો અમારા દ્વારા ભણ્યરાજુ રેલ કોર્પોરેશન લીમીટેડના

સભ્યોને આથી સમર્પિત

(કાયદાકીય અને રેઝયુલેટારી જરૂરીયાતોના રીપોર્ટના ફકરા નંબર - ૨ ના અનુસંધાને) કંપની ધારા, ૨૦૧૯ ની કલમ ૧૪૩ (૫) મુજબ નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેનો રીપોર્ટ

મુખ્ય સુચનાઓ:-

૧. શુ કંપની એવી કોઈ પ્રક્રિયા અમલમાં રાખેલ છે કે જેથી કે તમામ હિસાબીય લેવડ દેવડ આઈટી પ્રક્રિયાથી થઈ શકે? જો ના, તો આઈટી પ્રક્રિયા સિવાય કરવામાં આવેલ હિસાબી લેવડ દેવડ અને અન્ય કામગીરી અને તેની હિસાબો પર અસર અને તેની નાણાંકીય અસરો જો કોઈ હોય તો તે દર્શાવવો.
- ટીયએની:- હા, કંપનીએ તમામ નાણાંકીય લેવડ દેવડ માટે આઈટી સીસ્ટમ અમલમાં છે.
૨. શુ કોઈ લેન્ડર દ્વારા કંપની દ્વારા લોન ન ભરવાના કારણે કોઈ ચાલુ લોન પર રીસ્ટ્રક્ચરીગ કરવામાં આવેલ છે કે ડેબ્ટસ્યુ/લોન/વ્યાજ વિગેરેના કોઈ વેવર/રાઈટઓફ ના કિસ્સા બનેલ છે? જો હા તો તેની નાણાંકીય અસરો દર્શાવવો.
- ટીયએની:- ઓડીટના સમય દરમ્યાન કંપનીએ કોઈ વેવર/રાઈટ ઓફ કરેલ નથી.
૩. શુ કેન્દ્રીય/રાજ્ય એજન્સી તરફથી કોઈ ખાસ સ્કીમ માટે મળેલ /મળવા પાત્ર બંડોળનો હિસાબ પ્રમાણે/તેની શરતો અને નિયમો મુજબ વાપરવામાં આવેલ છે. જે તેમન કરવામાં આવેલ હોય તો તેની યાદી.
- ટીયએની:- અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કંપનીને કોઈ પણ ખાસ પ્રોજેક્ટ માટે કેન્દ્ર/ રાજ્ય એજન્સીઓ પાસેથો કોઈ નાણાં મળેલ નથી સીવાય કે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન પાસેથી પ્રામ થયેલ શેર કેપીટલની રકમ અને તેનો હિસાબ બારાબર રાખવામાં આવેલ છે અને તે બેન્ક ખાતામાં જમા કરવામાં આવેલ છે.

શાખાને લગત સૂચનો : માળખાકીય શાખાઓ:-

૧. કંપની પાસે રહેલ જમીન પર દબાણ ન થાય તે માટે કંપની તરફથી યોગ્ય પગલાઓ લેવામાં આવેલ છે કે કેમ. શુ કંપનીના કોઈ જમીન પર દબાણ થયેલ છે કે તે દાવા અંતર્ગત છે કે તેનો ઉપયોગ કરવામાં આવેલ નથી કે તેને સર્પલ્સ જાહેર કરવામાં આવેલ છે. વિગતો આપવી.
- ટીયએની:- અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ પ્રમાણે ઓડીટના સમયગાળામાં અમારા જાણ પર આવેલ કે કંપની પાસે કોઈ પણ પ્રકારની જમીન રહેલ નથી.
૨. શુ સરકારના સૂચનો / નીતીઓ મુજબ પબ્લિક પ્રાઇવેટ ભાગીદારી મુજબ કોઈ પણ પ્રોજેક્ટનું વેગ માટે ઓળખાણ કરવામાં આવેલ છે. જો કોઈ ફેરબદલી હોય તો જણાવો.
- ટીયએની:- લાગુ પડતી નથી.

૩. શુ કોઈ ચાલુ કરાર કે જેમાં કામગીરીના લક્ષ્યાંકો દર્શાવેલ છે તેમા ભાવ વધારા કે અન્ય કારણોસર કોઈ રેવન્યુ / નુકશાન કરારોના કારણે થયેલ છે અને શુ તે ચોપડાઓમાં બરોબર દર્શાવવામાં આવેલ છે.
- **ટીપ્પણી:**- અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ આ ઓડીટના સમયગાળા દરમ્યાન અમોને જણાઈ આવેલ કે કંપનીએ ઈપીસી માટે “કટોસન રોડ - બહુચરાજુ ગેજ કન્વર્જન (૨૬.૬ કિલોમીટર) - મીટર ગેજ ટુ બ્રોડ ગેજ બહુચરાજુ ખાતે ન્યુ માર્ગનિસુજુકી ઈન્ડિયા લિ. બ્રોડગેજ સાઈડિંગ (આશરે ત કિલોમીટર) ૨૫ કેવી એસી ઈલેક્ટ્રીફિકેશન વેસ્ટન રેલવે અમદાવાદ ડીવીઝન સાથે” માટે ટેન્ડર મે. કલ્પતરુ પાવર ટ્રાન્સમીશન લીમીટેડને આપેલ છે. ઈપીસી કોન્ટ્રાક્ટ બાબતે જણાવવાનું કે અમોને આપેલ માહિતી મુજબ મે. કલ્પતરુ પાવર ટ્રાન્સમીશ લીમીટેડ કોઈ કામગીરી શરૂ કરેલ નથી અને તેથી આ મુદ્દો લાગુ પડતો નથી.
૪. શુ કોઈ ખાસ સ્કીમ માટે કેન્દ્ર / રાજ્ય સરકાર પાસેથી મળેલ / મળવા પાત્ર ભંડોળનું બરાબર હિસાબ રાખવામાં આવેલ છે / ઉપયોગ કરવામાં આવેલ છે. જો ન કરવામાં આવેલ હોય તો તેની વિગતો.
- **ટીપ્પણી:**- અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કંપની દ્વારા કોઈ ખાસ પ્રોજેક્ટ માટે કેન્દ્ર / રાજ્ય એજન્સીઓ પાસેથી કોઈ નાણાં પ્રામ થયેલ નથી સીવાય કે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન પાસેથી પ્રામ થયેલ શેર કેપીટલની રકમ અને તેનું હિસાબ સારી રીતે રાખવામાં આવેલ છે અને તેને બેંક ખાતામાં જમા કરવામાં આવેલ છે.
૫. શુ કોઈ બેંક ગેરેન્ટી સમયસર રીવેલીડેટ કરવામાં આવેલ છે?
- **ટીપ્પણી:**- અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ ચાલુ સાલે કંપની દ્વારા કોઈ બેંક ગેરેન્ટી નો ઉપયોગ કરવામાં આવેલ નથી અને તેથી આ મુદ્દો લાગુ પડતો નથી.
૬. ટ્રેડ રીસીવેબલ, ટ્રેડ પેયેબલ, ટર્મ ડિપોઝીટ, બેક ખાતાઓ અને પ્રામ થયેલ રોકડના બેલેન્સના કન્ફર્મેશન પર ટીપ્પણીઓ.
- **ટીપ્પણીઓ:**- અમોને નીચે મુજબના કન્ફર્મેશન પ્રામ થયેલ છે અને તે નાણાંકીય પત્રકોના આંકડાઓને અનુરૂપ છે.
- ૧) યસ બેન્ક પાસેથી બેન્ક બેલેન્સ પ્રમાણપત્ર.
 - ૨) જીએસએફએસ પાસેથી બેલેન્સ અને ડિપોઝીટ માટે ઈન્ટરેસ્ટ પ્રમાણપત્ર.
 - ૩) ગુજરાત રેલ ઈન્ડસ્ટ્રીક્યુર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ પાસેથી બેલેન્સ કન્ફર્મેશન.
- બેલેન્સ શીટની તારીખે કોઈ ટ્રેડ રીસીવેબલ નથી.

૭. એબોન્ડન કરવામાં આવેલ પ્રોજેક્ટ માટે થયેલ ખર્ચાને ખરેખર રાઈટ ઓફ કરવામાં આવેલ રકમ દર્શાવો.
- ટીપ્પણી:- અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કોઈ પણ પ્રોજેક્ટ એબોન્ડન કરવામાં આવેલ નથી. તેથી આ કલમ લાગુ પડતી નથી.

શાહ અન્ડ દલાલ વતી
ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ
એફઆરએન : ૧૦૮૪૩૨૫૬૫૫૫૫

સ્થળ:- અમદાવાદ
તારીખ:- ૦૪/૦૭/૨૦૨૦

સહી/-
મલય દલાલ
ભાગીદાર
સભ્ય. નં. ૦૩૬૭૭૬

ઓડીટરના સ્વતંત્ર અહેવાલને લગત એનેક્ષર - સી

(કાયદાકીય અને રેગ્યુલેટારી જરૂરીયાતોના રીપોર્ટના ફકરા નંબર - ઉ (એફ) ના અનુસંધાને)

કંપની ધારા, ૨૦૧૩ (ધારા) ની કલમ ૧૪૩ ની પેટા કલમ ૩ ના કલોગ (૧) અંતર્ગત આંતરીક નાણાંકીય નિયંત્રણનો નાણાંકીય રીપોર્ટ ઉપર અહેવાલ.

અમોએ ઉ૧ મી માર્ચ, ૨૦૨૦ ના રોજનો બહુયરાજુ રેલ કોર્પોરેશન લીમિટેડના (કંપની) આંતરીક નાણાંકીય નિયંત્રણનો ઓડીટ કરેલ છે અને તે કંપનીના સ્ટેન્ડએલોન નાણાંકીય પત્રકોના ઓડીટને અનુલક્ષીને છે.

આંતરીક નાણાંકીય નિયંત્રણ માટે મેનેજમેન્ટની જવાબદારી:-

આંતરીક નાણાંકીય નિયંત્રણની જાળવણીની જવાબદારી કંપનીના મેનેજમેન્ટની છે અને તેનો આધાર કંપનીના ફાઈનાન્શીયલ રીપોર્ટિંગ કાયટેરીયાનું આંતરીક નિયંત્રણ છે જે ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડીયા દ્વારા જારી કરવામાં આવેલ ઓડીટ ઓફ ઈન્ટરનલ ફાઈનાન્શીયલ કંટ્રોલ ઓવર રીપોર્ટિંગના ગાઈડન્સ નોટમાં દર્શાવવામાં આવેલ છે. આ જવાબદારીઓમાં ડીજાઈન, અમલીકરણ અને આંતરીક નાણાંકીય નિયંત્રણની જાળવણીનો સમાવેશ થાય છે કે જેથી ધંધો સારી અને સમયબધ્ય રીતે ચાલી શકે, કંપનીની નિતીઓનું પાલન થાય, તેના હેતુઓ સચ્યાય, ઉચાપત અને ભુલોને અટકાવી શકાય અને ઓળખી શકાય, હિસાબી રેકર્ડને બરાબર અને સંપૂર્ણ રીતે જાળવી શકાય અને કંપની ધારા, ૨૦૧૩ અંતર્ગત જરૂરી નાણાંકીય માહિતી સમયસર તૈયાર કરી શકાય તેવી બાબતોનો સમાવેશ થાય છે

ઓડીટરની જવાબદારી:-

અમારી જવાબદારી અમારા ઓડીટના આધારે કંપનીના આંતરીક નાણાંકીય નિયંત્રણો દ્વારા કંપનીના ફાઈનાન્શીયલ રીપોર્ટિંગ બાબતે અભિપ્રાય આપવાનો છે. અમોએ અમારું ઓડીટ નાણાંકીય રીપોર્ટિંગ (ધી ગાઈડ નોટ) પર આંતરીક નાણાંકીય નિયંત્રણના ગાઈડન્સ નોટના આધારે અને કંપનીઝ એકટ, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૧૦) કે જે ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડીયા દ્વારા જારી કરેલ સ્ટેન્ડર્ડ ઓન ઓડીટીંગ પર આધારિત છે કે જેથી આંતરીક નાણાંકીય નિયંત્રણો પર એપ્લીકેબીલી વધારી શકાય. આ સ્ટેન્ડર્ડ અને ગાઈડન્સ નોટ મુજબ અમોએ એથીકલ જરૂરિયાતોનું પાલન કરવું પડે અને ઓડીટ તે રીતે કરવું પડે કે જેથી તે સાબીત થાય કે ફાઈનાન્શીય રીપોર્ટિંગ પર આંતરીક નાણાંકીય નિયંત્રણો લાગુ કરવામાં આવેલ છે અને તે મટીરીયલ સંદર્ભમાં સારી રીતે લાગુ કરવામાં આવેલ છે.

અમારા ઓડીયમાં એવી પ્રક્રિયાઓ લાગુ કરવામાં આવેલ છે કે જેથી નાણાંકીય રીપોર્ટિંગ પર આંતરીક નાણાંકીય નિયંત્રણો લાગુ કરવામાં આવેલ છે તે બાબતે ઓડીટમાં સાબીતી પ્રાપ્ત કરી શકાય. અમારા ઓડીટમાં નાણાંકીય રીપોર્ટિંગ પર થયેલ આંતરીક નાણાંકીય નિયંત્રણો અને મેટીરીયલ રીસ્કની ચકાસણી અને એસેસ રીસ્ક પર ડીજાઈનનું ટેસ્ટીંગ અને ઈવેલ્યુએશનની અસર વગેરે સામેલ છે. લાગુ કરવામાં આવેલ પ્રક્રિયા ઓડીટરના જરૂરિયત પર આધારિત છે જેમાં નાણાંકીય પત્રકો પર મટીરીય મીસસ્ટેટમેન્ટના જોખમના મુલ્યાંકનનો પણ સમાવેશ થાય છે કે જે છેતરપીંડી કે ભુલના કારણે હોય શકે.

અમો માનીએ છીએ કે અમારા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ ઓડીટની વિગતો કંપનીના નાણાંકીય રીપોર્ટિંગ પર રહેલ આંતરીક નાણાંકીય નિયંત્રણો બાબતે ઓડીટ અભિપ્રાય પ્રાપ્ત કરવા માટે યોગ્ય અને બરાબર છે.

નાણાંકીય રીપોર્ટિંગ પર આંતરીક નાણાંકીય નિયંત્રણનું મતલબઃ-

કંપનીનું નાણાંકીય રીપોર્ટિંગ પરનું આંતરીક નાણાંકીય નિયંત્રણ તે પ્રક્રિયા છે કે જેથી નાણાંકીય રીપોર્ટિંગ બાબતે ખાત્રી પ્રામ કરી શકાય અને હિસાબી નીતીઓ મુજબ એકટરનલ કામગીરી માટે નાણાંકીય પત્રકો તૈયાર કરી શકાય. કંપનીના નાણાંકીય રીપોર્ટિંગ પરના આંતરીક નાણાંકીય નિયંત્રણમાં તે નિતીઓ અને પદ્ધતિઓનો સમાવેશ થાય છે કે:-

- (૧) રેકૉર્ડની જાળવણી કરવા સારુ કે જે વિગતવાર, ચોકસાઈ પૂર્વક કંપનીના એસેટની વિગતો દર્શાવી શકાય,
- (૨) એવી ખાત્રી આપી શકે કે નાણાંકીય પત્રકો માટેના લેવડ ડેવડ કરવા માટે માન્યતાપ્રાપ્ત હિસાબી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવેલ છે અને કંપનીના રસીદો અને ખર્ચાઓ કંપનીના મેનેજમેન્ટ અને નિયામકોના હુકમ મુજબ કરવામાં આવેલ છે,
- (૩) એવી ખાત્રી પ્રામ કરી શકાય કે કોઈ ગેરકાયદેસર એકવેજીશન કે કંપનીના એસેટનું ખોટી રીતે ઉપયોગ કે જે નાણાંકીય પત્રક પર અસર કરી શકે તેની સમયસર માહિતી પ્રામ કરી શકાય.

નાણાંકીય રીપોર્ટિંગ પર આંતરીક નાણાંકીય નિયંત્રણની મર્યાદાઓ:-

નાણાંકીય રીપોર્ટિંગ પર આંતરીક નાણાંકીય નિયંત્રણની મર્યાદાઓ સિમિત હોવાથી, કે જેમાં મેળાપીપણાકે મેનેજમેન્ટ ની અયોગ્ય સંચાલન ના કારણે ભૂલ કે ગેરરીતીથી થયેલ મટીરીયલ મીસસ્ટેટમેન્ટને ઓળખી ન શકાય. વધુમાં ભવિષ્યના સમયગાળા માટેના નાણાંકીય રીપોર્ટિંગ પરના આંતરીક નાણાંકીય નિયંત્રણના વિશ્લેષણમાં તે ખતરો રહેલ છે કે પરીસ્થિતિમાં ફેરફારથી કે અન્ય કારણોથી તેનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરી શકાય નહીં.

અભિપ્રાયઃ-

અમારા મતે ને અમારી પાસે રહેલ માહિતી અને અમોને આપવામાં આવેલ સ્પષ્ટતા મુજબ કંપની પાસે તમામ મટીરીયલ સંદર્ભમાં, નાણાંકીય રીપોર્ટિંગ પર આંતરીક નાણાંકીય નિયંત્રણ છે અને નાણાંકીય રીપોર્ટિંગ પર આવા આંતરીક નાણાંકીય નિયંત્રણો ઉઠ મી માર્ચ, ૨૦૨૦ ના રોજ અમલમાં છે અને કંપની દ્વારા નાણાંકીય રીપોર્ટિંગ પર મુકવામાં આવેલ આંતરીક નિયંત્રણના આધારે અને આંતરીક નિયંત્રણના જરૂરી કોમ્પોનેન્ટ્સના આધારે તેમ કહી શકાય કે તે ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડીયાના ઓડીટ ઓફ ઇન્ટરનલ ફાઇનાન્શીયલ કન્ટ્રોલ ઓવર ફાઇનાન્શીયલ રીપોર્ટિંગના ગાઈડન્સ નોટ મુજબ છે.

શાહ એન્ડ દલાલ વતી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
એફઆરએન : ૧૦૯૪૭૨૫૬૮૫૪૫૬

સ્થળઃ- અમદાવાદ
તારીખઃ- ૦૪/૦૭/૨૦૨૦

સહી/-
મલય દલાલ
માંગીદાર
સભ્ય. નં. ૦૩૬૭૭૬

બહુચરાજુ રેલ કોપરિશન લિ.
સીઆઈએન : ગુજરાતીનુજેરીઓસાનુસીરીનું
૩૧ મી માર્ચ, ૨૦૨૦ ના રોજનું સરયેચુ
(રકમ રૂ.માં)

વિગત	નોંધ નંબર	૩૧-૩-૨૦૨૦ ના રોજ	૩૧-૩-૨૦૧૯ ના રોજ
૧ એસેટ્સ			
નોનકરન્ટ એસેટ્સ			
(એ) પ્રોપરી, પ્લાન્ટ અને ઈક્વીપમેન્ટ	૪	૮૬૧૮૯૮	-
(બી) ચાલુ મુડી કામે		-	-
(સી) અન્ય ઈન્ટેજેબલ એસેટ્સ		-	-
(ડી) નાણાંકીય એસેટ		-	-
(૧) રોકાણ		-	-
(૨) ટ્રેડ રીસીવેબલ		-	-
(૩) લોન		-	-
(૪) અન્ય નાણાંકીય એસેટ		-	-
(એફ) ટીફિડ ટેક્ષ એસેટ (નેટ)	૫	-	-
(જી) અન્ય નોન-કરન્ટ એસેટ	૬	૧૩૦૪૮૩૫૬૯	-
પેટા - કુલ		૧૩૧૪૪૫૩૮૭	-
કરન્ટ એસેટ			
(એ) ઈન્વેન્ટરીઝ		-	-
(બી) નાણાંકીય એસેટ		-	-
(૧) રોકાણ		-	-
(૨) ટ્રેડ રીસીવેબલ		-	-
(૩) કેશ અને કેશ ઈક્વીવેલેન્ટ	૭	૧૩૬૦૦૭૬	૭૪૦૮૪૦૦
(૪) લોન		-	-
(૫) અન્ય નાણાંકીય એસેટ		-	-
(સી) કરન્ટ એસેટ (નેટ)	૮	-	-
(ડી) અન્ય કરન્ટ એસેટ	૯	૩૫૭૫૦૩૧	૨૬૦૦૦૦૦
પેટા - કુલ		૪૫૬૫૧૦૭	૧૦૦૦૮૪૦૦
કુલ એસેટ		૧૩૬૫૧૦૪૫૪	૧૦૦૦૮૪૦૦
૨ મૂડી અને દેવા			
ઈક્વીટી			
(એ) ઈક્વીટી શેર કેપીટલ	૧૦	૧૦૦૦૦૦૦૦	-
(બી) અન્ય ઈક્વીટી	૧૧	(૩૭૧૮૭૪૦૬)	(૧૬૧૧૩૮૩૪)
પેટા - કુલ		(૨૭૧૮૭૪૦૬)	(૧૬૧૧૩૮૩૪)
દેવા			

વિગત	નોંધ નંબર	૩૧-૩-૨૦૨૦ ના રોજ	૩૧-૩-૨૦૧૯ ના રોજ
ફાળવણી થતાં સુધી	૧૨	-	૧૦૦૦૦૦૦૦
શેર અરજી નાણાં			
નોન - કરન્ટ લાયબલીટી			
(એ) નાણાંકીય જવાબદારીઓ			
(૧) બોરોઈંગ		-	-
(૨) ટ્રેડ ચૂકવવાપાત્ર		-	-
(૩) અન્ય નાણાંકીય જવાબદારીઓ		-	-
(બી) પ્રાવધાનો		-	-
(સી) ડીફર્ડ ટેક્ષ જવાબદારીઓ (નેટ)		-	-
(ડી) અન્ય નોન કરન્ટ જવાબદારીઓ		-	-
પેટા કુલ		-	૧૦૦૦૦૦૦૦
કરન્ટ જવાબદારીઓ			
(એ) નાણાંકીય જવાબદારીઓ			
(૧) બોરોઈંગ	૧૩	૧૪૩૧૨૭૮૫૫	-
(૨) ટ્રેડ ચૂકવવાપાત્ર	૧૪	૧૬૨૬૮૪૦૩	૧૫૮૨૮૫૪૬
(બી) પ્રાવધાનો	૧૫	૧૨૨૫૨૬૧	૨૬૩૨૦૦
(સી) અન્ય કરન્ટ જવાબદારીઓ	૧૬	૮૬૩૮૧	૨૮૫૮૮
(ડી) કરન્ટ ટેક્ષ જવાબદારીઓ (નેટ)	૧૭	-	-
પેટા - કુલ		૧૬૩૭૦૭૯૫૦	૧૬૧૨૨૩૩૫
કુલ ઈક્વિટી અને જવાબદારીઓ		૧૩૬૫૧૦૪૯૪	૧૦૦૦૮૪૦૦

ખાસ હિસાબી પદ્ધતિઓ અને નોંધો ૧, ૨ અને ઉ નાણાંકીય પત્રકોનો ભાગ છે.

હિસાબી ફોર્મ પરની નોંધો નાણાંકીય પત્રકોનો આતરીક ભાગ છે.

સમાન તારીખના અમારા અહેવાલ પ્રમાણે

શાહ અને દલાલ વતી

ચાર્ટર્ડ એક્ઝાઇન્ટન્ટ

અફિયારઅન ૧૦૮૪૩૨૩૬૮૮૪

નિયામક બોર્ડના વતી અને તેમના દ્વારા

સહી/-

મલય દલાલ

ભાગીદાર,

સભ્ય નં. ૦૩૬૭૭૬

સહી/-

સંતોશ કુમાર

નિયામક / સીરીઝાં

ડીઆઈઅન: ૦૭૮૫૪૧૧૭૮

સહી/-

બી. સી વલી

નિયામક

ડીઆઈઅન: ૦૭૧૩૭૮૪૨

સ્થળ:- અમદાવાદ

તારીખ:- ૦૪/૦૭/૨૦૨૦

સ્થળ:- ગાંધીનગર

તારીખ:- ૦૪/૦૭/૨૦૨૦

બહુચરાજુ રેલ કોપરિશન લિ.

સીઆઈએન : ચુઠપ૧૦૧નુજેર૨૦૧૮એસજુસી૧૦૫૬૦૨

૩૧ મી માર્ચ, ૨૦૨૦ અંતિમ નફા નુકશાનના પત્રકો

(રકમ રૂ.માં)

વિગત	નોંધ નંબર	૦૧-૦૪-૨૦૨૦ થી ૩૧-૩-૨૦૨૦ ના સમયગાળા માટે	૩૧-૧૨-૨૦૧૯ થી ૩૧-૩-૨૦૧૯ ના સમયગાળા માટે
રેવન્યુ			
૧. ક્રમગીરીમાં આવક		-	-
૨. અન્ય આવક	૧૮	૧૭૫૮૪૭૦	૮૪૦૦
૩. કુલ આવક (૧ મુલુક)		૧૭૫૮૪૭૦	૮૪૦૦
૪. ખર્ચ			
કર્મચારીઓ માટે ખર્ચ, કોન્ટ્રાક્ટરોને	૧૯	૬૩૫૦૦૩	૨૫૪૭૪
અને કન્સલટન્ટને ચૂકવણું			
નાણાંકીય કિમત	૨૦	-	-
ઘસારો અને અમોરટાઇઝેશન ખર્ચ	૨૧	-	-
અન્ય ખર્ચ	૨૨	૨૨૨૦૭૮૩૮	૧૬૦૮૦૬૬૧
કુલ ખર્ચ (૪)		૨૨૮૪૨૫૪૧	૧૬૧૨૦૧૩૫
૫. અસામાન્ય બાબત અને		(૨૧૦૮૩૪૭૧)	(૧૬૧૧૧૭૩૫)
ટેક્ષ પહેલાનો નફા / (નુકશાન) (૩ - ૪)			
૬. અસામાન્ય આઈટેમ		-	-
૭. ટેક્ષ પહેલાનો નફા / (નુકશાન)		(૨૧૦૮૩૪૭૧)	(૧૬૧૧૧૭૩૫)
(૫ - ૬)			
૮. વેરા ખર્ચ			
કરન્ટ વેરો		-	૨૨૦૦
ડીફર્ડ વેરો		-	-
કુલ વેરાનો ખર્ચ		-	૨૨૦૦
૯. વેરા બાદ નફા / (નુકશાન) હાલના સમયગાળા માટે		(૨૧૦૮૩૪૭૧)	(૧૬૧૧૩૮૩૫)
માટે વેરા બાદ (૭ - ૮)			
૧૦. અન્ય કોમ્પ્લીન્સીવ આવક			
એ(૧) તેવી આઈટમો કે જેને નફા અને નુકશાન માં			
વળ્ણીકૃત ન કરી શકાય.			
(એ) રીવેલ્યુઅશન સર્પલસમાં ફેરફાર		-	-
(બી) લાભદાયક જવાબદારીઓ /		-	-
એસેટોની ફરીમાપણી		-	-
(સી) અન્ય કોમ્પ્લીન્સીવ આવકમાંથી		-	-
પ્રામ થયેલ ઈકવીટી ઈન્સ્ટ્રુમેન્ટ		-	-
(ડી) પોતાના કેડીટ રીસકમાં થયેલ		-	-
ફેર વેલ્યુ ગેન્જ		-	-

(એ) અન્ય (વિગત દર્શાવો)	-	-
બી(૨) આવક વેરાની બાબતો કે જેનું	-	-
નફા અને નુકશાનમાં વર્ગીકૃત ન કરી શકાય	-	-
વર્ગીકૃત થઈ શકે તેવી આઈટમો	-	-
(અ) વિદેશી કામગીરીમાં નાણાંકીય	-	-
પત્રકોમાં થયેલ એક્ષયેન્જમાં	-	-
ફેરફારો	-	-
(બી) ડેબટ ઈન્સ્ટ્ર્યુમેન્ટ દ્વારા પ્રામ થયેલ	-	-
કોમ્પ્લીન્સીવ આવક	-	-
(સી) કેશ ફ્લો હેજમાં હેજંગ	-	-
ઇન્સ્ટ્ર્યુમેન્ટના ડેજનેટ થયેલ	-	-
ભાગમાં નફા અને નુકશાનના	-	-
લાગુ પડતા ભાગો.	-	-
(ડી) ઈક્વીટીને લગત રોકાણકારોમાંથી	-	-
પ્રામ કોમ્પ્લીન્સીવ આવકનો	-	-
હિસ્સો	-	-
(એ) અન્ય (વિગત દર્શાવો)	-	-
(૨) નફા અને નુકશાનમાં ફીઝી વર્ગીકૃત	-	-
થઈ શકે તેવી આઈટમો	-	-
પર આવક વેરો	-	-
સબ ટોટલ	-	-
૧૧. હાલના સમયગાળા માટે કુલ	<u>(૨૧૦૮૩૪૭૧)</u>	<u>(૧૬૧૧૩૮૩૫)</u>
કોમ્પ્લીન્સીવ આવક (૮ વિન્દો ૧૦)	-	-
ઇક્વીટી શેર દીઠ આવક	-	-
પાયાની	૨૩	(૩૫.૩)
ડિલ્યુટેડ		(૩૫.૩)

ખાસ હિસાબી પદ્ધતિઓ અને નોંધો ૧, ૨ અને ઉ નાણાંકીય પત્રકોનો ભાગ છે.

આનુષ્ઠાનિક નોંધ આ નાણાંકીય પત્રકોનો અભિનશ્બાગ છે.

શાહ અને દલાલ વતી

ચાર્ટર્ડ એક્ઝાઉન્ટન્ટ

એફઆરએન ૧૦૮૪૩૨૩૬૮

સહી/-

મલય દલાલ

ભાગીદાર,

સત્રય નં.૦૩૬૭૭૬

સ્થાન:- અમદાવાદ

તારીખ:- ૦૪/૦૭/૨૦૨૦

નિયામક બોર્ડના વતી અને તેમના દ્વારા

સહી/-

સંતોશ કુમાર

નિયામક / સીએચો

ડીઆઈએન: ૦૭૮૫૪૧૧૭૮

સહી/-

બી. સી વલી

નિયામક

ડીઆઈએન: ૦૭૧૩૭૮૪૨

સ્થાન:- ગાંધીનગર

તારીખ:- ૦૪/૦૭/૨૦૨૦

બહુચારાજી રેલ કોપરિશન લિ.
સીઆઈઓન : ગુજરાતિયુજેરોનેસાનુસીનોફોર્મ
૩૧ મી માર્ચ, ૨૦૨૦ અંતિત કેશ ફ્લોનો પત્રક
(રકમ રૂ.માં)

વિગત	૦૧-૦૪-૨૦૧૯	૧૩-૧૨-૨૦૧૯
	થી ૩૧-૩-૨૦૨૦ ના	થી ૩૧-૩-૨૦૧૯ ના
	સમયગાળા માટે	સમયગાળા માટે
૧. ઓપરેટીંગ કામગીરીમાંથી કેશ ફ્લો		
નફા નુકશાનના પત્રક મુજબ વેરા પહેલાનું નુકશાન	(૨૧૦૮૩૪૭૧)	(૧૬૧૧૧૭૩૪)
એટજેસ્ટ કરેલા:-		
વ્યાજનો આવક	(૪૬૧૧૬૫)	૮૪૦૦
નાણાંકીય ખર્ચ	-	-
વર્કિંગ કેપીટલમાં ફેરફાર પહેલા	(૨૧૫૪૪૬૩૬)	(૧૬૧૦૩૩૩૪)
ઓપરેટીંગ નફો		
વર્કિંગ કેપીટલના મુવમેન્ટ માટે		
એડજેસ્ટમેન્ટ		
અન્ય કરન્ટ એસેટમાં (વધારો)/(ઘટાડો)	(૩૫૭૫૦૩૧)	-
ચૂકવવા પાત્ર ટ્રેડમાં વધારો/(ઘટાડો)	૩૪૩૮૮૫૭	૧૫૮૨૮૫૪૬
પ્રોવિઝનમાં વધારો/(ઘટાડો)	૫૬૨૦૬૧	૨૬૩૨૦૦
અન્ય કરન્ટ જવાબદારીઓમાં	૫૬૭૮૮	૨૮૫૮૯
વધારો/(ઘટાડો)		
વર્કિંગ કેપીટલમાં ફેરફારો બાદનો	૮૮૨૬૭૮	૧૬૧૨૨૭૩૪
ઓપરેટીંગ પ્રોફીટ		
ચૂકવેલ વેરો (રીફંડમાં નેટ)	-	(૨૨૦૦)
ઓપરેટીંગ કામગીરીમાં	(૨૦૬૬૧૬૫૭)	૧૬૮૦૦
નેટ કેશ ફ્લો (ઉપયોગમાં) (અ)		
૨. રોકાણની કામગીરીમાં કેશ ફ્લો:-		
ચાલુ કામગીરીમાં વર્કિંગ કેપીટલમાં	(૫૬૧૮૧૮)	-
વધારો		
નોન કરન્ટ એસેટમાં વધારો	(૧૩૦૪૮૩૫૬૬)	-
વ્યાજની આવક	૪૬૧૧૬૫	(૮૪૦૦)
રોકાણની કામગીરીમાં	(૧૩૧૦૮૪૨૨૨)	(૮૪૦૦)
નેટ કેશ ફ્લો (ઉપયોગમાં) (બ)		
૩. નાણાંકીય કામગીરીમાંથી કેશ ફ્લો:-		
શેર કેપીટલમાંથી	૨૬૦૦૦૦૦૦	-
એપ્લીકેશન મનીની બાકી ફાળવણી માંથી		૭૪૦૦૦૦૦૦
ટુકાગળાના બોરોઇંગમાંથી	૧૪૩૧૨૭૮૫૪	-

નાણાંકીય કોસ્ટ	-	-
નાણાંકીય કામગીરીમા	૧૪૫૭૨૭૮૫૪	૭૪૦૦૦૦૦
નેટ કેશ ફ્લો (ઉપયોગમાં) (સી)		
કેશ અને કેશ ઈક્વીવેલેન્ટમાં નેટ કેશ	(૬૦૧૮૩૨૪)	૭૪૦૮૪૦૦
ફ્લો (એ) વં (બી) વં (સી)		
વર્ધની શરૂઆતમાં કેશ અને કેશ	૭૪૦૮૪૦૦	-
ઈક્વીવેલેન્ટ		
વર્ધના અંતે કેશ અને કેશ ઈક્વીવેલેન્ટ	૧૩૬૦૦૭૬	૭૪૦૮૪૦૦
વર્ધના અંતે કેશ અને કેશ ઈક્વીવેલેન્ટનો		
બ્રેકઅપ		
કરન્ટ / સેવીગ ખાતામાં બેંક સાથે રહેલ	૧૩૬૦૦૭૬	૭૪૦૮૪૦૦
બ્લેન્સ		
	૧૩૬૦૦૭૬	૭૪૦૮૪૦૦

નોંધો:-

૧. કેશ અને કેશ ઈક્વીવેલેન્ટમાં કેશ અને બેંકની સીલલક અને બેંકમાં રહેલ ડિપોઝિટ (જેમાં મેચયુરીટી ત મહિના કરતા ઓછા હોય તેનો સમાવેશ થાય છે.
૨. ભારતીય હિસાબી પધ્યતિ -૭ મુજબ સ્ટેટમેન્ટ ઓફ કેશ ફ્લોમાં દર્શાવેલ ઈન્ડાયરેક્ટ મેથડ મુજબ ઉપર દર્શાવેલ કેશ ફ્લો પત્રક તૈયાર કરવામાં આવેલ છે.
૩. જરૂરીયાત મુજબ ગત વર્ધના આકડાઓને રીગૃપ અને રી કલેસીફાઇ કરવામાં આવેલ છે જેથી કરીને હાલના વર્ધના આકડાઓ સાથે સમતુલ્ય જળવાઈ રહે.

સમાન તારીખના અમારા અહેવાલ પ્રમાણે

શાહ અને દલાલ વતી

ચાર્ટર્ડ એક્ઝાઉન્ટન્ટ

એફઆરએન ૧૦૮૪૭૨૯૬૫૮૫૪

નિયામક બોર્ડના વતી અને તેમના દ્વારા

સહી/-

મલય દલાલ

ભાગીદાર,

સર્વ્ય નં. ૦૩૬૭૭૬

સહી/-

સંતોશ કુમાર

નિયામક / સીર્ટાઓ

ડિઅાર્થાનં: ૦૭૮૫૪૧૭૮

સહી/-

બી. સી વલી

નિયામક

ડિઅાર્થાનં: ૦૭૧૩૭૮૪૨

સ્થળ:- અમદાવાદ

તારીખ:- ૦૪/૦૭/૨૦૨૦

સ્થળ:- ગાંધીનગર

તારીખ:- ૦૪/૦૭/૨૦૨૦

બહુચાળુ રેલ કોર્પોરેશન લિ.

સીઆઈએન : યુઝ્પ૧૦૧જ્ઞે૨૦૧૮એસજ્ઞી૧૦૫૬૦૨
ઈક્વિટીમાં ફેરફારનું પત્રક

(રકમ રૂ.માં)

એ. ઈક્વિટી શેર ભંડોળ	
૧૩ મી ડિસેમ્બર, ૨૦૧૮ મુજબ	-
ઈક્વિટી શેર ભંડોળમાં ફેરફારો	-
૩૧ મી માર્ચ, ૨૦૧૯ મુજબ	-
ઈક્વિટી શેર ભંડોળમાં ફેરફારો	૧,૦૦,૦૦,૦૦૦
૩૧ મી માર્ચ, ૨૦૨૦ મુજબ	<u>૧,૦૦,૦૦,૦૦૦</u>
બી. અન્ય ઈક્વિટી	
૧૩ મી ડિસેમ્બર, ૨૦૧૮ મુજબ	-
વર્ષ દરમ્યાન થયેલ નફો / (નુકશાન)	(૧૬૧૧૩૮૩૫)
અન્ય કોમ્પીન્સીવ આવક	-
કુલ કોમ્પીન્સીવ આવક	-
૩૧ મી માર્ચ, ૨૦૧૯ મુજબ	(૧૬૧૧૩૮૩૫)
વર્ષ દરમ્યાન થયેલ નફો / (નુકશાન)	(૨૧૦૮૩૪૭૧)
અન્ય કોમ્પીન્સીવ આવક	-
કુલ કોમ્પીન્સીવ આવક	-
૩૧ મી માર્ચ, ૨૦૨૦ મુજબ	(૩૭૧૬૭૪૦૬)

સાથે જોડવામાં આવેલ નોંધો નાણાંકીય પત્રકોનો આંતરીક ભાગ છે.

સમાન તારીખ ના અમારા અહેવાલ પ્રમાણે.

શાહ અને દલાલ વતી

ચાર્ટર્ડ એક્ઝાઉન્ટન્ટ

એફઆરએન ૧૦૫૪૩૨૩૬૮૮૫૪

નિયામક બોર્ડના વતી અને તેમના દ્વારા

સહી/-

મલય દલાલ

ભાગીદાર,

સભ્ય નં.૦૩૬૭૭૬

સહી/-

સંતોશ કુમાર

નિયામક / સીર્ટિઓ

ડીઆઈએન: ૦૭૮૫૪૧૯૮

સહી/-
બી. સી વલી

નિયામક

ડીઆઈએન: ૦૭૧૩૮૮૪૨

સ્થળ:- અમદાવાદ

તારીખ:- ૦૪/૦૭/૨૦૨૦

સ્થળ:- ગાંધીનગર

તારીખ:- ૦૪/૦૭/૨૦૨૦

બહુચાળ રેલ નિગમ લિ.
૩૧ મી માર્ચ, ૨૦૨૦ અંતિત નાણાંકીય પત્રકોને લગત નોંધો

૧. ભૂમિકા

૧. કંપનીની માહિતી :

૧. બહુચાળ રેલ કોર્પોરેશન લીમિટેડ એ ગુજરાત સરકારના તા.૦૫/૦૨/૨૦૧૮ ના રોજના ઠરાવ નં. એમઆઈએસ-૧૦-૨૦૧૭-૧૬૬૫-૧ - ૧ અન્વયેનો બહુચાળ - કાટોસણ રેલવે પ્રોજેક્ટ માટેનો એક સ્પેશીયલ પર્પસ વેહીકલ (એસપીવી) છે જેઓ ગુજરાત રાજ્યના કોટાસણ રોડ - બહેચાળ - ચાણાસ્મા - રણ્ણજના ફ્લેક્સિબિલિટી લાઈનના ગેજ ફેરફારને લગત ડેવલોપમેન્ટ, નાણાંકીય કામગીરી, આયોજન અને ઈમ્પલીમેન્ટેશનની કામગીરી કરશે.
૨. બોર્ડ ઓફ ડાયરેક્ટરો દ્વારા તા.૨૬ મી જુન, ૨૦૨૦ ના રોજ પસાર કરવામાં આવેલ ઠરાવ મુજબ નાણાંકીય પત્રકોને મંજૂરી આપવામાં આવેલ છે.

૩(અ) તૈયારીનો આધાર:-

અ. પૂર્તિનું નિવેદન :-

આ નાણાંકીય પત્રકો ભારતીય હિસાબી પદ્ધતિઓ (ઈન્ડ એએસ) મુજબ કંપનીજ (ઈન્ડિયન એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ) નીયમો, ૨૦૧૬ કે જે કંપની ધારા, ૨૦૧૩ (ધારા) કલમ ૧૩ માં નોટીફાઇ કરવામાં આવેલ છે અને તેના અન્ય પ્રાવધાનો મુજબ તૈયાર કરવામાં આવેલ છે.

કંપનીજ (એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ) નીયમો, ૨૦૦૯ અને તેના કલમ ૧૩ અને ધારાના અન્ય પ્રાવધાનુ મુજબ ત૧ માર્ચ, ૨૦૧૮ સુધીના નાણાંકીય પત્રકો તૈયાર કરવામાં આવેલા.

આ કંપનીના પહેલા નાણાંકીય પત્રકો છે કે જે ઈન્ડિયન એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ (ઈન્ડ એએસ), ઈન્ડ એએસ ૧૦૧, મુજબ તૈયાર કરવામાં આવેલ છે જેમાં પહેલી વખત ઈન્ડિયન એકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ લાગુ પાડવામાં આવેલ છે. ઈન્ડ એએસ તરફ કરવામાં આવેલ રૂપાન્તરણ અને તેનો જુના નાણાંકીય સ્થિતી પર થયેલ અસર, નાણાંકીય કામગીરી અને કંપનીના કેશ ફ્લો બાબતેની સમજૂતી નોંધ નંબર - ત૦ માં દર્શાવવામાં આવેલ છે.

કંપનીના હિસાબી પદ્ધતિઓની વિગત નોંધ ઉ (બી) માં દર્શાવેલ છે.

બી. કાર્યાત્મક અને કરન્સીની રૂપરેખા:-

આ નાણાંકીય પત્રકોને ભારતીય રૂપીયામાં (આઈએનઆર) માં તૈયાર કરવામાં આવેલ છે જે કંપનીનો કાર્યરત કર્નસી છે.

સી. અંદાજો અને નિર્ણયોનો ઉપયોગ:-

આ નાણાંકીય પત્રકો તૈયાર કરતી વખતે મેનેજમેન્ટ દ્વારા નિર્ણયો, અંદાજો અને ધારણાઓ કરેલ છે કે જે હિસાબી પદ્ધતિઓના અમલને અસર કરે છે અને એસેટ, લાયબલીટી, આવક અને ખર્ચને દર્શાવેલ છે. ખરેખરના પરીક્ષામો કરેલા અંદાજો થી જુદા હોઈ શકે છે.

અગત્યતા અંદાજો અને જજમેન્ટ

આ નોંધમાં ઉચ્ચ સ્તરના જજમેન્ટ અને ઝડપિતાની રૂપરેખા આપે છે અને તેવી આઈટમો કે જેને અદાજો અને એસેમ્પશનોના ધોરણે વધારે એટજેસ્ટ કરવામાં આવે અને તે ખરેખર કરતા જુદો એસેસ થાઈ તેને દર્શાવવામાં આવેલ છે. દરેક અંદાજો અને જજમેન્ટની વિગતવાર માહિતી લાગતા વળગતા નોંધોમાં આપવામાં આવેલ છે અને તેના આધારે દરેક આઈટમની ગણતરી નાણાંકીય પત્રકમાં કરવામાં આવેલ છે.

અગત્યના અંદાજો અને જજમેન્ટને અસરકરતા કોણો નીચે મુજબ છે:-

- અન્ય ક્ષેત્રો નીચે મુજબ છે.
- ચાલુ ચુક્કવવા પાત્ર વેરાનો અંદાજ
- પ્રોવીઝનો અને કન્ટીજન્સીની ઓળખ અને ગણત્રી:- રીસોર્સીસના આઉટ ફ્લો બાબતેની સંભાવનાઓ અને તેના કદની ગણત્રી.
- નાણાંકીય એસેટસ ની ક્ષતિગ્રશતતા

અદાજો અને તેને લગત એસેમ્પશનોને ઓનગોઈગ રીતે ચકાસવામાં આવેલ છે. હિસાબી અંદાજોને લગત તકલીફોને ઓળખવામાં આવેલ છે.

ડી. ફેર વેલ્યુની ગણત્રી:-

ફેર વેલ્યુ માટે કંપનીના ગણા બધા હિસાબી પદ્ધતિઓની અને ખુલાસાઓની જરૂરીયાત રહેલ છે, બસે નાણાંકીય અને બીન - નાણાંકીય એસેટસ અને જવાબદારીઓને લગત.

ફેર વેલ્યુઓને જુદા જુદા લેવલમાં વિભાગીત કરવામાં આવેલ છે અને તેનો આધાર નીચે જણાવેલ વેલ્યુઅશન પદ્ધતીઓ પર રહેલ છે.

- પ્રથમ લેવલઃ- સક્રિય બજારમાં નિર્ધારિત થયેલ કિંમત (એડઝસ્ટ કર્યા સીવાયના) કે જે એકજ પ્રકારના એસેટ અને જવાબદારીઓ માટે છે.

- બીજો લેવલઃ- લેવલ ૧ માં નિર્ધારિત કરેલ કિમતો સીવાયના કે જેને એસેટ કે લાયબલીટી, સીધી રીતે (એટલે કે કિમત તરીકે) કે આડકતરી રીતે (એટલે કે કિમતમાંથી પ્રાપ્ત થયેલ) નોંધવામાં આવેલ છે.
- ત્રીજો લેવલઃ- એસેટ કે લાયબલીટીમાંથી પ્રાપ્ત થયેલ ઈનપુટ કે ઓબજર્વેબલ માર્કેટ ડેટા (અનાઓઝરવેબલ - ઈનપુટ) પર આધારીત ન હોય.

જ્યારે કોઈ પણ એસેટ કે લાયબલીટીની ફેર વેલ્યુની ગણત્રી કરવામાં આવે ત્યારે કંપની દ્વારા દર્શાનીય બજાર કિમતનો ઉપયોગ કરવામાં આવે છે. જો કોઈ પણ એસેટ કે લાયબલીટીના ફેર વેલ્યુ માટે ઉપયોગ કરવામાં આવેલ ઈનપુટ જુદા જુદા ફેર વેલ્યુમાં આવતી હોય તો ફેર વેલ્યુની ગણત્રીને સૌથી નીચેના સ્તરના ઈનપુટ પર દર્શાવવામાં આવે છે કે સંપૂર્ણ ગણત્રી માટે જરૂરી છે.

કપની ફેર વેલ્યુના સ્તરો વચ્ચેના ટ્રાન્સફરને રીપોર્ટીંગ સમયગાળાના અંતે થયેલ ફેરફારોના આધારે ઓળખે છે.

ફેર વેલ્યુની ગણત્રીના સમયે કરેલ એસમ્પશાનો બાબતેની વિગત નીચે દર્શાવેલ નોંધોમાં સામેલ રાખેલ છે.

- નોંધ ૨૭ - નાણાંકીય રીસ્ક મેનેજમેન્ટના ઉદ્દેશો અને પોલીસીઓ
- નોંધ ૨૮ - ફેર વેલ્યુની ગણત્રી.

૩(બી) અગત્યના હિસાબી પોલીસીઓ

નીચે દર્શાવેલ હિસાબી પોલીસીઓ હાલના નાણાંકીય પત્રકોના સમયગાળા દરમ્યાન અમલમાં મુકવામાં આવેલ છે.

૧. નાણાંકીય ઉપકરણો:-

ઓળખ અને પ્રાથમીક ગણત્રીઓ

ટ્રેડ રીસીવેબલ ઉભા થાય ત્યારે જ તેની ઓળખ કરવામાં આવેલ છે. અન્ય તમામ નાણાંકીય એસેટ અને નાણાંકીય જવાબદારીઓને અગાઉથી જ કંપની ઓળખે છે કે જ્યારે તે ઈન્સ્ટ્રુમેન્ટના કરારના પ્રાવધાનોનો ભાગ બને છે.

એક નાણાંકીય એસેટ કે નાણાંકીય જવાબદારીને સૌધ્યમાં પ્રથમ તેના ફેર વેલ્યુમાં ગણવામાં આવે છે અને તેવા આઈટમો કે જે ફેર વેલ્યુમાં નથી તેને નફા નુકશાનથી (એફ્લીટીપીએલ) થી ગણત્રી કરવામાંઆવે છે, ટ્રાન્સેક્શનની કિમતને સીધી રીતે તેને પ્રાપ્ત કરીશું કરતી વખતે ગણત્રી કરવામાં આવે છે.

વર્ગીકરણ અને ત્યારબાદની ગણત્રી અને નફા અને નુકશાનઃ- નાણાંકીય એસેટસ

એમોરાઇઝડ કીમને નાણાંકીય એસેટઃ- આવા એસેટો પાછળથી તેના એમોરાઇઝડ કીમતે અસરકારક વ્યાજ પદ્ધતિથી ગણવામાં આવે છે. ઈમ્પ્રેમેન્ટ નુકશાનથી એમોરાઇઝડ કિમતમાં ઘટાડો થાય છે. વ્યાજની આવક, ફોરીન એક્શન્યુની પ્રાપ્તી અને નુકશાનોની ઓળખ નફા કે નુકશાન ઉપર થાય છે. કોઈ પણ પ્રકારના નફા કે નુકશાન કે તીરેકગનાઈઝેશનની

અસર નફા અને નુકશાનના પત્રકો પર થાય છે.

નાણાંકીય એસેટની સાચી કિંમત કોમ્પ્રીઝેન્સીવ આવક (એફ્વીટીઓસીઆઈ) ના આધારે :- તમામ ઈક્વીટી રોકાણોને ફેર વેલ્યુમાં ગણત્રી કરવામાં આવે છે. જેવા રોકાણો કે જે વેચાણ માટે કરવામાં ન આવેલ હોય અને જ્યા કંપની દ્વારા તેને એફ્વીટીઓસીઆઈ માં વર્ગીકરીત કરવાના વિકલ્યનો ઉપયોગ કરવામાં આવેલ હોય તેવા સંજોગોમાં રોકાણમાં થયેલ તમામ ફેર વેલ્યુ ચેન્જને અધર કોમ્પ્રીઝેન્સીવ ઈન્કમમાં (ઓસીઆઈ) માં દર્શાવવામાં આવે છે. એક્યુમીલેટ થયેલ નફા અને નુકશાનને ઓસીઆઈ માં દરેક ઈન્વેસ્ટમેન્ટના વેચાણથી થયેલ આવકમાં ફેરવર્ગીકરણ કરવામાં આવે છે.

નફા અને નુકશાનથી ફેર વેલ્યુને લગત નાણાંકીય એસેટસ (એફ્વીટીપીએલ)- આવા એસેટસ પાછળથી ફેર વેલ્યુ તરીકે આકવામાં આવે છે. નેટ નફા અને નુકશાન, જેમાં કોઈ વ્યાજ કે ડીવીડન્ટની આવકનો સમાવેશ થાય છે તે નફા કે નુકશાન તરીકે દર્શાવાય છે.

વર્ગીકરણ, પાછળથી કરવામાં આવેલ ગણત્રી અને નફો અને નુકશાનના:- નાણાંકીય જવાબદારીઓ

નાણાંકીય જવાબદારીઓને પાછળથી એમોરટાઇઝ કિમત પર ગણત્રી કરવામાં આવે છે અને તેમાં અસરકારક વ્યાજ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વેચાણ અને એક વર્ષમાં ચૂકવવા પાત્ર રકમો માટે કે જે બેલેન્સ શીટની તારીખથી એક વર્ષમાં હોય તેમાં રકમ કિમત ફેર આવા રોકાણોમાં રહેલ ફેર વેલ્યુ કિમત પ્રમાણે હોય છે.

ડીરેક્ગનાઈઝેશના:- નાણાંકીય એસેટ

કંપની દ્વારા કોઈપણ નાણાંકીય એસેટને ડીરેક્ગનાઈઝ ત્યારે કરવામાં આવે જ્યારે આવા નાણાંકીય એસેટમાંથી રહેલ કેશ ફ્લોના કોન્ટ્રાક્યુઅલ હક્ક પુરા થઈ જાય કે તેના દ્વારા કોન્ટ્રાક્યુયલ કેશ ફ્લો ના હક્કોને ટ્રાન્સફર કરવામાં આવે કે જેથી રહેલ તમામ માલીકીના રીસ્ક અને ફાયદાઓને ટ્રાન્સફર કરવામાં આવે કે જ્યારે કંપની દ્વારા તમામ માલીકીના રીસ્ક અને ફાયદાઓને ટ્રાન્સફર કે રીટેઇન કરવામાં ન આવે અને તેના દ્વારા નાણાંકીય એસેટ પર કોઈ પણ પ્રકારનો નિયંત્રણ રહે નહીં.

જો કંપની દ્વારા તેવા લેવડ ટેવડો કરવામાં આવે કે જેથી તેના દ્વારા બેલેન્સ શીટમાં દર્શાવેલ એસેટને ટ્રાન્સફર કરવામાં આવે પરંતુ તેના દ્વારા તમામ રીસ્ક અને આવકને પોતાની પાસે રાખવામાં આવે તો આવા ટ્રાન્સફર કરવામાં આવેલ એસેટને ડીરેક્ગનાઈઝ કરવામાં ના આવે.

ડીરેક્ગનાઈઝેશના:- નાણાંકીય જવાબદારીઓ

કંપની દ્વારા કોઈ નાણાંકીય જવાબદારીઓને ત્યારે ડીરેક્ગનાઈઝ કરવામાં આવે છે કે જ્યારે તેને લગત કરારની જવાબદારીઓને પુરી કે રદ કરવામાં આવેલ હોય કે તે અભિપૂર્ણ થઈ ગયેલ હોય.

કંપની દ્વારા ત્યારે પણ એક નાણાંકીય જવાબદારીને ડીરેક્ગનાઈઝ કરવામાં આવે છે જ્યારે તેના ટર્મમાં ફરેફાર કરવામાં

આવેલ હોય અને નવા ટર્મ મુજબ કેશ ફ્લોમાં ખુબજ વધારે ફેરફારો હોય. હાલના કિસ્સામાં, એક નવા નાણાંકીય જવાબદારી કે જે ફેરબદલી કરેલ શરતો મુજબ તેના ફેર વેલ્યુ પર ઓળખવામાં આવેલ છે. પૂરી થયેલ નાણાંકીય જવાબદારીને લગત રકમ હાથ પર રાખવા અને ફેરફાર મુજબના નવા નાણાંકીય જવાબદારીને ઓળખવામાં રહેલ ફરકને નશા અને નુકશાન માં દર્શાવવામાં આવે છે.

ઓફ્સેટીંગ

નાણાંકીય એસેટ અને નાણાંકીય જવાબદારી એક ઓફ્સેટ છે અને બેલેન્સ શીટમાં દર્શાવેલ નેટ રકમ ત્યારે જ હોય જ્યારે કંપની પાસે હાલમાં રકમને ઓફ્સેટ કરવા માટે કાયદાકીય હક્ક રહેલ હોય અને તે તેને સેટલ કરવા માગતી હોય કે એસેટ રીલીઝ કરવા અને એક સાથે જવાબદારીઓ સેટલ કરવા માંગતી હોય.

૨. કરન્ટ અને નોન કરન્ટ વર્ગીકરણ:-

કંપની દ્વારા બેલેન્સ શીટમાં એસેટ અને જવાબદારીઓ દર્શાવવામાં આવે છે અને તેનો આધાર કરન્ટ / નોન કરન્ટ વર્ગીકરણ છે. એસેટને કરન્ટ તરીકે ત્યારે દર્શાવવામાં આવે જ્યારે:-

(એ) તેને રીયલાઈઝ કરવા, કે વેચવા કે કંપનીની જરૂરીયાતો માટે ઉપયોગ કરવાનું હોય ત્યારે.

(બી) પ્રાથમીક ધોરણે ધંધા માટે રાખવામાં આવેલ હોય.

(સી) રીપોર્ટીંગની તારીખથી ૧૨ માસમાં તેને રીયલાઈઝ કરવાની થાય તો.

(ડી) રોકડ કે રોકડ સમાન હોય અને તેની લેવડ ટેવડ કરવામાં પ્રતિબંધ ન હોય કે તેને જવાબદારી પુરી કરવા માટે રીપોર્ટીંગની તારીખથી ૧૨ માસમાં સેટલ કરવાની હોય ત્યારે.

બાકી રહેલ તમામ એસેટોને નોન - કરન્ટ તરીકે વર્ગીકરણ કરવામાં આવે છે.

લાયબલીટી ત્યારે કરન્ટ છે કે જ્યારે:-

(એ) તે કંપની દ્વારા તેના સામાન્ય કમે સેટલ કરવામાં આવનાર હોય ત્યારે.

(બી) તેને ફંક્શન ધંધા માટે રાખવામાં આવેલ હોય તો.

(સી) તેને રીપોર્ટીંગ તારીખથી ૧૨ માસમાં સેટલ કરવાની હોય તો.

(ડી) રીપોર્ટીંગની તારીખથી ૧૨ માસમાં કંપની પાસે જવાબદારી સેટલ કરવા માટેનો બીનશરતી હક્ક રહેલ ન હોય ત્યારે.

બાકી રહેલ તમામ લાયબલીટીને નોન - કરન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

કામગીરીની પ્રક્રિયા

પ્રોસેસ માટે પ્રામ કરવામાં આવેલ એસેટ અને તેનાથી રકમ કે તેના સમાન્તર કોઈ લાભ પ્રામ થયા વર્ચેના સમયને ઓપરેટીંગ સાયકલ રહેવામાં આવે છે.

૩. અડયણો:-

નાણાંકીય ઉપકરણોનો ઈમ્પેરમેન્ટ.

નાણાંકીય એસેટસમાં થનાર સંભવિત કેડીટ લોસ માટે કંપનીએ લોસ એલાવન્સની ઓળખ કરેલ છે અને તેની ગણત્રી એમોરાઇઝ કોસ્ટ પર કરવામાં આવેલ છે.

દરેક રીપોર્ટ તારીખે કંપની ચકાસે છે કે એમોરાઇઝ કોસ્ટ પર કરવામાં આવેલ નાણાંકીય એસેટ કેડીટ ઈમ્પરડ છે કે નહિ. એક નાણાંકીય એસેટને ત્યારે જ કેડીટ ઈમ્પાર્ડ ગણવામાં આવે જ્યારે નાણાંકીય એસેટના ભવિષ્યના કેશ ફલો પર કોઈ નિર્ધારીત અસર થયેલ હોય.

કંપની લોસ એલાવન્સની ગણત્રી કેડીટ લોસના સમાન્તરના રકમમા તેના પૂર્ણ જીવન કાળમાં કરે છે. તેના જીવન કાળ દરમિયાન થનાર કેડીટ લોસ સંભવિત કેડીટ લોસ છે કે જે નાણાંકીય ઈન્સ્ટ્રુમેન્ટના જીવનકાળમાં થનાર ડીફોલ્ટ ઈવેન્ટ પર આધારીત છે.

કોઈ પણ નાણાંકીય એસેટના કેડીટ રીસ્ક કે જેમાં નોંધપાત્ર વધારો થયેલ છે તેને નિર્ધારીત કરતી વખતે કે કંપની લાગુ પડતા માહિતીની ચકાસણી કરે છે અને કોસ્ટ અને મહેનતને ધ્યાને લેતી નથી. આમા કવોન્ટીટેટીવ અને કવોલીટેટીવ માહિતી અને ચકાસણાનીનો સમાવેશ થાય છે કે જે કંપનીના ભૂતકાળના અનુભવ અને પ્રામ થયેલ કેડીટ એસેસમેન્ટનો સમાવેશ થાય છે કે જેમાં ભવિષ્યની માહિતીનો સમાવેશ થાય છે.

સંભવિત કેડીટ લોસની ગણત્રી

સંભવિત કેડીટ લોસ એટલે કે કેડીટ લોસનો પ્રોબેલ્લીટીના આધારે કરવામાં આવેલ અંદાજો. કેડીટ લોસની ગણત્રી કેશ ફલો શોર્ટફોલની હાલની કિમત પર આધારીત છે (એટલે કે કરાર મુજબ કંપનીને થયેલ કેશ ફલો અને કંપનીને મળવાપાત્ર કેશ ફલોમાં રહેલ તરફાવત)

બેલેન્સ શીટમાં રહેલ સંભવિત કેડીટ લોસને લગત પ્રેઝન્ટેશન

એમોરાઇઝ કિમત મુજબ નાણાંકીય એસેટને લગત લોસ એલાવન્સને એસેટના ગ્રોસ કેરીયીગ એમાઉન્ટમાંથી બાદ કરવામાં આવે છે.

માંડવાળ કરવું

નાણાંકીય એસેટના ગ્રોસ રકમને માંડવાળ કરવામાં આવેલ છે (પુરી રીતે કે તેનો અમુક ભાગ) અને તે એ હદે કે વસુલાતની કોઈ ખરેખરની સંભાવના ન રહે. સામાન્ય કિસ્સામાં જ્યારે કંપની તેમ નક્કી કરે છે કે કર્જદાર પાસે એસેટ કે આવકનો કોઈ સ્વોત ન હોય કે જેથી માંડવાળ કરવાની રકમ ભરવા માટે કોઈ નાણાં રહેલ ન હોય. પરંતુ જે નાણાંકીય એસેટને માંડવાળ કરવામાં આવેલ હોય તેને પણ એનફોર્સમેન્ટ કામગીરી લાગુ પડે છે કે જેનાથી કંપનીના રકમ વસુલ કરવાની કામગીરીને પૂર્ણ કરી શકાય.

નોન - ફાઈનાન્શીયલ એસેટનો ઈમ્પેરીમેન્ટ

કંપની પાસે રહેલ ઈન્વેન્ટરી કે ડીફર્ડ ટેક્ષ એસેટ સીવાયના નોન - ફાઈનાન્શીયલ એસેટ કે જે દરેક રીપોર્ટિંગની તારીખે રીવ્યુ કરવામાં આવેલ કે જેથી તે નિર્ધારીત કરવામાં આવે કે ઈમ્પેરીમેન્ટ માટે કોઈ સંકેતો રહેલ નથી. જો આવા સંકેતો હોય તો તેવા એસેટના વસુલ કરવાની થતી રકમનો અંદાજ લેવામાં આવે છે.

૪. બોરોઇંગ કિમત:-

બોરોઇંગ કિમત વ્યાજ અને અન્ય કોસ્ટ (જેમાં વિદેશી નાણાંને લગત એક્ષચેન્જમાં ફેરફારનો સમાવેશ થાય છે કે જે વ્યાજની કિમત માટે એડજેસ્ટ કરવામાં આવેલ હોય) કે જે નાણાં બોરો કરવામાંના સંદર્ભે થયેલ હોય. બોરોઇંગ કોસ્ટ કોઈ પણ એસેટ પ્રામ કરવા કે નિર્માણ કરવા ઉપર સીધો લાગુ પડે છે કે જે તેથાર થવામાં લાબો સમયગાળો લેતો હોય શરૂ થવામાં અને તેનો ઉપયોગ એસેટની કિમતનો ભાગ હોય. અન્ય બોરોઇંગ કોસ્ટને જે સમયગાળામાં થયેલ હોય તે સમયગાળામાં ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે.

૫. બોરોઇંગ:-

બોરોઇંગને કરન્ટ લાયબલીટી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને ફક્ત ત્યારે કે જ્યારે કંપનીને રીપોર્ટિંગ સમયગાળાથી ૧૨ મહિના પછી એવો ભીન શરતી હક્ક રહેલ હોય કે તેઓ લાયબલીટી માટે સેટલમેન્ટને ફેરવી શકે. જ્યારે લાબા ગાળાની લોન વ્યવસ્થાના પ્રાવધાનોમાં કોઈ ભ્રીય થયેલ હોય અને તે પણ રીપોર્ટિંગ સમયગાળા પહેલા કે તેના અંતે કે જેની એવી અસર થાય કે આવા લાયબલીટી રીપોર્ટિંગની તારીખે માંગણી પર ચૂકવવા પાત્ર થાય ત્યાર કંપની આવા લાયબલીટીને કરન્ટ તરીકે નોંધતી નથી, અને જો નાણાં આપનાર સ્વીકારે તો રીપોર્ટિંગના સમયગાળા બાદ અને નાણાંકીય પત્રકોની મંજુરી પહેલા આવા ચૂકવણાની માંગણી ભ્રીયના કારણે થયેલ હોય તો.

૬. રેવન્યુની મંજુરી:-

રેવન્યુને ત્યારે ઓળખવામાં આવે છે કે જ્યારે તેની ઉધરાણીની / કે પ્રામિની પુરતી સંભાવના રહેલ હોય.

વ્યાજના આવકને ઓળખવા માટે અસરકારક વ્યાજ પધ્યતિનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો એક્યુરલ બેઝીસ

પર હિસાબ કરવામાં આવે છે અને મોબલાઈ ઝેશન એડવાન્સ નું વ્યાજ પ્રામથ્યે દર્શાવવામાં આવે છે.

અન્ય તમામ આવકના આઇટમોને એક્યુર્લ બેઝ પર એકાઉન્ટીંગ કરવામાં આવે છે.

૭. પ્રાવધાનો (કર્મચારી ફાયદા સિવાયના):-

જો એક પ્રાવધાનને કોઈ જુના ઈવેન્ટના કારણે મંજુરી આપવામાં આવે તો કંપનીને હાલમાં પણ એવી જવાબદારી રહેલ છે કે જેનો અદાજ લઈ શકાય અને તે સંભવિત છે કે નાણાંકીય બેનીફીટની જરૂર આવા કાયદાકીય કે કરારી જવાબદારીઓને પુરી કરવા માટે પડી શકે છે. પ્રાવધાનો તેના પર નક્કિ કરવામાં આવે છે કે ભવિષ્યમાં કેટલો કેશ ફલો થઈ શકે (બેલેન્સ શીટની તારીખે થનાર સંભવિત ખર્ચના અંદાજોના આધારે) અને તે પણ વેરા પહેલાના દર મુજબ કે ચાલતા બજાર અંદાજો અને તે સમયે રહેલ પૈસાની કિમત મુજબ અને જવાબદારીઓમાં રહેલ રીસ્ક મુજબ રહે છે.

કન્ટીજન્સીઓ

તેવા કન્ટીજન્સી નુકશાનો કે જે દાવાઓ, લીટીગેશન, એસેસમેન્ટ, ફાઈન, પેનલ્ટી વગેરેને લગત હોય તેના પ્રાવધાનોને ઓળખવામાં આવેલ છે કે જ્યારે તેવી સંભાવના હોય કે લાયબલીટી થઈ શકે અને તેની રકમનો અંદાજ લઈ શકાય.

૮. કન્ટીગન્સીને લગત જવાબદારીઓ:-

કન્ટીજન્સીને ત્યારે દર્શાવવામાં આવે કે જ્યારે એવી સંભવિત જવાબદારી હોય કે જુના કોઈ ઈવેન્ટને કારણે ઉદભવે અને તેનો આસ્તિત્વ ત્યારે જ નિશ્ચિત થાય કે જ્યારે ભવિષ્યમાં એક કે તેનાથી વધારે ઈવેન્ટો થાય કે જે કંપનીના પુરા નિયંત્રણમાં ન હોય કે ભૂતકાળના ઈવેન્ટના કારણે હાલમાં કોઈ જવાબદારીઓ ઉભી થઈ હોય કે જ્યાં આવા ઈવેન્ટને સેટલ કરવા માટે નાણાં ચૂકવવાની જરૂરીયાત ઉભી થાય કે આવા થનાર ખર્ચનો પુરેપુરો અંદાજ પ્રામથ્યે રાજી કરી ન શકાય.

૯. આવક વેરો:-

આવક વેરામાં કરન્ટ અને રીફર્ડ ટેક્ષનો સમાવેશ થાય છે. એવી બાબતો કે જે ઈક્વિટી અથવા અન્ય કોમ્પ્રીઝેન્સીવ આવક સિવાયની બાબતને નફા કે નુકશાનમાં દર્શાવવામાં આવે.

કરન્ટ ટેક્ષ

કરન્ટ ટેક્ષમાં ચૂકવવા પાત્ર વેરો કે ટેક્ષેબલ આવકમાંથી મળવાપાત્ર આવક કે નુકશાન જેતે વર્ષનો હોય અને જુના વર્ષોના આધારે ચૂકવવા પાત્ર કે મળવા પાત્ર વેરામાં એડજેસ્ટ કરવામાં આવે છે. કરન્ટ ટેક્ષની રકમ તે દર્શાવે છે કે વેરાની રકમનો સૌથી સારો અંદાજ શુદ્ધ કે જે ચૂકવવા કે મળવાપાત્ર છે અને તેના પર આવક વેરાની અનિશ્ચિતતાને ધ્યાને લીધેલ.

હોય. તની ગણત્રી વેરા દરો (અને વેરાના નિયમો) કે જે રીપોર્ટિંગની તારીખે લાગુ પડતા હોય તેના આધારે કરવામાં આવે છે.

કરન્ટ ટેક્ષ અને કરન્ટ ટેક્ષની જવાબદારીઓ ઓફસેટ ત્યારેજ હોય જ્યારે લાગુ પડતા રકમ પર કોઈ કાયદાકીય હક્કો કે અધિકારો રહેલ હોય, અને તેનો ઉદ્દેશ્ય એસેટને પ્રાપ્ત કરવા અને તેને નેટ બેઝીસ કે એક સાથે સેટલ કરવા માટે થાય છે.

તેવા વેરાના લાભો કે જે કર્મચારી સ્ટોક ઓપરશનના કારણે પ્રાપ્ત થયેલ હોય કે જે કોમ્પ્લીન્સીલ આવકમાં જમા કરવામાં આવેલ આવકમાં ચાર્જ કરવામાં આવેલ વળતર કરતા વધારે હોય ત્યારે.

ડીફર્ડ ટેક્ષ

ડીફર્ડ ટેક્ષને તે રીતે ઓળખવામાં આવે છે કે તે એસેટની રકમ અને જવાબદારીઓમાં રહેલ ફેરફારો કે જેનો ઉપયોગ નાણાંકીય રીપોર્ટિંગ માટે કરવામાં આવેલ હોય અને તેવા રકમને વેરાના કામે ઉપયોગ કરવામાં આવેલ હોય. ડીફર્ડ ટેક્ષને એમ પણ ઓળખવામાં આવે છે કે જેમા કેરી ફોર્વર્ડ કરવામાં આવેલ ટેક્ષ અને ટેક્ષ કેરીટ હોય. ડીફર્ડ ટેક્ષને ત્યારે રેકગનાઈઝ કરવામાં આવતી નથી જ્યારે:-

- કોઈ પણ લેવડ દેવડ વખતે ટેક્ષના નફા / નુકશાની ગણત્રી પર અસર ન કરે તો તેવા એસેટ કે લાયબલીટીમાં અસ્થાઈ ફેરફાર હોય તો.
- ગુડવીલના પહેલા ઓળખ વખતે રહેલ અસ્થાઈ ટેક્ષમાં ફેરફારો.

ડીફર્ડ ટેક્ષ એસેટને તે હદ સુધી ઓળખવામાં આવે છે કે જ્યારે તેવી સંભાવના રહેલ હોય કે ભવિષ્યમાં ટેક્ષવાળો નફો ઉપલબ્ધ હોય અને તેનો ઉપયોગ કરી શકાય. બીન વપરાયેલ વેરાના નુકશાનોનો અસ્થિત્વ તે ચોક્કસપણે દર્શાવે છે કે ભવિષ્યમાં વેરામાં નફો રહેશે નહિ. આથી, નુકશાનો ઈતીહાસ હોય તો, કંપનીએ ડીફર્ડ ટેક્ષ એસેટને ત્યારે જ ઓળખવી જોઈએ કે જ્યારે તેની પાસે જરૂરીયાત મુજબ ટેક્ષમાં તફાવત રહેલ હોય કે ત્યારે જ્યારે એવી ચોક્કસ સાખીતી હોય કે જરૂરીયાત મુજબનો ટેક્ષમાં નફો ઉપલબ્ધ રહેશે કે જેની સામે ડીફર્ડ થયેલ ટેક્ષ એસેટ પ્રાપ્ત કરી શકાય. ડીફર્ડ થયેલ ટેક્ષ એસેટ - રેકગનાઈઝ થયેલ કે રેકગનાઈઝ થયા વગરની, તેનો રીવ્યુ દરેક રીપોર્ટિંગની તારીખે કરવામાં આવે છે અને તેને તે હદે રેકગનાઈઝ કરવામાં આવે છે કે જ્યારે તેવી સંભાવના રહેલ હોય કે સંબંધિત વેરાના ફાયદાઓ પ્રાપ્ત કરી શકાય.

ડીફર્ડ ટેક્ષની ગણત્રી તેવા વેરાના દર પર કરવામાં આવે છે કે જે તેવા સમયે લાગુ પડે કે જ્યારે તે એસેટ ઉભો થયો હોય કે જવાબદારી પૂરી થઈ હોય અને રીપોર્ટિંગના સમયે જે નિયમો અસરમાં હોય ત્યારે.

ડીફર્ડ ટેક્ષની ગણત્રી તે દર્શાવે છે કે વેરાની જવાબદારીઓ પાછળથી આવશે અને તે રીતે આવશે કે જે રીતે કંપનીની અપેક્ષા છે, અને તે પણ રીપોર્ટિંગની તારીખે, કે જેથી એસેટ કે લાયબલીટીના કેરીએંગ એમાઉન્ટને વસુલ કે ચૂકવી

શકાય.

ડીફર્ડ ટેક્ષ એસેટ અને લાયબલીટી ત્યારે ઓફસેટ હોય જ્યારે કરન્ટ ટેક્ષ લાયબલીટી કે એસેટને ઓફિસેટ કરવાનો કોઈ કાયદાકીય લાગુ કરવાનો હક્ક રહેલ હોય, અને તે સમાન સંતા દ્વારા વસુલ કરવામાં આવેલ આવક વેરાને લગત હોય કે સમાન ટેક્ષ એન્ટીટી કે જુદો ટેક્ષ એન્ટીટી હોય, પરંતુ તે કરન્ટ ટેક્ષ લાયબલીટી અને એસેટને નેટ બેઝીસના આધાર સેટલ કરવા માગતી હોય કે તેઓના ટેક્ષ એસેટ કે લાયબલીટીને એકસાથે પ્રાપ્ત કરી શકાય.

ટાઇભીગના ફેરફારને લગત ડીફર્ડ ટેક્ષ કે જે તે વર્ષના ટેક્ષ હોલીડે પીરીયડ રેકગનાઇઝ થયા બાદ રીવર્સ કરવામાં આવેલ હોય.

૧૦. શેરદીઠ આવક:-

સામાન્ય આવક / (નુકશાન) પ્રતિ શેરની ગણત્રી વર્ષના નેટ નફા કે નુકશાનનો ભાગાકાર કરીને કરવામાં આવે છે કે જે ઈક્વીટી શેરધારકોને લગત હોય કે જે તે વર્ષના આઉટસ્ટેન્ડીંગ ઈક્વીટીશેરની સંખ્યાના સરેરાશ મુજબ હોય છે. દરેક બોનસ અને શેર વિભાજનને જે તે વર્ષના આઉટસ્ટેન્ડીંગ ઈક્વીટી શેરના સરેરાશ સંખ્યા સામે સરભર કરવામાં આવે છે. દરેક શેરના ડાયલ્યુટેડ આવક / (નુકશાન) ની ગગણત્રી કરવા માટે દરેક ઈક્વીટી શેર ધારકના વર્ષમાં થયેલ નફા કે નુકશાન અને વર્ષમાં આઉટસ્ટેન્ડીંગ રહેલ શેરોના વેઇટ એવરેજ સંખ્યાને એડજેસ્ટ કરવામાં આવે છે.

૧૧. કેશ અને કેશના સમાન્તરો:-

એક બેલેન્સ શીટમાં કેશ અને કેશ સમાનતરોમાં બેન્કમાં રહેલ કેશ અને હાથ પર રહેલ અને ટુકા ગાળાના રીપોર્ટીંગ કે જેની મેચયુરીટી સમય ત્રણ માસ કે તેનાથી ઓછો હોય તેનો સમાવેશ થાય છે અને તેના પર વેલ્યુમાં ફેરફારમાં રહેલ રીસ્કની અસર રહેલ છે.

કંપનીના કેશ મેનેજમેન્ટના આંતરીક ભાગ તરીકે કેશ ફલો, કેશ અને કેશના સમાન્તર કે જેમાં કેશ અને શૉર્ટ ટર્મ રીપોર્ટીંગ, કે જે ઉપર દર્શાવવામાં આવેલ છે અને બેન્ક ઓવરડ્રાફ્ટના નેટનો સમાવેશ થાય છે.

૧૨. રીપોર્ટીંગના સમયગાળા પછી થયેલ ઈવેન્ટ્સ:-

તેવા ઈવેન્ટને એડજેસ્ટ કરવા કે જે રીપોર્ટીંગ પીરીયડના અંતે રહેલ પરિસ્થિતિ દર્શાવે છે. નાણાંકીય પત્રકોને ઈશ્યુના એથોરાઇઝેશન પહેલા દરેક ઈવેન્ટ માટે એડજેસ્ટ કરવામાં આવે છે. એડજેસ્ટ કર્યા સિવાયના ઈવેન્ટ તે દર્શાવે છે કે રીપોર્ટીંગ સમયગાળાના અંતે કેવી પરિસ્થિતીઓ રહેલ છે. રીપોર્ટીંગની તારીખે પછી થયેલ નોન - એડજસ્ટીંગ ઈવેન્ટને એકાઉન્ટ કરવામાં આવતી નથી પરંતુ તેને ડીસ્કોલસ કરવામાં આવે છે.

૧૩. પ્રોપર્ટી, પ્લાન્ટ અને ઉપકરણ:-

એવી મિલકત ઉપર કરેલા ખર્ચ કે જે મિલકત નું કાર્ય પ્રગતિમાં છે તે વર્ક ઈન પ્રોગ્રેસમાં સમાવેશ કરેલ છે. તમામ સીધી રીતે ઓળખાયેલ ખર્ચાઓ, આઈડેન્ટીકલ કે બાંધકામની કામગીરી કે જે પ્રોજેક્ટના બાંધકામને લગત હોય કે જે કમિશન થયેલ હોય તેને કેપીટલ વર્ક ઈન પ્રોગ્રેસ (સીડબલ્યુઆઈપી) કહે છે અને તેના કમિશનિંગ પછી તેને ફિક્સ એસેટ તરીકે ટ્રાન્સફર/એલોટ કરવામાં આવે છે.

વધુમાં, પ્રોપર્ટી, પ્લાન્ટ કે ઉપકરણ પ્રામ કરવા માટે આપવામાં આવેલ એડવાન્સ કે જે દરેક બેલેન્સ શીટની તારીખે આઉટસ્ટેન્ડીંગ હોય તેને કેપીટલ એડવાન્સ તરીકે નોન - કરન્ટ એસેટમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

બહુચારાજુ રેલ કોપરિશન લિ.
૩૧ મી માર્ચ, ૨૦૨૦ અંતિમ નાણાંકીય પત્રકોની નોંધ
(રકમ રૂ.માં)

વિગત	૩૧-૩-૨૦૨૦ અંતિમ	૩૧-૩-૨૦૧૯ અંતિમ
૪ કેપીટલ વર્ક ઇન પ્રોગ્રેસ જેમાં પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ ખર્ચના હિસાબે કુલ	૮૬૧૮૧૮	-
૫ ડીફર્ડ ટેક્ષ એસેટ કે જેનો સંબંધ ડીફર્ડ ટેક્ષ એસેટ્સ (નેટ) ડીફર્ડ ટેક્ષ એસેટ ડીફર્ડ ટેક્ષ એસેટને લગત લાયબલીટી નેટ ડીફર્ડ ટેક્ષ એસેટ	૮૬૧૮૧૮	-
૬ અન્ય નોન - કરન્ટ એસેટ કેપીટલ એસેટ વર્કની કામગીરી માટે ઓડવાન્સ - કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન લીમીટેડ (કેપીટીએલ)	૧૩૦૪૮૭૫૬૮	-
કુલ	૧૩૦૪૮૭૫૬૮	-
૭ કેશ અને કેશ ઈક્વિલેન્ટ બેક સાથે રહેલ સીલક યેસ બેંક સેવીગ ખાતું ૦૧૮૬૯૪૬૦૦૦૦૧૨૪૩ યસ બેંક કરન્ટ ખાતું ૦૧૮૬૯૪૭૦૦૦૦૦૧૮૪ કુલ	-	૭૪૦૮૪૦૦
૮ કરન્ટ ટેક્ષ એસેટ (નેટ) કુલ	૧૩૮૦૦૭૬	-
૯ અન્ય કરન્ટ એસેટ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પ પાસેથી પ્રામ થયેલ શેર કેપીટલ કેશ કે અન્ય રીતે રેવન્યુ સત્તા પાસેથી મળવાપાત્ર રકમ પ્રામ થનાર ટીડીએસ પ્રામ થનાર જીએસ્ટી	-	૨૬૦૦૦૦૦
કુલ	૪૨૪૮૧	-
	૩૫૩૨૫૫૦	-
	૩૫૭૫૦૩૧	૨૬૦૦૦૦૦

વિગત	૩૧-૩-૨૦૨૦		૩૧-૩-૨૦૧૯	
	અંતિત		અંતિત	
૧૦ ઈક્વીટી શેર કેપીટલ ઓપોરાઈઝ ૨૨,૫૦,૦૦,૦૦૦ (ગત વર્ષ - ૧૦,૦૦,૦૦૦) રૂ. ૧૦ ના ઈક્વીટી શેર કુલ ઈશ્યુ કે સબસ્કાઈભ થયેલ ૧૦,૦૦,૦૦૦ ઈક્વીટી શેર પ્રતિ રૂ. ૧૦ ના કુલ્લી પેડ અપ. કુલ પેડ-અપ કેપીટલ:- ૧૦,૦૦,૦૦૦ ઈક્વીટી શેર પ્રતિ રૂ. ૧૦ ના કુલ્લી પેડ અપ. કુલ	૨૨૫૦૦૦૦૦૦૦		૧૦૦૦૦૦૦૦	
	<u>૨૨૫૦૦૦૦૦૦૦</u>		<u>૧૦૦૦૦૦૦૦</u>	
	૧૦૦૦૦૦૦૦		૧૦૦૦૦૦૦૦	
	<u>૧૦૦૦૦૦૦૦</u>		<u>૧૦૦૦૦૦૦૦</u>	
	૧૦૦૦૦૦૦૦			
	<u>૧૦૦૦૦૦૦૦</u>			

નોંધો:-

(૧) સમયગાળા શરૂઆતે અને અંતે આઉટસ્ટેન્ડીંગ શેરોના રીકન્સીલીએશન

વિગત	૨૦૧૯-૨૦		૨૦૧૮-૧૯	
	શેરોની સંખ્યા	રકમ	શેરોની સંખ્યા	રકમ
વર્ષની શરૂઆતમાં	-	-	-	-
ઉમેરો : વર્ષ દરમાન ઈશ્યુ થયેલ	૧૦૦૦૦૦૦	૧૦૦૦૦૦૦૦	-	-
વર્ષના અંતે આઉટસ્ટેન્ડીંગ	<u>૧૦૦૦૦૦૦</u>	<u>૧૦૦૦૦૦૦૦</u>		

(૨) ઈક્વીટી શેરને લગત શરતો / છક્કો

- કંપની પાસે એક જ કલાસના ઈક્વીટી શેરો છે અને તેની કિંમત રૂ. ૧૦/- પ્રતિ શેર છે.
- દરેક શેર ધારકને પ્રતિ શેર એક વોટ પ્રાપ્ત છે.
- જો કંપનીનું લીક્વીડેશન થાય તો ઈક્વીટી શેર ધારકોને બધી લાયબલીટીઓ ચૂકવ્યા બાદ કંપની પાસે રહેલ એસેટો પર હક્ક રહેશે. તેની વહેચણી શેર ધારકો પાસે રહેલ ઈક્વીટી શેરોની સંખ્યા મુજબ રહેશે.

(૩) શેરોની ફાળવણી

- ચાલુ વર્ષે કંપનીએ નીચે દર્શાવેલ દરેક પ્રમોટરોને રૂ. ૧૦/- ના એકઅંશ ૧૦,૦૦,૦૦૦ ઈક્વીટી શેરોની ફાળવણી કરેલ છે.
- ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ (જી - રાઈડ) રૂ. ૧૦/- પ્રતિ શેર એવા ૪,૧૦,૦૦૦ ઈક્વીટી શેર.
- મારુતી સુજુકી ઈન્ડીયા લીમીટેડ (એમએસઆઈએલ) ને રૂ. ૧૦/- પ્રતિ શેર એવા ૩,૩૦,૦૦૦ ઈક્વીટી શેર.
- ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (જાઈડીસી) ને રૂ. ૧૦/- પ્રતિ શેર એવા ૨,૬૦,૦૦૦ ઈક્વીટી શેર.

(૪) ૫% કરતા વધારે શેર કેપીટલ ધરાવતા શેર ધારકોની વિગત નીચે મુજબ છે.

શેર ધારકનું નામ	શેરોની સંખ્યા	૩૧ માર્ચ ૨૦૨૦ અંતિમ	૩૧ માર્ચ, ૨૦૧૯ અંતિમ
		% હોલ્ડિંગ	% હોલ્ડિંગ
ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર	૪૧૦૦૦૦	૪૧.૦૦%	-
ટેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ (જી - રાઈડ)			
મારુતી સુજુકી ઈન્નીયા લીમીટેડ (એમએસઆઈએલ)	૩૩૦૦૦૦	૩૩.૦૦%	-
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ટેવલોપમેન્ટ કોર્પોરેશન (જીઆઈડીસી)	૨૬૦૦૦૦	૨૬.૦૦%	-
કંપનીના રેકૉર્ડ મુજબ કે જેમાં તેના શેર ધારકો / સભ્યોના રજીસ્ટર, ઉપર દર્શાવેલ શેર ધારણ કાયદા મુજબ અને શેરના ખરેખરના માલિક છે.			
ચાલુ સાલે કંપનીએ કોઈ પણ બોનસ શેર ઈશ્યુ કરેલ નથી.			
૧.૧ અન્ય ઈક્વીટી			
શીટેઇન કરેલ આવક			
શીટેઇન કરેલ આવક મુજબ ઓપનીંગ બેલેન્સ ઉમેરો / ઘટાડો એડજેસ્ટમેન્ટ વર્ષ માટે	(૧૬૧૧૩૮૩૫)	-	-
નેટ (નુકશાન) / નફો ચાલુ સાલે	(૨૧૦૮૩૪૭૧)	(૧૬૧૧૩૮૩૫)	
બંધ સીલ્ડક	(૩૭૧૯૭૪૦૬)	(૧૬૧૧૩૮૩૫)	
કુલ રીજર્વ અને સરખસ	(૩૭૧૯૭૪૦૬)	(૧૬૧૧૩૮૩૫)	
૧.૨ શેર કેપીટલ મની એલટ કરવામાં બાકી રહેલ રકમ			
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ટેવલોપમેન્ટ કોર્પોરેશન (જીઆઈડીસી)	-	૨૬૦૦૦૦૦૦	
ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ (જી-રાઈડ)	-	૪૧૦૦૦૦૦૦	
મારુતી સુજુકી ઈન્નીયા લીમીટેડ (એમએસઆઈએલ)	-	૩૩૦૦૦૦૦૦	
કુલ		૧૦૦૦૦૦૦૦૦	
૧.૩ બોરોઝિંગ - કુરન્ટ			
ટુકા ગાળાના બોરોઝિંગ			
સંબંધિત પક્ષકારોને લોન અને એડવાન્સ - અન સેક્યૂર્ડ			
ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ (જી - રાઈડ)	૧૪૩૧૨૭૮૫૪	-	
કુલ	૧૪૩૧૨૭૮૫૪		

૧૪	ટ્રેડ ચુકવવાપાત્ર - કરન્ટ માઈકો એન્ટરપ્રાઇઝ અને સ્માલ એન્ટરપ્રાઇઝ ના કુલ આઉટસ્ટેન્ડીંગ માઈકો એન્ટરપ્રાઇઝ અને સ્માલ એન્ટરપ્રાઇઝ સીવાયના અન્ય કુલ આઉટસ્ટેન્ડીંગ એ.બી. એન્ટરપ્રાઇઝ ગુજરાત રેલ ઇન્ફાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ આશીશ સી. દોશી ફોરચ્યુન ઈન હવેલી કુલ	૨૮૮૮૪ ૧૪૨૫૬૨૪૩ ૭૬૦૦ ૫૫૬૦ ૧૫૮૨૮૫૪૬
	કંપનીના કરન્સી અને લીકવીડીટી રીસ્ક કે જે ચુકવવાપાત્ર ટ્રેડને લગત છે તેને નોંધ રહ્યા દરમાં દર્શાવવામાં આવેલ છે.	૧૫૮૨૮૫૪૬
૧૫	પ્રાવધાનો - કરન્ટ ચુકવવા પાત્ર એકાઉન્ટીંગ ફી ચુકવવા પાત્ર કન્સલટન્સી / પ્રોફેશનલ ચાર્જ ચુકવવા પાત્ર કન્વેન્સ ખર્ચ (લમ્પસમ) ચુકવવા પાત્ર વ્યાજ ચુકવવા પાત્ર આંતરીક ઓડીટ ફી ચુકવવા પાત્ર મેન પાવર સેવાઓ ચુકવવા પાત્ર સ્ટેચ્યુટરી ઓડીટ ફી ચુકવવા પાત્ર વાહન ભાડુ આવક વેરો નાણાંકીય વર્ષ ૧૮-૧૯ ના પ્રાવધાનો કુલ	૨૭૭૮૭૫ ૨૭૦૦૦ ૪૪૦૦ ૫૫૮૭૧૨ ૪૦૫૦૦ ૧૩૦૧૮૪ ૪૫૦૦૦ ૧૪૦૪૮૦ -
		૧૩૪૦૦૦ -
		૨૨૦
		૨૬૩૨૦૦
૧૬	અન્ય કરન્ટ લાયબલીટીઓ ચુકવવા પાત્ર સ્ટેચ્યુટરી ડયુ ટીડીએસ ચુકવવા પાત્ર કુલ	૮૬૩૮૧ ૮૬૩૮૧ -
		૨૮૫૮૮
૧૭	કરન્ટ ટેક્ષ લાયબલીટી (નેટ) કુલ	-
૧૮	અન્ય આવક પ્રામ થયેલ વ્યાજ ટેન્ડર પ્રોસેસ ફી કુલ	૮૬૧૧૬૪ ૧૨૮૮૩૦૪ ૧૭૫૮૪૭૦
		૮૪૦૦ -
		૮૪૦૦
૧૯	કર્મચારી બેનીફીટ ખર્ચ, કોન્ટ્રાક્ટરો અને કન્સલટન્ટને ચુકવણું મેન પવાર સેવાઓ કુલ	૬૩૪૦૦૩ ૬૩૪૦૦૩
		૨૮૪૭૪
૨૦	નાણાંકીય કિમત નાણાંકીય કિમત કુલ	-
		-

૨૧	ઘસારો અને એમોરેટાઈજેશન ખર્ચ			
	ઘસારો	-	-	-
	કુલ	-	-	-
૨૨	અન્ય ખર્ચ			
	બેંક ચાર્જ્સ	૫૮	-	-
	બોર્ડ મીટિંગ ખર્ચ	૨૪૪૮૧	-	-
	કન્સલ્ટન્સી / પ્રોફેશનલ ચાર્જ	૧૩૫૪૫૮૭	-	-
	ફીડીબિલિટી સ્ટડી ખર્ચ	૨૬૮૫૭૧૮	૧૫૭૨૦૫૪૦	
	ઇન્કોપોરેશન ખર્ચ	-	૩૧૫૧૧૧	
	ટીડીએસના ચૂકવણા પર વ્યાજ	૧૭૨૭	-	-
	આવક વેરા પર વ્યાજ	૧૦	-	-
	કચેરી ખર્ચ	૫૦૮૮	-	-
	કચેરી ખર્ચ (પ્રાથમિક ખર્ચ)	-	૫૦૦૦	
	આરઓસી અને લીગલ ચાર્જ	૧૭૨૬૭૮૦૦	-	-
	રાઉન્ડ ઓફ	૩	-	-
	સ્ટેશનરી અને પ્રીન્ટિંગ ચાર્જ	૧૮૦૪૪	-	-
	સેટયુટરી ઓડીટ ફી	૫૦૦૦૦	૫૦૦૦૦	
	પ્રવાસ અને કન્વેયન્સ ખર્ચ - અન્ય	૮૫૭૬૫		
	વાહન ભાડા ખર્ચ	૭૧૪૬૨૫		
	કુલ	૨૨૨૦૭૯૩૮	૧૬૦૮૦૬૬૧	
	અન્ય ખર્ચાઓ:-			
	ઓડીટર રેમ્બ્યુનરેશન:-			
	સેટયુટરી ઓડીટ ફી	૫૦૦૦૦	૫૦૦૦૦	
	કુલ	૫૦૦૦૦	૫૦૦૦૦	
	અન્ય કોમ્પ્લીક્ષન્સીવ આવક (ઓસીઆઈ)			
	તેવા કોઈ પણ કોપ્રીહેન્સીવ આવકના ભાગ નથી કે જે દર્શાવવા યોગ્ય છે.			
૨૩	શેર દીક આવક (ઈપીએસ)			
	પ્રતિ શેર થયેલ આવકની ગણત્રી થયેલ નેટ નફો / (નૂકશાનને) કે જે ઇકવીટી શેર ધારકને પ્રાપ્ત છે તેને રૂ.૧૦/- ના ઇકવીટી શેરના સરેરાશ સંખ્યાથી ભાગીને કરવામાં આવે છે કે જે નીચે મુજબ છે.			

શેર દીક ઇકવીટી શેર ધારકને લગત નેટ નુકશાન
 વર્ષ દરમ્યાનના ઇકવીટી શેરોની સંખ્યાનો
 સરેરાશ ★

વિગત	૨૦૧૯-૨૦૨૦	૨૦૧૮-૨૦૧૯
દરેક ઇકવીટી શેર ધારકને લગત નેટ નુકશાન	(૨૧૦૮૩૪૭૧)	(૧૬૧૧૩૮૭૫)
વર્ષ દરમ્યાનના ઇકવીટી શેરોની સંખ્યાનો	૫૮૭૨૬૦	-
સરેરાશ ★		
પ્રતિ શેર ફેસ વેલ્યુ	૧૦	૧૦
પ્રતિ શેર બેજીક અને ડાયલ્યુટેડ ★ આવક	-૩૫.૩૦	૦.૦૦
કોઈ પોટેન્શીયલ ઇકવીટી શેર રહેલ નથી તેથી બેજીક અને ડાયલ્યુટેડ ઈપીએસ એક જ છે.		

૨૪ કન્ટીજન્સી લાયબલીટી અને કેપીટલ

કમીટમેન્ટ

વિગત

૨૦૧૯-૨૦૨૦

૨૦૧૮-૨૦૧૯

કેપીટલ કમીટમેન્ટ

૨૫૦૪૬૧૬૪૩૧

કુલ

૨૫૦૪૬૧૬૪૩૧

૨૫ સેગમેન્ટની માહિતી

ઈએન્ડ-એએસ ૧૦૮ મુજબ સેગમેન્ટની માહિતી આપવા માટે વપરાયેલ ઓપરેટીંગ સેગમેન્ટને ઓળખવામાં આવેલ છે અને તેનો આધાર કંપનીના વહિવટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ આંતરીક રીપોર્ટ છે કે જેનાથી સેગમેન્ટને રીસોર્સ એલોટ કરવામાં આવેલ છે અને તેની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે.

નિયામક બોર્ડ ભેગા મળીને કંપનીના ‘મુખ્ય કાર્યકારી નિર્ણય લેનાર’ અથવા ‘સીઓરીએમ’ છે જેનો અર્થ ઈન્ડ એએસ ૧૦૮ મુજબ છે. આંતરીક રીપોર્ટીંગ માટે ઉપયોગમાં લેવાયેલ ઈન્નીકેટરો હાલના પફર્મમેન્સ એસેસમેન્ટ માપદંડ મુજબ ઈવોટ્વ કરી શકે છે.

ક્ષેત્રીય વિસ્તારની માહિતી

કંપની દ્વારા ઈકોનોમીક વાતાવરણમાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી કે જેમાં જુદા જ ખતરાઓ અને આવક રહેલ છે. તેથી તે એક જ ક્ષેત્રીય સેગમેન્ટમાં કામ કરી રહેલ છે.

૨૬ માઈક્રો, નાના અને મીડીયમ એન્ટરપ્રાઇઝને ચૂકવવાપાત્ર રકમ

કંપનીએ માઈક્રો, નાના અને મીડીયમ એન્ટરપ્રાઇઝને કોઈ પણ નાણાં ચૂકવવાના રહેતા નથી કે જે ત૧ માર્ચ, ૨૦૨૦ ના રોજ થી ૪૫ દિવસની અંદર રહેલ છે.

૨૭ નાણાંકીય રીસ્ક મેનેજમેન્ટ અને તેના ઓફ્જેક્ટીવ અને પોલીસી

કંપનીને માર્કેટ રીસ્ક, કેરીટ રીસ્ક અને લીકવીડીટી રીસ્કનો સામનો કરવો પડે છે. કંપનીના ઉચ્ચ વહિવટ દ્વારા આવા ખતરાઓને લગત બાબતોનું સંચાલન કરવામાં આવે છે. કંપનીના ઉચ્ચ વહીવટને નાણાં વિભાગનો સહાય પ્રાપ્ત છે કે જેઓ નાણાંકીય ખતરા બાબતે અભિપ્રાય આપે છે અને કંપનીના નાણાંકીય રીસ્ક મેનેજમેન્ટનું ફેમ વર્ક બનાવે છે. નાણાં વિભાગ દ્વારા કંપનીના ઉચ્ચ વહીવટને એવો આશાસન આપવામાં આવે છે કે કંપની દ્વારા નાણાંકીય ખતરાઓનો સારી રીતે વહીવટ કરવામાં આવી રહેલ છે.

(અ) માર્કેટને લગત રીસ્ક

માર્કેટ રીસ્ક એવો રીસ્ક છે કે જેના કારણે કોઈ પણ નાણાંકીય ઉપકરણનો ભવિષ્યનો કેશ ફલો ફલ્યુએટ થઈ શકે છે

કારણ કે માર્કેટ દરમાં ફેરફારો થાય છે. માર્કેટ દરમાં વ્યાજના દરનો ખતરો રહેલ છે. નીચે ના ભાગોમાં દર્શાવેલ સંવેદનશીલ વિશ્લેષણ ત૧ માર્ચ, ૨૦૨૦ ની સ્થિતી અનુસાર છે. આ વિશ્લંખણમાં માર્કેટ વેરીયેબલના મુવમેન્ટના અસરનો સમાવેશ થતો નથી; જેમ કે ગ્રેટયુર્ટી અને અન્ય નિવૃત્તી બાદની જવાબદારીઓ; અને નોન ફાઇનેન્શીયલ એસેટ અને લાયબલીટીનો સમાવેશ થાય છે.

(૧) વ્યાજ દરનો ખતરો

વ્યાજ દરનો રીસ્ક તે રીસ્ક છે કે જેમાં માર્કેટના વ્યાજ દરમાં ફેરફારને કારણો નાણાંકીય ઉપકરણના ફેર વેલ્યુ કે ભવિષ્યના કેશ ફ્લોમાં બદલાવ થાય છે. કંપનીના બોરોડ્યુગ વ્યાજ મુક્ત છે અને તેથી ઈન્ડ એઓસ ૧૦૭ માં દર્શાવેલ વ્યાજ દરના રીસ્કની અસર થતી નથી.

(બી) લીકવીડીટી રીસ્ક

લીકવીડીટી રીસ્ક એવો રીસ્ક છે કે જેમાં કંપની હાલના કે ભવિષ્યના કેશ અને કોલેટ્રલ જવાબદારીઓને નુકશાન કર્યા સીવાય પુરી કરી શકતી નથી. કંપનીનો ઉદેશ તે છે કે દરેક સમયે ઓપટીમભ લીકવીડીટી જળવાઈ રાખે કે જેથી તેની રોકડ અને કોલેટ્રલ જરૂરીયાતો પુરી કરી શકે. કંપની તેના લીકવીડીટીની સ્થિતિનો બારીકાઈથી નિરીક્ષણ કરી રહી છે અને તેની પાસે એક મજબુત કેશ મેનેજમેન્ટ સીસ્ટમ રહેલ છે. તેની પાસે સારા એવા નાણાંકીય ઓતો છે જેમાં ઓછા ખર્ચે બેન્કની લોનોનો સમાવેશ થાય છે.

(૨) કરાર આધારિત ચુકવણા અંગે કંપની ની નાણાંકીય જવાબદારીઓ દર્શાવતું પત્રક નીચે મુજબ છે.

૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિમ	ઓન ડીમાન્ડ	૩ મહિનાથી ઓછુ	૩ થી ૧૨ મહિના સુધી	૧ - ૫ વર્ષ સુધી	૫ વર્ષથી વધુ	કુલ
બોરોડ્યુગ	-	-	૧૪૩૧૨૭૮૫૫	-	-	૧૪૩૧૨૭૮૫૫
ચૂકવણા પાત્ર ટ્રેડ	-	-	૧૬૨૬૮૪૦૩	-	-	૧૬૨૬૮૪૦૩
અન્ય નાણાંકીય લાયબલીટી		-	-	-	-	--
૩૧ માર્ચ ૨૦૧૯ અંતિમ						
ચૂકવણાપાત્ર ટ્રેડ	-	-	૧૫૮૨૮૫૪૬	-	-	૧૫૮૨૮૫૪૬
અન્ય નાણાંકીય લાયબલીટી		-	-	-	-	--

(સી) કેડીટ રીસ્ક

કેડીટ રીસ્ક એવો રીસ્ક છે કે જેમાં સામાવાળી પાર્ટી કોઈ પણ નાણાંકીય ઉપકરણ કે ગ્રાહક સંપર્કને લગત પોતાની જવાબદારીઓ પૂરી ન કરે જેના કારણે નાણાંકીય નુકશાન થાય. કંપનીને તેના ઓપરેટીંગ કામગીરી કરવા માટે કેડીટ રીસ્કનો સામનો કરવો પડે છે (પ્રાથમિક ધોરણે ટ્રેડ રીસીવેબલ) અને તેના નાણાંકીય પ્રવૃત્તિઓ, જેમાં બેક, નાણાંકીય

સંસ્થાઓ અને અન્ય નાણાંકીય ઈન્સ્ટ્રુમેન્ટ માં તેનો સમાવેશ થાય છે.

(૧) ટ્રેડ રીસીવેબલ

કંપનીના તમામ બાકી રહેલ કસ્ટમર રીસીવેબલને મોનીટર કરવામાં આવી રહેલ છે. કંપનીનો આ કામગીરીનો પ્રથમ વર્ષ હોવાથી કંપનીને કોઈ બેડ ટેબટ કે લોંગ આઉટસ્ટેન્ડીંગનો વર્ષ દરમ્યાન સામનો કરવો પડેલ નથી. ઉપરાંત કંપનીના તમામ બાકી રહેલ કસ્ટમર રીસીવેબલ રીપોર્ટની તારીખથી હ માસની અંદરના છે. અને તે જ પ્રમાણે ટ્રેડ રીસીવેબલને ખૂબજ લો કેરીટ રીસ્ક લાગુ પડે છે અને મેનેજમેન્ટ એવી ખાતરી કરે છે કે ટ્રેડ રીસીવેબલનો કોઈ ઈમ્પેરમેન્ટની જરૂરીયાત રહેલ નથી.

(૨) નાણાંકીય ઉપકરણો અને રોકડ ડીપોઝિટ

બેકમાં રહેલ બેલેન્સ બાબતેના કેરીટ રીસ્કને કંપનીના નાણાં વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે અને તે કંપનીના ઉચ્ચ વહિવટની નિગરાણીમાં રહેલ છે. બેન્ક કે નાણાંકીય સંસ્થાઓ સાથે રહેલ તમામ બેલેન્સ લો રીસ્ક કેરીટ છે કારણ કે કંપનીને સારા કેરીટ રેટોંગ આપવામાં આવેલ છે. તે રેઠ્યુલેટરી સત્તાની નિગરાણીમાં છે.

૨૮ શીલટેક્ડ પાર્ટી ડિઝિકલોશર

(૧) સંબંધીત પક્ષકારો અને સંબંધોની રૂપરેખા

એસોસીયેટ એન્ટીટી

ગુજરાત રેલ ઈન્ડસ્ટ્રીક્યર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ (જી - રાઈડ)

ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (જાઈડીસી)

મારુતી સુજુકી ઈન્ડીયા લીમીટેડ (એમએસઆઈએલ)

એવી સંસ્થાઓ કે જેના પર ખાસ મેનેજેરીયલ પર્સનલ અને તેઓના સંબંધીઓ ખાસ અસર કરી શકે.

ગુજરાત રેલ ઈન્ડસ્ટ્રીક્યર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ (જી - રાઈડ)

ખાસ મેનેજમેન્ટ પર્સનલ / એક્ગ્ઝિક્યુટીવ ડિરેક્ટર

શ્રી સંતોશ કુમાર

સીઈઓ/નિયામક

શ્રી અધ્યની કુમાર યાદવ

ચેરમેન

નિયામક નોન - એક્ગ્ઝિક્યુટીવ

શ્રી જાઈગામ અલી ખાન

નિયામક

(૧૪મી ઓગસ્ટ, ૨૦૧૯ સુધી)



શ્રી બજરંગ વર્લી

નિયામક

શ્રી ધર્મશ બ્રહ્મભટુ

નિયામક

(૧૪મી ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી)

શ્રી બચ્યુવેનુગોપાલ

નિયામક

શ્રી રાજ સ્વરૂપ કપુર

નિયામક

(૨) સંબંધિત પાર્ટીઓ સાથે લેવડ દેવડ

ટ્રેન્સેક્શનની સમરી / સંબંધિત પાર્ટી સાથે બેલેન્સ	એસોસીયેટ એન્ટીટી	એવી એન્ટીટીઓ કે જેમાં ખાસ વહીવટી પર્સનલ અને તેઓના સંબંધીઓ ખાસ અસર કરી શકે	ખાસ વહીવટી પર્સોનેલ અને તેઓના સબધીઓ		
વર્ષ દરમ્યાન ટ્રાન્સેક્શન	૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત	૩૧ માર્ચ, ૨૦૧૯ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત	૩૧ માર્ચ, ૨૦૧૯ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત
લોન પ્રામ થયેલ	૧૪૩૧૨૭૮૫૫	-	-	-	-
ખર્ચનો રીટિમ્બર્સમેન્ટ (કેપિટલાઈઝ - સીડબલ્યુઆઈપી)	૨૦૦૦૦	-	-	-	-
અન્ય ખર્ચ	૨૬૮૫૭૧૮	૧૫૮૮૦૪૫૦	-	-	-
ચૂકવેલ વ્યાજ (કેપિટલાઈઝ - સીડબલ્યુઆઈપી)	૬૨૦૭૮૧	-	-	-	-
કુલ	૧૪૬૪૫૪૩૬૪	૧૫૮૮૦૪૫૦	-	-	-

વર્ષના અંતે બેલેન્સ	એસોસીયેટ એન્ટીટી	એવી એન્ટીટીઓ કે જેમાં ખાસ વહીવટી પર્સનલ અને તેઓના સંબંધીઓ ખાસ અસર કરી શકે	ખાસ વહીવટી પર્સોનેલ અને તેઓના સબધીઓ		
	૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત	૩૧ માર્ચ, ૨૦૧૯ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત	૩૧ માર્ચ, ૨૦૧૯ અંતિત	૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત
મળવાપાત્ર રકમ -	-	-	-	-	-
ચુકવવાપાત્ર રકમ	૧૬૩૦૦૪૮૮૯	૧૫૮૦૦૬૬૧	-	-	-

૨૮ ફેર વ્યુની ગણત્રી

કંપનીના નાણાંકીય ઈન્સ્ટ્રુમેન્ટના ફેર વેલ્યુ અને કેરીંગ રકમના કલાસની સરખામણી નીચે મુજબ છે.

કેટેગરી	૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિત		૩૧ માર્ચ, ૨૦૧૯ અંતિત	
	કેરીંગ વેલ્યુ	ફેર વેલ્યુ	કેરીંગ વેલ્યુ	ફેર વેલ્યુ
૧) એમોરાઇઝ કોસ્ટ પર નાણાંકીય એસેટ ટ્રેડ રીસીવેબલ (કરન્ટ / નોન કરન્ટ) કેશ અને કેશના સમાનતર અન્ય નાણાંકીય એસેટ (કરન્ટ / નોન કરન્ટ) કુલ	- - 1380096 -	- - 1380096 -	- - 9408400 -	- - 9408400 9408400
૨) એમોરાઇઝ કોસ્ટ પર નાણાંકીય લાયબલીટી બોરોઈંગ યૂકવવા પાત્ર ટ્રેડ અન્ય નાણાંકીય જવાબદારીઓ (કરન્ટ / નોન કરન્ટ) કુલ	143127844 16268403 -	143127844 16268403 -	- 148285486 -	- 148285486 148285486

નાણાંકીય એસેટ અને જવાબદારીના ફેર વેલ્યુમાં તે રકમનો સમાવેશ થાય છે કે જેમાં ઈન્સ્ટ્રુમેન્ટને સહમત પક્ષકારો વચ્ચે હાલના લેવડ ટેવડ તરીકે એક્શન્યેન્જ કરી શકાય, સિવાય કે તે જબરજસ્તીનો કે લીકવીડેશન સેલ હોય. મેનેજમેન્ટે પ્રામ થયેલ ટ્રેડ, રોકડ અને રોકડના સમાનતર, અન્ય બેન્કની સીલ્સક, અન્ય નાણાંકીય એસેટ, બોરોઈંગ, યૂકવવાપાત્ર ટ્રેડ, અને અન્ય નાણાંકીય લાયબલીટીસને ચકાસેલ છે અને તે કેરીંગ એમાઉન્ટના એપ્રોક્સીમેટ છે કે જે ઈન્સ્ટ્રુમેન્ટના ટુંકાગાળા મેચયુરીટી વાળા છે.

ફેર વેલ્યુ હેરાર્ડકી:-

તમામ ફાઈનાન્શીયલ ઈન્સ્ટ્રુમેન્ટ કે જે માટે ફેર વેલ્યુ ઓળખાયેલ છે કે ખુલાસો કરવામાં આવેલ છે તે ફેર વેલ્યુના કેટેગરીમાં આવે છે, અને તેનું વિવરણ નીચે આપવામાં આવેલ છે, અને તેનો આધાર સોથી નીચેના સ્તરનું ઈનપુટ પર છે કે જે ફેર વુલ્યુની ગણત્રી માટે પુરી રીતે અગત્યનું છે.

લેવલ ૧ : સક્રિય બજારમાં નિર્ધારિત થયેલ (એડજેસ્ટ કર્યા સિવાય) રકમ કે જે ચાલુ માર્કેટમાં એક સમાન એસેટ કે લાયબલીટી માટે રહેલ છે.

લેવલ ૨ : વેલ્યુઅશન ટેકનીકો કે જેના માટે સૌથી નીચેના સ્તરનું ઈનપુટ વપરાય કે જે ફેર વેલ્યુની ગણત્રીમાં ખાસ અસર કરી શકે અને જે ઓબજર્વેલબ હોય સીધી કે આડકતરી રીતે.

લેવલ ૩ : તેવા વેલ્યુઅશન ટેકનીકો કે જેમાં સૌથી નીચેના સ્તરનું ઈનપુટ લેવલની ગણત્રીમાં ખાસ અસર કરી શકે અને તેનો આધાર ઓબજર્વેલબ માર્કેટ ડેટા પર ન રહેલ હોય.

નીચે દર્શાવેલ કોષ્ટક કંપનીના એસેટ અને લાયબલીટીઓના ફેર વેલ્યુ ગણત્રીને દર્શાવે છે.

૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિમ એસેટનો ફેર વેલ્યુ ગણત્રી માટેનો કવોન્ટીટેટીવ ડીઝલોશરો:-

વિગત	કુલ / (કેરીઇગી વેલ્યુ)	ચાલુ બજારમાના કોટેડ કિમત (લેવલ - ૧)	ખાસ નોંધપાત્ર ઈનપુટ (લેવલ - ૨)	નોંધપાત્ર નોન ઓબજર્વેલબ ઈનપુટ (લેવલ - ૩)
એમોરાઇઝ કોસ્પ પર ગણત્રી કરેલ નાણાંકીય એસેટ મળવાપાત્ર ટ્રેડ રોકડ અને તેનો સમાન્તર અન્ય નાણાંકીય એસેટ (કરન્ટ / નોન કરન્ટ)	- ૧૩૬૦૦૭૬ -	- - -	- - -	- - -
કુલ	૧૩૬૦૦૭૬	-	-	-

૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિમ લાયબલીટીઓનો ફેર વેલ્યુ ગણત્રી માટેનો કવોન્ટીટેટીવ ડીઝલોશરો:-

વિગત	કુલ / (કેરીઇગી વેલ્યુ)	ચાલુ બજારમાના કોટેડ કિમત (લેવલ - ૧)	ખાસ નોંધપાત્ર ઈનપુટ (લેવલ - ૨)	નોંધપાત્ર નોન ઓબજર્વેલબ ઈનપુટ (લેવલ - ૩)
એમોરાઇઝ કોસ્પ પર ગણત્રી કરેલ નાણાંકીય લાયબલીટીઓ બોરોઈંગ ચૂકવાપાત્ર ટ્રેડ અન્ય નાણાંકીય લાયબલીટી (કરન્ટ / નોન કરન્ટ)	૧૪૩૧૨૭૮૫૫ ૧૮૨૬૮૪૦૩ -	- - -	- - -	- - -
કુલ	૧૬૨૭૮૮૪૮	-	-	-

૩૧ માર્ચ, ૨૦૧૯ અંતિત એસેટનો ફેર વેલ્યુ ગણાત્રી માટેનો કવોન્ટીટેટીવ ડીસ્કલોશારો:-

વિગત	કુલ / (કેરીઇગી વેલ્યુ)	ચાલુ બજરમાના કોટેડ કિમત (લેવલ - ૧)	ખાસ નોંધપાત્ર ઈનપુટ (લેવલ - ૨)	નોંધપાત્ર નોન ઓબજર્વેઝન ઈનપુટ (લેવલ - ૩)
એમોરાઇઝ કોસ્પ પર ગણાત્રી કરેલ નાણાંકીય એસેટ મળવાપાત્ર ટ્રેડ રોકડ અને તેનો સમાન્તર અન્ય નાણાંકીય એસેટ (કરન્ટ / નોન કરન્ટ) કુલ	- ૭૪૦૮૪૦૦	- -	- -	- -

૩૧ માર્ચ, ૨૦૧૯ અંતિત લાયબલીટીઓનો ફેર વેલ્યુ ગણાત્રી માટેનો કવોન્ટીટેટીવ ડીસ્કલોશારો:-

વિગત	કુલ / (કેરીઇગી વેલ્યુ)	ચાલુ બજરમાના કોટેડ કિમત (લેવલ - ૧)	ખાસ નોંધપાત્ર ઈનપુટ (લેવલ - ૨)	નોંધપાત્ર નોન ઓબજર્વેઝન ઈનપુટ (લેવલ - ૩)
એમોરાઇઝ કોસ્પ પર ગણાત્રી કરેલ નાણાંકીય લાયબલીટીઓ બોરોઈંગ ચૂકવવાપાત્ર ટ્રેડ અન્ય નાણાંકીય લાયબલીટી (કરન્ટ / નોન કરન્ટ) કુલ	- ૧૫૮૨૮૫૪૬ -	- -	- -	- -

૩૦. પ્રથમ વાર એડોપ્ટ કરેલ ઈન્ડ એએસ

નોંધ ઉ એ માં દર્શાવ્યા મુજબ ઉ ૧ માર્ચ, ૨૦૨૦ અંતિતના આ નાણાંકીય પત્રકો કંપની દ્વારા ઈન્ડ એએસ મુજબ તૈયાર કરવામાં આવેલ પ્રથમ નાણાંકીય પત્રકો છે. ઉ ૧ માર્ચ, ૨૦૧૯ અંતિતના સમયગાળા માટે (કંપનીના પ્રથમ નાણાંકીય પત્રકો), કંપનીએ કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૩૩ મુજબ અને ધારા (પહેલા જીએપી છે) અને અન્ય કલમમાં દર્શાવેલ હિસાબી પદ્ધતિઓ અનુસાર નાણાંકીય પત્રકો તૈયાર કરેલ છે.

તે મુજબ કંપનીએ તેવા નાણાંકીય પત્રકો તૈયાર કરે છે કે જે ઉ ૧ માર્ચ, ૨૦૨૦ અંતિત છે અને તે ઈન્ડ એએસ મુજબ છે, અને તેમાં ઉ ૧ માર્ચ, ૨૦૧૯ ના કોમ્પ્રીહેન્સીવ માહિતીનો સમાવેશ થાય છે. વધુમાં આવી કોમ્પ્રીહેન્સીવ માહિતી

દર્શાવતી વખતે કંપનીએ પહેલા રીપોર્ટ કરેલ રકમોને નાણાંકીય પત્રકોમાં એડજેસ્ટ કરેલ છે. આ નોંધ તે દર્શાવે છે કે કંપની દ્વારા કરવામાં આવેલ મુખ્ય એડજેસ્ટમેન્ટો કે જે જુના નાણાંકીય પત્રકો જુના જીએએપી મુજબ રીસ્ટેટ કરવા માટેના છે, અને જુના જીએએપીમાંથી ઈન્ડ એએસમાં ફેરબદલ કરવાથી કંપનીના નાણાંકીય સ્થિતી અને નાણાંકીય કામગીરી અને કેશ ફ્લો પર શુઅસર થયેલ છે તે દર્શાવે છે.

નોંધ ૨ - બીમાં દર્શાવેલ હિસાબી પધ્યતિઓને ૩૧ માર્ચ, ૨૦૨૦ અંતિતના નાણાંકીય પત્રકો તૈયાર કરવા માટે અમલમાં મુકવામાં આવેલ છે અને તેમાં ૩૧ માર્ચ, ૨૦૧૯ અંતિતના કોમ્પ્રીઝેન્સીવ માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે.

લાગુ કરવામાં અને અવેલ કરવામાં આવેલ એક્ષસેમ્પશનો

ઈન્ડ એએસ ૧૦૧ પ્રથમ એડોપ્ટરોને ઈન્ડ એએસમાં રીટ્રસ્પેક્ટીવ એપ્લીકેશનમાં અમુક એક્ષસેમ્પશનોની પરવાનગી આપતી હોવાથી કોમ્પ્રીઝેન્સીવ સમયગાળો એટલે કે ડિસેમ્બર ૧૩, ૨૦૧૮ થી માર્ચ ૩૧, ૨૦૧૯ કે જે કંપનીનો પ્રથમ નાણાંકીય વર્ષ હતો તેમાં ટ્રેન્સેક્શનની તારીખ કંપનીને લાગુ પડતું નથી. તે મુજબ ઈન્ડ - એએસ ૧૦૧ માં દર્શાવ્યા મુજબ ઓપશનલ અને મેન્ટેન્ટરી એક્ષસેમ્પશનો કંપની પર લાગુ પડતા નથી અને તેથી તેનો ખુલાસો કરવામાં આવેલ નથી.

(અ) ઈકવીટીનું રીકન્સીલીયેશન:-

વિગત	૩૧ માર્ચ, ૨૦૧૯ અંતિત			(રકમ રૂ.)
	ભારતીય જીએપી	ઈન્ડ એએસ	ઈન્ડ એએસ	
૧ એસેટ				
નોન કરન્ટ એસેટ	-	-	-	-
પ્રોપર્ટી, પ્લાન્ટ અને ઉપકરણ	-	-	-	-
ગતીમાં રહેલ કેપીટલ કામગીરી	-	-	-	-
ડીફર્ડ ટેક્ષ એસેટ (નેટ)	-	-	-	-
કરન્ટ એસેટ				
નાણાંકીય એસેટ	-	-	-	-
રોકડ અને રોકડના સમાન્તર	૭૪૦૮૪૦૦	-	૭૪૦૮૪૦૦	
અન્ય કરન્ટ એસેટ	૨૬૦૦૦૦૦	-	૨૬૦૦૦૦૦	
રોકડ અને રોકડના સમાન્તર સીવાય	-	-	-	
અન્ય બેન્ક સીલ્ક				
કુલ એસેટ	૧૦૦૦૮૪૦૦	-	૧૦૦૦૮૪૦૦	

૨ ઈકવીટી અને લાયબલીટી			
ઈકવીટી			
ઈકવીટી અને શેર કેપીટલ	-	-	-
અન્ય ઈકવીટી	(૧૬૧૧૩૮૩૫)	-	(૧૬૧૧૩૮૩૫)
લાયબલીટી			
શેર એપ્લીકેશનની રકમ કે જે ફાળવણી માટે બાકી રહેલ છે	૧૦૦૦૦૦૦૦	-	૧૦૦૦૦૦૦૦
નોન કરન્ટ લાયબલીટી			
અન્ય નાણાંકીય જવાબદારી	-	-	-
સરકારી ગ્રાન્ટ	-	-	-
કરન્ટ લાયબલીટી			
નાણાંકીય લાયબલીટી	-	-	-
ચૂકવવાપાત્ર ટ્રેડ	-	-	-
માઈકો એન્ટરપ્રાઇઝ અને નાના એન્ટરપ્રાઇઝને ચૂકવવાપાત્ર બાકી રકમ	-	-	-
માઈકો એન્ટરપ્રાઇઝ અને નાના એન્ટરપ્રાઇઝ સીવાયના અન્ય કેવિટો ને ચૂકવવાપાત્ર બાકી રકમ	૧૫૮૨૮૫૪૬	-	૧૫૮૨૮૫૪૬
અન્ય નાણાંકીય લાયબલીટી	-	-	-
પ્રોવીઝનો	૨૬૩૨૦૦	-	૨૬૩૨૦૦
અન્ય કરન્ટ લાયબલીટી	૨૮૫૮૮	-	૨૮૫૮૮
કરન્ટ ટેક્ષ લાયબલીટી (નેટ)	-	-	-
કુલ ઈકવીટી અને લાયબલીટી	૧૦૦૦૮૪૦૦	-	૧૦૦૦૮૪૦૦

(બી) ૩૧ માર્ચ, ૨૦૧૯ અંતિમ કુલ કોમ્પ્રિલેન્સીવ આવકનું રીકન્સીલીયેશન

વિગત	૩૧ માર્ચ, ૨૦૧૯ અંતિમ		
	ભારતીય જુઓએપી મુજબ રીગ્યુલિંગ	ઈન્ડ એઓસ એડજેસ્ટમેન્ટ	ઈન્ડ એઓસ
આવક			
અન્ય આવક	૮૪૦૦	-	૮૪૦૦
કુલ આવક	૮૪૦૦	-	૮૪૦૦
ખર્ચાઓ			
કર્મચારી બેનીફીટ ખર્ચ	૨૮૪૭૪	-	૨૮૪૭૪

ઘસારો અને એમોરાઈજેશન ખર્ચ	-	-	-
અન્ય ખર્ચ	૧૬૦૫૦૬૬૧	-	૧૬૦૫૦૬૬૧
કુલ ખર્ચ	૧૬૧૨૦૧૩૫	-	૧૬૧૨૦૧૩૫
(નૂકશાન) / નફો ટેક્ષ પહેલા	(૧૬૧૧૧૭૩૫)	-	(૧૬૧૧૧૭૩૫)
વેરા ખર્ચ			
કરન્ટ વેરો	૨૨૦૦	-	૨૨૦૦
ડીફર્ડ ટેક્ષ કેરીટ	-	-	-
કુલ વેરા ખર્ચ	૨૨૦૦	-	૨૨૦૦
(નૂકશાન) / નફો વર્ષ માટે	(૧૬૧૧૩૮૩૫)	-	(૧૬૧૧૩૮૩૫)
અન્ય કોમ્પીલેન્સીવ આવક (ઓસીઆઈ)	-	-	-
નફો અને નુકશાન તરીકે વર્ગીકૃત કરી ન શકાય તેવા આઈટમ	-	-	-
હાલના સમયગાળા માટે અન્ય કોમ્પીલેન્સીવ આવક	-	-	-
હાલના સમયગાળા માટે કુલ કોમ્પીલેન્સીવ આવક	(૧૬૧૧૩૮૩૫)	-	(૧૬૧૧૩૮૩૫)

૩૧. કેશ ફ્લો પત્રક

જુના જીએએપીમાંથી ઇન્ડ એએસમાં થયેલ ટ્રાન્સેક્શનથી કેશ ફ્લો પત્રકમાં કોઈ મટીરીયલ અસર થયેલ નથી.

ઉપર દર્શાવેલ નોંધો નાણાંકીય પત્રકોનો આંતરીક ભાગ છે.

૩૧. ત૧ માર્ચ, ૨૦૨૦ અંતિતના કંપનીના નાણાંકીય પત્રકોને ૧૨ મહિનાના સમયગાળા માટે એટલે કે ૦૧ એપ્રિલ,
૨૦૧૯ થી ત૧ માર્ચ, ૨૦૨૦ માટે તૈયાર કરવામાં આવેલ છે. જુના સમયગાળો કે જે કામગીરીઓ પ્રથમ વર્ષ હોવાથી
કંપનીએ તેનો પહેલો નાણાંકીય પત્રક ૧૩ ડિસેમ્બર, ૨૦૧૮ થી ત૧ માર્ચ, ૨૦૧૯ માટે તૈયાર કરેલ છે. આથી
નાણાંકીય પત્રકોના કોરસપોન્ટીંગ આકડાઓ ત.૫ માસ માટેના છે અને તેને ચાલુ વર્ષના આકડાઓ સાથે સરખામણી
કરી ન શકાય. જુના વર્ષના આકડાઓને રીશ્રૂપ કે રીકલાસીફાય જરૂરી હોય ત્યા કરવામાં આવેલ છે કે જેથી તે ચાલુ
વર્ષના પ્રેઝન્ટેશન સાથે સરખાવી શકાય.

૩૩. દુનીયા ભરમાં અને ભારતના કોવિડ - ૧૯ ના ફેલાવાથી કંપનીના વહીવટએ એવા પ્રાથમિક એસેસમેન્ટ કરેલ છે કે
અને ધંધાઓ ઉપર થનાર અડવર્સ અસરો અને નાણાંકીય રીસ્કની ગણત્રી કરેલ છે અને તેમ માનવામાં આવેલ છે કે તે

ટુંકા ગાળાની અસર છે. કંપનીને ચાલુ રાખવાની ક્ષમતા અને તેની જવાબદારીઓને પુરી કરવામાં કોઈ પણ પ્રકારની મીડીયમ કે લાભાગાળાની અસરો થશે તેમ કંપનીનું મેનેજમેન્ટ માનતું નથી.

નોંધ ૧ થી ૩૩ ના સીગનેટરીઓ

અમારા નીચે દર્શાવેલ તારીખના અહેવાલ મુજબ

શાહ અને દલાલ વતી

ચાર્ટર્ડ એક્ઝાઉન્ટન્ટ

એફઆરએન ૧૦૮૪૩૨૩૬૫૮૫૬

નિયામક બોર્ડના વતી અને તેમના દારા

સહી/-

મલય દલાલ

ભાગીદાર,

સત્ય નં. ૦૩૬૭૭૬

સહી/-

સંતોશ કુમાર

નિયામક / સીઈઓ

ડીઆઈએન: ૦૭૮૫૪૧૭૮

સહી/-

બી. સી વલી

નિયામક

ડીઆઈએન: ૦૭૧૩૩૬૪૨

સ્થળ:- અમદાવાદ

તારીખ:- ૦૪/૦૭/૨૦૨૦

સ્થળ:- ગાંધીનગર

તારીખ:- ૦૪/૦૭/૨૦૨૦


Bahucharaji Rail Corporation Limited (BRCL)

Reasons for delay in submission of 2nd Annual Report of BRCL for the year 2019-2020 before Vidhansabha:


- Annual Report of the company for the year 2019-2020 has to be finalized under Companies Act, 2013 and the same has to be get audited by Statutory Auditor under the Companies Act, 2013. After completion of Statutory Audit of the company the same is required to get audited by C&AG Office.

- 2nd Annual Report of the company get approved in December 2020 in Annual General Meeting of the company. Due to Covid-19 pandemic, all offices and commercial activities were almost closed. Hence the printing of Annual Reports was pending.

- As such, due to Administrative and other reasons mentioned hereabove, the 2nd Annual Report for the year 2019-20 is placed before the State legislature in upcoming session i.e. September, 2021.


 11/8/2021
 Chief Executive Officer

Bahucharaji Rail Corporation Limited (BRCL)


 Deputy Secretary
 Industries & Mines Department
 Sachivatalaya, Government of Bihar

Industries & Mines Department
2nd Administrative Report of
Bahucharaji Rail Corporation Limited
Pursuant to Section 394(2) of the Companies Act, 2013
(for the F.Y. 2019-20)

Bahucharaji Rail Corporation Limited (BRCL) is a Joint Venture of Gujarat Rail Infrastructure Development Corporation Limited, Gujarat Industrial Development Corporation and Maruti Suzuki India Limited, incorporated under provision of the Companies Act, 2013 on 13.12.2018.

BRCL has been incorporated to carry on the business of development , financing, planning and implementation of Gauge Conversion of Katosan Road-Bechraji-Chanasma-Ranuj (65 Kms) line project in the state of Gujarat.

During the year the Company has undertaken following business activities:

- a)The work of Transaction Advisory has been assigned to GRIDE for processing and awarding tenders for various activities for the project. EPC contractor for the project has been finalized.
- b)For field supervision and contract management, Project Management Consultancy agency has been fixed.
- c)Other in-house day to day works for smoother progress of project are being undertaken by the Company.
- d)Land Acquisition for the project is being coordinated with State Government and District Administration.
- e)Monitoring the progress of project for various activities.
- f)Liaisoning with Railways and State Government on all issues related to Project.

The management is hopeful that it will be able to accelerate its activities and speed up implementation of the project in the forth coming years.

During the reporting period, company has incurred loss of Rs. 2,10,83,471/-



Additional Chief Secretary
Industries & Mines Department
Government of Gujarat



BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

(CIN: U45101GJ2018SGC105602)

Second Annual Report F.Y. 2019-2020

Date : 22/09/2020
Time : 12:30 Hours
Place : Block No.6, 7th Floor
Udyog Bhawan, Sector - 11,
Gandhinagar-382011, Gujarat

: Registered Office:

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

**Block No. 6, 7th Floor, Udyog Bhavan, Sector-11,
Gandinagar-382011**

Phone: -079-232-32728/29, Email: - info@brcl.org.in

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
(CIN: U45101GJ2018SGC105602)

INDEX

Sr. No.	Particulars	Page No.
1.	Board of Directors	4
2.	Notice of 2 nd Annual General Meeting	5
3.	Board's Report	8
4.	Independent Auditor's Report	25
5.	Balance Sheet	39
6.	Profit & Loss Account	41
7.	Cash Flow Statement	43
8.	Notes to Financial Statements	46

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
(CIN: U45101GJ2018SGC105602)

Board of Directors

Sr. No.	Name & DIN of Director	Designation
1.	SHRI ASHWINIKUMAR RAJENDRAPRASAD YADAV – 06581753	Chairman
2.	SHRI BAJRANG WARLI CHHAGANBHAI – 07133942	Director
3.	SHRI SANTOSH KUMAR – 07854179	Director
4.	SHRI DHARMESH NARHARIBHAI BRAHMBHATT – 08268559	Director
5.	SHRI BATCHU VENUGOPAL – 08303687	Director
6.	SHRI RAJ SWARUP KAPOOR – 08303688	Director
7.	SHRI ZAIGHAM ALI KHAN – 07655360	Director

Statutory Auditors

M/s Shah & Dalal
Chartered Accountants,
Ahmedabad

Bankers

Yes Bank,
Gandhinagar

Registered Office

Block No. 6, 7th Floor,
Udyog Bhavan, Sector-11,
Gandhinagar-382011.

Notice for the 2nd Annual General Meeting

NOTICE is hereby given that the Second Annual General Meeting of the Company Bahucharaji Rail Corporation Limited will be held on **Tuesday, the 22nd September, 2020 at 12.30 p.m. (at a shorter notice) through Video conferencing/OAVM mode at Block No. 6, 7th Floor, Udyog Bhavan, Sector 11, Gandhinagar – 382011** to transact the following business:

ORDINARY BUSINESS:

1. To receive, consider and adopt the Audited Financial Statement of the Company for the Financial Year ended March 31, 2020 together with the reports of the Board of Directors and Auditors and comments of Comptroller and Auditor General of India thereon.
2. To appoint Shri Bajrang Chhaganbhai Warli (DIN: 07133942), who retires by rotation as a Director and being eligible and offers himself for re-appointment.
3. To appoint Shri Raj Swarup Kapoor (DIN: 08303688), who retires by rotation as a Director and being eligible and offers himself for re-appointment.
4. To authorize Board of Directors of the Company to fix the remuneration of the Statutory Auditors of the Company appointed by the office of CAG of India for audit of accounts of the Company for the year 2020-21.

SPECIAL BUSINESS:

5. To consider and, if thought fit, to pass with or without modifications, the following Resolution as an Ordinary Resolution:

ORDINARY RESOLUTION

"RESOLVED THAT pursuant to the provisions of Section 149 and 152 read with Schedule IV and all other applicable provisions of the Companies Act, 2013 and the Companies (Appointment and Qualification of Directors) Rules, 2014 (including any statutory modification(s) or re-enactment(s) thereof for the time being in force), Ms. Kavita Sheth (Shah) (DIN: 08268558), who was appointed as an Additional Director of the Company by the Board of Directors w.e.f. 06th February, 2020 pursuant to provisions of Section 161 (1) of the Companies Act, 2013 and the Articles of Association of the Company holds office up to the date of this Annual General Meeting, be and is hereby appointed as a Woman Director of the Company, Nominated by Gujarat Industrial Development Corporation (GIDC)."

Regd. Office:

Block No. 6, 7th Floor,
Udyog Bhavan,
Sector -11,
Gandhinagar - 382 011

By order of the Board of Directors**Sd/-****CHAIRMAN/DIRECTOR****Date: 22nd September, 2020****NOTES:**

1. Shareholders seeking any information regarding any aspect of this report are requested to write to the company well in advance so as to enable the management to keep the information ready.

EXPLANATORY STATEMENT UNDER SECTION 102(1) OF THE COMPANIES ACT, 2013**SPECIAL BUSINESS****Item No. 5****REGULARISATION OF MS. KAVITA SHETH (SHAH) (DIN: 08268558)**

Ms. Kavita Sheth (Shah) (DIN: 08268558), who has been appointed as an Additional Director of the Company under Section 161 (1) of the Companies Act, 2013 w.e.f. 06th February, 2020 holds office up to the date of this Annual General Meeting and is eligible for appointment as a Woman Director of the Company, Nominated by Gujarat Industrial Development Corporation (GIDC).

The Board of Directors has recommended the ordinary resolution for your approval.

None of the Directors or Key Managerial Personnel of the Company (including relatives of the Directors and Key Managerial Personnel), are concerned or interested, financially or otherwise, in this resolution.

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

(CIN: U45101GJ2018SGC105602)

Reg. Office: Block No. 6, 7THFloor, Udyog Bhavan, Sector-11, Gandhinagar, Gujarat-382011**BOARD'S REPORT**

To,

The Members,

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

Gandhinagar, Gujarat

Your Directors have pleasure in presenting their 2nd Annual Report on the business and operations of Bahucharaji Rail Corporation Limited ("the Company") and the accounts for the financial year ended on 31st March, 2020.

1. FINANCIAL SUMMARY OR HIGHLIGHTS/PERFORMANCE OF THE COMPANY:

The financial position of the Company for financial year ended on 31st March, 2020 is as follows:

(Amount in Rs.)

Particulars	2019-20	2018-19
Revenue from Operations	0	0
Other Income	17,59,470	8,400
Total Revenue	17,59,470	8,400
Less: Total Expenses	(2,28,42,941)	(1,61,20,135)
Profit / (Loss) Before Tax	(2,10,83,471)	(1,61,11,735)
Less: Tax Expenses	0	2200
Profit / (Loss) after tax	(2,10,83,471)	(1,61,13,935)

2. BRIEF DESCRIPTION OF THE COMPANY'S WORKING DURING THE YEAR:

The Company is Presently in the Process of implementation of the project. The commercial operation has not begun.

- a) The work of Transaction Advisory has been assigned to GRIDE for processing and awarding tenders for various activities for the project. EPC contractor for the project has been finalized.

- b) For field supervision and contract management, Project Management Consultancy agency has been fixed.
- c) Other in-house day to day work for smoother progress of project are being undertaken by the Company.
- d) Land Acquisition for the project is being coordinated with State Government and District Administration.
- e) Monitoring the progress of project for various activities.
- f) Liasoning with Railways and State Government on all issues related to Project.

The management is hopeful that it will be able to accelerate its activities and speed up implementation of the project in the forth coming years.

3. EFFECT OF COVID-19:

The novel Coronavirus (COVID-19) pandemic is spreading around the globe rapidly. The virus has taken its toll on not just human life, but businesses and financial markets too, the extent of which is currently indeterminate. Entities need to carefully consider the accounting implications of this situation and outcome of the same may be different from the estimated at these financial Statements. The Company will continue to closely monitor any material changes arising out of future economic conditions and impact on its activities.

4. CHANGE IN THE NATURE OF BUSINESS, IF ANY:

During the financial year under review, there is no Change in the nature of business.

5. DIVIDEND:

During the financial year under review, the Board of Directors did not recommend any Dividend on the Equity Shares of the Company.

6. TRANSFER TO RESERVES:

During the financial year under review, Company has not transferred any amount to General Reserve.

7. SHARE CAPITAL OF THE COMPANY AND CHANGE IN SHARE CAPITAL, IF ANY:

The Company has allotted 10,00,000 Equity Shares of Rs. 10/- each to the Subscribers to the Memorandum of Association.

The Authorized, Issued, Subscribed and Paid-up Share Capital of the Company as at 31st March, 2020 as follows:

SHARE CAPITAL STRUCTURE	
Authorised Share Capital *	Rs. 2,25,00,00,000/- (Rupees Two Twenty Five Crore only) divided into 22,50,00,000 Equity Shares of Rs. 10/- each.
Issued, Subscribed and Paid-up Share Capital **	Rs. 1,00,00,000/- (Rupees One Crore only) divided into 10,00,000 Equity Shares of Rs. 10/- each.

* During the financial year under review, Authorized Share Capital of the Company increased from Rs. 1,00,00,000 (Rupees One Crore Only) divided into 10,00,000 (Ten Lakh) Equity Shares of Rs. 10/- each to Rs. 225,00,00,000 (Rupees Two Hundred Twenty Five Crore Only) divided into 22,50,00,000 (Twenty Two Crores Fifty Lakhs) Equity Shares of Rs. 10/- each.

** Allotment of 8,25,80,000 (Eight Crore Twenty Five Lakh Eighty Thousand) Equity shares of Rs. 10/- (Ten) each to equity share holders of the Company on right basis, which shall rank Pari passu in all respect with existing share holders w.e.f 24th July, 2020.

8. SUBSIDIARIES, JOINT VENTURES AND ASSOCIATE COMPANIES:

The Company is Joint Venture Company promoted by, Gujarat Rail Infrastructure Development Corporation Limited, Gujarat Industrial Development Corporation and Maruti Suzuki India Limited. Therefore by virtue of share holding pattern the company becomes associate company of J.V. Partners.

9. DISCLOSURE REGARDING ISSUE OF EQUITY SHARES WITH DIFFERENTIAL RIGHTS:

The Company has not issued any Equity Shares with Differential Voting Rights during the financial year and it is therefore not required to make disclosures specified in Rule 4 (4) of Companies (Share Capital and Debenture) Rules, 2014.

10. DISCLOSURE REGARDING ISSUE OF SWEAT EQUITY SHARES:

The Company has not issued any Sweat Equity Shares during the financial year and it is therefore not required to make disclosures specified in Rule 8 (13) of Companies (Share Capital and Debenture) Rules, 2014.

11. DISCLOSURE REGARDING ISSUE OF EMPLOYEE STOCK OPTION:

The company has not issued any shares under Employee Stock Option Scheme during the financial year and it is therefore not required to make disclosures specified in Rule 12 (9) of Companies (Share Capital and Debenture) Rules, 2014.

12. PARTICULARS OF EMPLOYEES:

As the Bahucharaji Rail Corporation Limited is not a Listed Company therefore section 197 (12) and Companies (Appointment and Remuneration of Managerial Personnel) Rules, 2014, statement of particulars of employees are not applicable to the Company.

13. DIRECTORS AND KEY MANAGERIAL PERSONNEL:

During the financial year under review, following changes have been made in the Composition of the Board of Directors as on the date of this Report are as follows:

Mr. Zaigham Ali Khan (DIN: 07655360) resigned from directorship on account of transfer.
Mr. Dharmesh Narharibhai Brahmbhatt (DIN: 08268559) resigned from directorship and
in his place Ms. Kavita Sheth (Shah) (DIN: 08268558) was appointed as Woman Director as representative of GIDC.

Ms. Kavita Sheth (Shah) (DIN: 08268558) who was appointed as additional woman director during the year ceases to be director at ensuing Annual General Meeting and is being appointed as regular Woman Director of the Company.

14. MANAGERIAL REMUNERATION:

The Company is not required to make disclosures pursuant to Rule 5 of Companies (Appointment and Remuneration of Managerial Personnel) Rules, 2014 relating to Managerial Remuneration being an Unlisted Company.

15. DIRECTORS LIABLE TO RETIRE BY ROTATION:

Pursuant to the Section 152(6) of the Companies Act, 2013, Shri Bajrang Warli (DIN: 07133942) and Shri Raj Swarup Kapoor(DIN: 08303688) retires by rotation at the AGM of the Company and being eligible offer themselves for re-appointment.

The Company has received the disclosure in Form DIR-8 stating that they are eligible to be re-appointed at the forthcoming Annual General Meeting of the Company.

16. DEPOSITS:

During the financial year under review, the Company has not accepted any Deposits from the public and it is therefore not required to comply with the requirement under the Companies (Accounts) Rules, 2014.

17. BOARD MEETING:

Notice of Meeting is prepared and circulated in advance to the Directors as required under Secretarial Standards. During the year, Four Board Meetings were convened and held on 08/05/2019, 15/07/2019, 14/11/2019, and 09/01/2020.

18. BOARD EVALUATION:

Bahucharaji Rail Corporation Limited is incorporated as State Government Company, a Joint Venture of GIDC, G-RIDE and MSIL. Therefore Clause(p) of Sub-section (3) of Section 134 shall not apply.

19. AUDITORS:

The Auditors, M/s. SHAH & DALAL (FRN:109432W), Chartered Accountant, Ahmedabad, were appointed as Statutory Auditors of the Company for the Financial Year 2020-2021 by the Comptroller and Auditor General of India, vide Letter No. CA.V/COY/GUJARAT, BRCL(1)/235 dated 14/08/2020.

20. AUDITORS' REPORT:

The Auditors' Report does not contain any qualification. Notes to Accounts and Auditors remarks in their report are self-explanatory and do not call for any further comments.

21. COMMENTS OF THE COMPTROLLER AND AUDITOR GENERAL OF INDIA UNDER SECTION 143(6)(b) OF THE COMPANIES ACT, 2013:

The Company has received letter No. A.M.G.1/Accounts/BRCL/2019-20/OW.59 dated 04th September, 2020 from Comptroller and Auditor General of India on the audited accounts of the company for the year ended on 31/03/2020 stating that nothing significant has come to the knowledge which would give raise to any comment upon statutory Auditors' Report by C & AG.

22. EXTRACT OF ANNUAL RETURN:

Pursuant to section 92(3) of the Companies Act, 2013 and rule 12(1) of the Companies (Management and Administration) Rules, 2014, an extract of annual return in Form – MGT

9 as a part of this Annual Report as **ANNEXURE II**.

23. INTERNAL AUDIT & CONTROLS:

The internal auditor appointed was M/s. Thakkar Dhaval R. & Associates were appointed as internal auditor for FY 2019-20. The Company has initiated process for appointment of Internal Auditors for further years by following Tender Process.

24. CORPORATE SOCIAL RESPONSIBILITY (CSR):

During the year under review, under Section 135 of the Companies Act, 2013 the provision of Corporate Social Responsibility is not applicable to the company.

25. RISK MANAGEMENT POLICY:

BRCL shall identify the possible risks associated with its business and commits itself to put in place a Risk Management Frame work to address the risk involved on an ongoing basis to ensure achievement of the business objective without any interruptions. BRCL shall optimize the risks involved by managing their exposure and bringing them in line with the acceptable risk appetite of the Company.

26. CONSERVATION OF ENERGY, TECHNOLOGY ABSORPTION AND FOREIGN EXCHANGE EARNINGS AND OUTGO:

The Company has no activities which require disclosure relating to conservation of energy or technology absorption as it is not a Manufacturing Company. There has been no foreign exchange earnings or outgo during the year under review.

27. MATERIAL CHANGES AND COMMITMENTS, IF ANY, AFFECTING THE FINANCIAL POSITION BETWEEN THE END OF THE FINANCIAL YEAR AND THE DATE OF THE REPORT:

No material changes and commitments have occurred after the close of the financial year till the date of this report, which affect the financial position of the Company other than those specifically highlighted in this report.

28. DETAILS OF SIGNIFICANT AND MATERIAL ORDERS PASSED BY THE REGULATORS OR COURTS OR TRIBUNALS IMPACTING THE GOING CONCERN STATUS AND COMPANY'S OPERATIONS IN FUTURE:

No significant or material orders were passed by the regulator or court or tribunals which impact the going concern status and Company's operations in future.

29. OBLIGATION OF COMPANY UNDER THE SEXUAL HARASSMENT OF WOMEN AT WORKPLACE (PREVENTION, PROHIBITION AND REDRESSAL) ACT, 2013:

In order to prevent sexual harassment of women at work place a new act The Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal) Act, 2013 has been notified on 9th December, 2013. Under the said Act every company is required to set up an Internal Complaints Committee to look into complaints relating to sexual harassment at work place of any women employee.

Company will adopt a policy in future for prevention of Sexual Harassment of Women at workplace and will set up Committee for implementation of said policy, if required. During the financial year under review, Company has not received any complaint of harassment.

30. PARTICULARS OF LOANS, GUARANTEES AND INVESTMENTS:

During the year under review, the Company has not given any loans, made any investments or given guarantees on any loans, which fall within the purview of the provisions of Section 134(3)(g) of the Companies Act, 2013 and hence, no disclosures are required to be made thereof.

31. PARTICULARS OF CONTRACTS OR ARRANGEMENTS WITH RELATED PARTIES:

During the year under review, contracts and arrangements with related parties under Section 188(1) of the Companies Act, 2013, are reported in the Audited Balance sheet of the Company.

32. AUDIT COMMITTEE:

During the year under review, the provisions pursuant to Section 178 of the Companies Act, 2013 read with Rule (6) of the Companies (Meetings of Board and its Powers) Rules, 2014 was not applicable to the company in context of Audit Committee.

33. NOMINATION AND REMUNERATION COMMITTEE:

During the year under review, the provisions pursuant to Section 178 of the Companies Act, 2013 read with rule (6) of the Companies (Meetings of Board and its Powers) Rules, 2014 were not applicable to the company in context of Nomination and Remuneration Committee.

34. DIRECTORS' RESPONSIBILITY STATEMENT:

The Directors' Responsibility Statement referred to in clause (c) of sub-section (3) of Section 134 of the Companies Act, 2013, shall state that—

- (a) In the preparation of the Annual Accounts, the applicable Accounting Standards had been followed along with proper explanation relating to material departures;
- (b) the Directors had selected such Accounting Policies and applied them consistently and made judgments and estimates that are reasonable and prudent so as to give a true and fair view of the state of affairs of the Company at the end of the financial year and of the profit and loss of the Company for that financial year;
- (c) The Directors had taken proper and sufficient care for the maintenance of adequate accounting records in accordance with the provisions of this Act for safeguarding the assets of the Company and for preventing and detecting fraud and other irregularities;
- (d) The Directors had prepared the Annual Accounts on a going concern basis;
- (e) The Directors had devised proper systems to ensure compliance with the provisions of all applicable laws and that such systems were adequate and operating effectively.

35. SECRETARIAL AUDIT REPORT:

Section 204 of the companies Act, 2013 relating to Secretarial Audit is not applicable to the Company. Therefore the Company is not required to obtain Secretarial Audit Report in Form No. MR-3 pursuant to Section 204(1) of the Companies Act, 2013 and rule (9) of the Companies (Appointment and Remuneration of Managerial Personnel) Rules, 2014.

36. TRANSFER OF AMOUNTS TO INVESTOR EDUCATION AND PROTECTION FUND:

In terms of Section 124 of the Companies Act, 2013, read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, shares of the Company in respect of which dividend entitlements have remained unclaimed or unpaid for seven consecutive years or more, are required to be transferred by the Company to the Investor Education and Protection Fund (IEPF) of the Government of India. There were no such instances requiring compliance with the same.

37. ACKNOWLEDGEMENTS:

Your Directors express their warm wish to place on record their sincere appreciation to the Co-Operation extended by the Registrar of Companies, Comptroller & Auditor General of India and Statutory Auditors. The Directors are also grateful to the Government of Gujarat, MSIL, GIDC Officers and staff of the Company for their co-operation and look forward for their continued support.

**For & on behalf of the Board of Directors of
BAHUCHARAJI RAIL CORPORATIONLIMITED**

Place : Gandhinagar

Date : 22/09/2020

Sd/-
ASHWINIKUMAR RAJENDRAPRASAD YADAV
Chairman
DIN: 06581753

ANNEXURE - I

Office of the Principal Accountant General (Audit)-II, Gujarat

No.AMG-1/Accounts/BRCL/2019-20/0W59/04.09.2020

To,

Managing Director,

Bahucharaji Rail Corporation Limited,
7th Floor, Block No-6, Udyog Bhavan
Sector-11, Gandhinagar-382011

Subject: Comment of the Comptroller and Auditor General of India under Section 143(6)(b) of the Companies Act, 2013 on the financial statements of Bahucharaji Rail Corporation Limited for the year ended 31 March 2020.

Sir,

Please find enclosed nil comment certificate of the Comptroller and Auditor General of India under Section 143(6)(b) of the Companies Act, 2013 on the financial statements of Bahucharaji Rail Corporation Limited for the year ended 31 March 2020 for being placed before Annual General Meeting of the Company.

Under Section 143(6) of the Companies Act, 2013 the comments of the Comptroller and Auditor General of India are required to be sent by Company to every person entitled to copies of audited financial statements under Section 136(1) of the Companies Act, 2013 and also to be placed before the Annual General Meeting of the Company at the same time and in the same manner as the Statutory Auditor's Report of the Company. The date of placing the Report of the Comptroller and Auditor General of India before the Annual General Meeting may please be intimated to this office.

Six copies of the printed accounts may please be sent to this office for our use and record.

Receipt of this letter with its enclosures may please be acknowledged.

Yours faithfully,

Sr. Dy. Accountant General(AMG-I)

Encl: As above

**COMMENTS OF THE COMPTROLLER AND AUDITOR GENERAL OF INDIA UNDER SECTION
143(6)(b)OF THE COMPANIES ACT, 2013 ON THE FINANCIAL STATEMENTS OF
BAHUCHARAJI RAIL CORPORATION LIMITED FOR THE YEAR ENDED 31 MARCH 2020**

The preparation of financial statements of the Bahucharaji Rail Corporation Limited for the year ended 31 March 2020 in accordance with the financial reporting framework prescribed under the Companies Act, 2013 (Act) is the responsibility of the Management of the Company. The Statutory Auditors appointed by the Comptroller and Auditor General of India under Section 139 (5) of the Act are responsible for expressing opinion on the financial statements under Section 143 of the Act based on independent audit in accordance with the Standards on Auditing prescribed under Section 143 (10) of the Act. This is stated to have been done by them vide their Revised Audit Report dated 04July 2020.

I, on behalf of the Comptroller and Auditor General of India, have conducted a supplementary audit of the financial statements of Bahucharaji Rail Corporation Limited for the year ended 31 March 2020 under Section 143(6)(a) of the Act, This supplementary audit has been carried out independently without access to the working papers of the Statutory Auditors and is limited primarily to inquiries of the Statutory Auditors and Company personnel and a selective examination of some of the accounting records.

On the basis of my audit nothing significant has come to my knowledge which would give rise to any comment upon or supplement to Statutory Auditor's Report.

For and on behalf of the
Comptroller and Auditor General of India

Sd/-

(H.K. Dharmadarshi)
Principal Accountant General (Audit-II), Gujarat

Place: Ahmedabad
Date:04/09/2020

ANNEXURE - II
FORM NO. MGT 9
EXTRACT OF ANNUAL RETURN

As on financial year ended on 31.03.2020

**Pursuant to Section 92 (3) of the Companies Act, 2013 and rule 12(1) of the
Company (Management & Administration) Rules, 2014**

I. REGISTRATION & OTHER DETAILS:

1.	CIN	U45101GJ2018SGC105602
2.	Registration Date	13/12/2018
3.	Name of the Company	BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
4.	Category/Sub-category of the Company	Company Limited by Shares State Government Company
5.	Address of the Registered office & contact details	Block No. 6, 7 th Floor, Udyog Bhavan, Sector-11, Gandhinagar – 382011
6.	Whether listed company	No
7.	Name, Address & contact details of the Registrar & Transfer Agent, if any.	Not Applicable

II. PRINCIPAL BUSINESS ACTIVITIES OF THE COMPANY:

(All the business activities contributing 10 % or more of the total turnover of the company shall be stated)

SN	Name and Description of Main Products/ Services	NIC Code of the Product/ Service	% to total turnover of the company
			NIL

III. PARTICULARS OF HOLDING, SUBSIDIARY AND ASSOCIATE COMPANIES:

SN	Name and Address of the Company	CIN/GLN	Holding/ Subsidiary / Associate	% of Shares Held	Applicable Section
1.	Gujarat Rail Infrastructure Development Corporation Limited	U74999GJ2017SGC095040	Associate	41.00	2(6)
2.	Gujarat Industrial Development Corporation	Not Applicable	Associate	26.00	2(6)
3.	Maruti Suzuki India Limited	L34103DL1981PLC011375	Associate	33.00	2(6)

IV. SHARE HOLDING PATTERN (Equity Share Capital Breakup as percentage of Total Equity)
i) Category-wise Share Holding

Category of Share Holders	No. of Shares held at the beginning of the Year [As on 31-March - 2019]				No. of Shares held at the end of the Year [As on 31-March - 2019]				% Change during the year	
	Dem at	Physical	Total	% of Total Shares	Dem at	Physical	Total	% of Total Shares		
A. Promoters										
(1) Indian										
a) Individual/ HUF	-	-	-	-	-	-	-	-	-	
b) Central Govt	-	-	-	-	-	-	-	-	-	
c) State Govt(s)	-	-	-	-	-	-	-	-	-	
d) Bodies Corp.	-	-	-	-	-	-	-	-	-	
e) Banks / FI	-	-	-	-	-	-	-	-	-	
f) Any other Company	-	10,00,000	10,00,000	100	-	10,00,000	10,00,000	100	-	
Sub-Total [A](1)	-	-	-	-	-	-	-	-	-	
(2) Foreign	-	-	-	-	-	-	-	-	-	
a) NRI-Individual	-	-	-	-	-	-	-	-	-	
b) Other-Individual	-	-	-	-	-	-	-	-	-	
c) Bodies Corp.	-	-	-	-	-	-	-	-	-	
d) Banks / FI	-	-	-	-	-	-	-	-	-	
e) Any other	-	-	-	-	-	-	-	-	-	
Sub-Total [A] (2)	-	-	-	-	-	-	-	-	-	
Total shareholding of Promoter (A) = (A) (1)+(A) (2)	-	-	-	-	-	-	-	-	-	
B. Public Shareholding										
1. Institutions	-	-	-	-	-	-	-	-	-	
a) Mutual Funds	-	-	-	-	-	-	-	-	-	
b) Banks / FI	-	-	-	-	-	-	-	-	-	
c) Central Govt	-	-	-	-	-	-	-	-	-	
d) State Govt(s)	-	-	-	-	-	-	-	-	-	
e) Venture Capital Funds	-	-	-	-	-	-	-	-	-	
f) Insurance Companies	-	-	-	-	-	-	-	-	-	
g) FIIs	-	-	-	-	-	-	-	-	-	
h) Foreign Venture Capital Funds	-	-	-	-	-	-	-	-	-	
i) Others (specify)	-	-	-	-	-	-	-	-	-	
Sub-total (B)(1):-	-	-	-	-	-	-	-	-	-	
2. Non-Institutions										
a) Bodies Corp.	-	-	-	-	-	-	-	-	-	
i) Indian	-	-	-	-	-	-	-	-	-	
ii) Overseas	-	-	-	-	-	-	-	-	-	
b) Individuals	-	-	-	-	-	-	-	-	-	
i) Individual share holders holding nominal share capital upto Rs. 1 lakh	-	-	-	-	-	-	-	-	-	
ii) Individual shareholders holding nominal share capital in excess of Rs 1 lakh	-	-	-	-	-	-	-	-	-	
c) Others (specify)	-	-	-	-	-	-	-	-	-	
Sub-total (B)(2):-	-	-	-	-	-	-	-	-	-	
Total Public Shareholding (B)=(B)(1)+ (B)(2)	-	-	-	-	-	-	-	-	-	
C. Shares held by Custodian for GDRs & ADRs	-	-	-	-	-	-	-	-	-	
Grand Total (A+B+C)	-	10,00,000	10,00,000	100	-	10,00,000	10,00,000	100	-	

ii) Shareholding of Promoter

Sr. No	Share Holder's Name	Share holding at the beginning of the year			Share holding at the end of the year [As on 31 - March - 2020]			% Change in share holding during the year
		No. of Shares	% of total Shares of the Company	% of Shares Pledge / encumbered to total shares	No. of Shares	% of total Shares of the Company	% of Shares Pledge / encumbered to total shares	
1	Mr. Ashwinikumar Rajendraprasad Yadav , IAS (For and on Behalf of Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE))	4,09,998	41.00	-	4,09,998	41.00	-	-
2	Mr. Zaigham Ali Khan , IRAS (Nominee Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE))	1	0.00	-	1	0.00	-	-
3	Mr. Santosh Kumar , IRSE (Nominee of Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE))	1	0.00	-	1	0.00	-	-
4	Mr.Bajrang Chhaganbhai Warli (For and on Behalf of Gujarat Industrial Development Corporation (GIDC))	2,59,999	26.00	-	2,59,999	26.00	-	-
5	Mr.Dharmesh Narharibhai Brahmbhatt (Nominee of Gujarat Industrial Development Corporation (GIDC))	1	0.00	-	1	0.00	-	-
6	Mr. Sanjeev Grover (For and on Behalf of MARUTI SUZUKI INDIA LIMITED)	3,29,999	33.00	-	3,29,999	33.00	-	-
7	Mr. Raj Swarup Kapoor (Nominee of MARUTI SUZUKI INDIA LIMITED)	1	0.00	-	1	0.00	-	-
Total		10,00,000	100.00	-	10,00,000	100.00	-	-

iii) Change in Promoters' Shareholding (please specify, if there is change) - NO CHANGE

S N	Particulars	Shareholding at the beginning of the year		Cumulative Shareholding during the year	
		No. of shares	% of total shares of the company	No. of shares	% of total shares of the company
	At the beginning of the year	-	-	-	-
	No Change	-	-	-	-
	At the end of the year	-	-	-	-

iv) Shareholding Pattern of top ten Shareholders (Other than Directors, Promoters Holders of and GDRs and ADRs): NOT APPLICABLE

SN	For Each of the Top 10 Shareholders	Shareholding at the beginning of the year		Cumulative Shareholding during the year	
		No. of shares	% of total shares of the company	No. of shares	% of total shares of the company
	At the beginning of the year	-	-	-	-
	No Change	-	-	-	-
	At the end of the year	-	-	-	-

v) Shareholding of Directors and Key Managerial Personnel:

S N	Particulars	Shareholding at the beginning of the year		Cumulative Shareholding during the year	
		No. of shares	% of total shares of the company	No. of shares	% of total shares of the company
1.	ASHWINIKUMAR RAJENDRAPRASAD YADAV , IAS (For and on Behalf of Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE))				
	At the beginning of the year	4,09,998	41.00	-	-
	No Change	-	-	-	-
	At the end of the year	4,09,998	41.00	4,09,998	41.00
2.	BAJRANG WARLI CHHAGANBHAI (For and on Behalf of Gujarat Industrial Development Corporation (GIDC))				
	At the beginning of the year	2,59,999	26.00	-	-
	No Change	-	-	-	-
	At the end of the year	2,59,999	26.00	2,59,999	26.00
3.	SANTOSH KUMAR, IRSE (Nominee of Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE))				
	At the beginning of the year	1	0.00	-	-
	No Change	-	-	-	-
	At the end of the year	1	0.00	1	0.00
5.	BATCHU VENUGOPAL				
	At the beginning of the year	-	-	-	-
	No Change	-	-	-	-
	At the end of the year	-	-	-	-
6.	RAJ SWARUP KAPOOR (Nominee of MARUTI SUZUKI INDIA LIMITED)				
	At the beginning of the year	1	0.00	-	-
	No Change	-	-	-	-
	At the end of the year	1	0.00	1	0.00
8.	KAVITA RAKESHKUMAR SHAH (Nominee of Gujarat Industrial Development Corporation (GIDC))				
	At the beginning of the year	-	-	-	-
	No Change	-	-	-	-
	At the end of the year	-	-	-	-

V. INDEBTEDNESS-Indebtedness of the Company including interest outstanding/accrued but not due for payment:

	Secured Loans excluding deposits	Unsecured Loans	Deposits	Total Indebtedness
Indebtedness at the beginning of the F. Y.				
i) Principal Amount	0	0	0	0
ii) Interest due but not paid	0	0	0	0
iii) Interest accrued but not due	0	0	0	0
Total (i+ii+iii)	0	0	0	0
Change in Indebtedness during the F. Y.				
* Addition	0	14,36,86,567	0	14,36,86,567
* Reduction	0	0	0	0
Net Change	0	14,36,86,567	0	14,36,86,567
Indebtedness at the end of the F. Y.				
i) Principal Amount	0	14,31,27,855	0	14,31,27,855
ii) Interest due but not paid	0	5,58,712	0	5,58,712
iii) Interest accrued but not due	0	0	0	0
Total (i+ii+iii)	0	14,36,86,567	0	14,36,86,567

VI. REMUNERATION OF DIRECTORS AND KEY MANAGERIAL PERSONNEL:

- A. Remuneration to Managing Director, Whole-Time Directors and/or Manager:
NOT APPLICABLE
- B. Remuneration to other Directors: **NOT APPLICABLE**
- C. Remuneration to Key Managerial Personnel Other than MD/ Manager/
WTD:**NOT APPLICABLE**

VII. PENALTIES/ PUNISHMENT / COMPOUNDING OF OFFENCES:NOT APPLICABLE

**For & on behalf of the Board of Directors of
BAHUCHARAJI RAIL CORPORATIONLIMITED**

**Place: Gandhinagar
Date:22/09/2020**

**Sd/-
ASHWINIKUMAR RAJENDRAPRASAD YADAV
Chairman
DIN: 06581753**

INDEPENDENT AUDITORS' REPORT

TO THE MEMBERS OF

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

Report on the Financial Statements

Opinion

We have audited the accompanying financial statements of BAHUCHARAJI RAIL CORPORATION LIMITED ('the Company'), which comprise the Balance Sheet as at March 31, 2020, the Statement of Profit and Loss for the year then ended, the statement of cash flows for the year then ended, Statement of Changes in Equity for the year then ended and notes to the financial statements, including a summary of significant accounting policies and other explanatory information.

In our opinion and to the best of our information and according to the explanations given to us, the aforesaid financial statements give the information required by the Act in the manner so required and give a true and fair view in conformity with the accounting principles generally accepted in India including Ind AS, of the state of affairs of the Company as at March 31, 2020, and its financial performance, its cash flows and the changes in equity for the year ended on that date.

Basis of Opinion

We conducted our audit in accordance with the Standards on Auditing (SAs) specified under section 143(10) of the Companies Act, 2013. Our responsibilities under those Standards are further described in the Auditor's Responsibilities for the Audit of the Financial Statements section of our report. We are independent of the Company in accordance with the Code of Ethics issued by the Institute of Chartered Accountants of India together with the ethical requirements that are relevant to our audit of the financial statements under the provisions of the Companies Act, 2013 and the Rules thereunder, and we have fulfilled our other ethical responsibilities in accordance with these requirements and the Code of Ethics. We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our opinion on the Standalone Financial Statements.

Management's Responsibility for the Standalone Financial Statements

The Company's Board of Directors is responsible for the matters stated in Section 134(5) of the Companies Act 2013 ("the Act") with respect to the preparation of these financial statements that

give a true and fair view of the financial position, financial performance and cash flows of the Company in accordance with the accounting principles generally accepted in India, including the Indian Accounting Standards (Ind AS) specified under Section 133 of the Act, read with Rule 7 of the Companies (Accounts) Rules, 2014.

This responsibility also includes maintenance of adequate accounting records in accordance with the provisions of the Act for safeguarding of the assets of the Company and for preventing and detecting frauds and other irregularities; selection and application of appropriate accounting policies; making judgments and estimates that are reasonable and prudent; and design, implementation and maintenance of adequate internal financial controls, that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and presentation of the financial statements that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error.

In preparing the financial statements, management is responsible for assessing the Company's ability to continue as a going concern, disclosing, as applicable, matters related to going concern and using the going concern basis of accounting unless management either intends to liquidate the Company or to cease operations, or has no realistic alternative but to do so.

Those Board of Directors are also responsible for overseeing the Company's financial reporting process.

Auditor's Responsibilities for the Audit of the Financial Statements

Our objectives are to obtain reasonable assurance about whether the financial statements as a whole are free from material misstatement, whether due to fraud or error, and to issue an auditor's report that includes our opinion. Reasonable assurance is a high level of assurance, but is not a guarantee that an audit conducted in accordance with SAs will always detect a material misstatement when it exists. Misstatements can arise from fraud or error and are considered material if, individually or in the aggregate, they could reasonably be expected to influence the economic decisions of users taken on the basis of these financial statements.

As part of an audit in accordance with SAs, we exercise professional judgment and maintain professional skepticism throughout the audit. We also:

- Identified and assessed the risks of material misstatement of the financial statements, whether due to fraud or error, design and also performed audit procedures responsive to those risks, and

obtain audit evidence that is sufficient and appropriate to provide a basis for our opinion.

- Obtained an understanding of internal control relevant to the audit in order to design audit procedures that are appropriate in the circumstances. Under section 143(3)(i) of the Companies Act, 2013, we are also responsible for expressing our opinion on whether the company has adequate internal financial controls system in place and the operating effectiveness of such controls.
- Evaluated the appropriateness of accounting policies used and the reasonableness of accounting estimates and related disclosures made by management.
- Concluded on the appropriateness of management's use of the going concern basis of accounting and, based on the audit evidence obtained, whether a material uncertainty exists related to events or conditions that may cast significant doubt on the Company's ability to continue as a going concern. If we conclude that a material uncertainty exists, we are required to draw attention in our auditor's report to the related disclosures in the financial statements or, if such disclosures are inadequate, to modify our opinion. Our conclusions are based on the audit evidence obtained up to the date of our auditor's report. However, future events or conditions may cause the Company to cease to continue as a going concern.
- Evaluated the overall presentation, structure and content of the financial statements including the disclosures, and whether the financial statements represent the underlying transactions and events in a manner that achieves fair presentation.
- We have conducted our audit in accordance with Standards on Auditing specified under section 143(10) of the Act. Those Standards require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether the financial statements are free from material misstatement.

We communicate with those charged with governance regarding, among other matters, the planned scope and timing of the audit and significant audit findings, including any significant deficiencies in internal control that we identify during our audit.

We also provide those charged with governance with a statement that we have complied with relevant ethical requirements regarding independence, and to communicate with them all relationships and other matters that may reasonably be thought to bear on our independence, and where applicable, related safeguards.

From the matters communicated with those charged with governance, we determine those matters that were of most significance in the audit of the financial statements of the current period and are therefore the key audit matters. We describe these matters in our auditor's report unless law or regulation precludes public disclosure about the matter or when, in extremely rare circumstances, we determine that a matter should not be communicated in our report because the adverse consequences of doing so would reasonably be expected to outweigh the public interest benefits of such communication.

Report on Other Legal and Regulatory Requirements

1. As required by the Companies (Auditor's Report) Order, 2016 ("the Order") issued by the Central Government in terms of Section 143(11) of the Act, we give in "**Annexure A**" a statement on the matters specified in paragraphs 3 and 4 of the Order, to the extent applicable.
2. We are enclosing our report in terms of section 143(5) of the act, on the basis of such checks of the Books and Records of the company as we considered appropriate and according to information and explanation given to us, in the "**Annexure B**" on the direction and sub-directions issued by Comptroller and Auditor General of India.
3. As required by Section 143(3) of the Act, we report that:
 - a) We have sought and obtained all the information and explanations which to the best of our knowledge and belief were necessary for the purposes of our audit;
 - b) In our opinion, proper books of account as required by law have been kept by the Company so far as it appears from our examination of those books;
 - c) The Balance Sheet, the Statement of Profit &Loss and the Cash Flow Statement dealt with by this Report are in agreement with the books of account;
 - d) In our opinion, the aforesaid financial statements comply with the Accounting Standards specified under Section 133 of the Act, read with Rule 7 of the Companies (Accounts) Rules, 2014;
 - e) The company being Government Company, provisions of sub section 2 of section 164 of the Companies Act, 2013 are not applicable as per Notification No.G.S.R.463 [E] dated 5th June, 2015 of Ministry of Corporate Affairs;
 - f) With respect to the adequacy of the internal financial controls over financial reporting

of the Company and the operating effectiveness of such controls, refer to our separate report in "**Annexure C**"; and

- g) With respect to the other matters to be included in the Auditor's Report in accordance with Rule 11 of the Companies (Audit and Auditors) Rules , 2014, in our opinion and to the best of our knowledge and belief and according to the information and explanations given to us:
1. The Company does not have any pending litigations as on Balance Sheet dated March 31, 2020.
 2. The Company has made provision, as required under the applicable law or accounting standards, for material foreseeable losses, if any, on long-term contracts including derivative contracts.
 3. There has been no delay in transferring amounts, required to be transferred, to the Investor Education and Protection Fund by the Company.

for **Shah & Dalal**
Chartered Accountants
[FRN: 109432W]

Place : Ahmedabad

Date : 04/07/2020

Sd/-
Malay Dalal
Partner
M. No. : 036776

"ANNEXURE A" REFERRED TO IN THE INDEPENDENT AUDITOR'S REPORT

Of even date to the members of BAHUCHARAJI RAIL CORPORATION LIMITED on the Financial Statements for the year ended 31st March, 2020.

(Referred to in paragraph 1 under 'Report on other legal and regulatory requirement of our report of even date)

Based on the audit procedures performed for the purpose of reporting a true and fair view on the Financial Statements of the Company and taking into consideration the information and explanations given to us and the books of account and other records examined by us in the normal course of audit, we report that:

(I) In respect of its fixed assets:

The company does not have any fixed asset therefore this clause is not applicable. However the company has Capital Asset Work in Progress and it is reflected in Financial Statement.

- (ii) The company does not have any inventory therefore this clause is not applicable.
- (iii) The company has not granted any loans, secured or unsecured, to companies, firms, Limited Liability Partnership or other parties covered in the register maintained under section 189 of the Companies Act, 2013.
- (iv) According to the information and explanation given to us, the Company has not granted any loans, nor given any guarantees and securities u/s 185 and 186 of the Companies Act, 2013. Hence reporting under clause (iv) of CARO 2016 is not applicable to the Company.
- (v) According to the information and explanation given to us, the Company has not accepted any deposits from the public within the meaning of provision of section 73 to 76 of the Act and the rules framed there under and hence reporting under clause (v) of the CARO 2016 is not applicable.
- (vi) The maintenance of cost records specified by the Central Government under section 148(1) of the Companies Act, 2013 is not applicable to this Company. Hence reporting under clause (vi) of CARO 2016 is not applicable to the Company.
- (vii) According to the information and explanation given to us, in respect of statutory dues:

- (a) The Company had been regular in depositing undisputed statutory dues, including, Income Tax, Goods and Service Tax, and other material statutory dues applicable to it

to the appropriate authorities.

- (b) There is no dispute with revenue authorities regarding any duty or tax payable.
- (viii) According to the information and explanation given to us, the Company has not defaulted in repayment of dues to a financial institution or bank.
- (ix) To the best of our knowledge and according to the information and explanation given to us, during the year Company has not raised money by way of Initial Public Offer and/or Further Public Offer(including Debt Instrument) and also company has not obtained any Term loan and therefore this clause is not applicable to the company.
- (x) To the best of our knowledge and according to the information and explanation given to us, no fraud by the Company and no fraud on the Company by its officers or employees has been noticed or reported during the period.
- (xi) The Company is exempted from section 197 of the Companies Act, 2013 since this is the Government Company as per Notification No.G.S.R.463 [E] dated 5th June, 2015 of Ministry of Corporate Affairs. Hence reporting under clause (xi) of CARO 2016 is not applicable to the Company.
- (xii) The Company is not a Nidhi Company and hence reporting under clause (xii) of CARO 2016 is not applicable to the Company.
- (xiii) In our opinion and according to the information and explanation given to us the Company is in compliance with section 188 and 177 of the Companies Act, 2013, where applicable. For all transaction with the related parties and the details of related parties transaction have been disclosed in the financial statements etc, as required by the applicable Indian Accounting Standards.
- (xiv) During the period the Company has not made any preferential allotment or private placement of shares or fully or partly convertible debentures and hence reporting under clause (xiv) of CARO 2016 is not applicable to the Company.
- (xv) In our opinion and according to the information and explanation given to us, during the period the Company has not entered into any non-cash transaction with its directors or persons connected with him and hence provision of section 192 of the Companies Act, 2013 are not applicable.

(xvi) The company is not required to be registered under section 45-IA of the Reserve Bank of India Act, 1934.

for **Shah & Dalal**
Chartered Accountants
[FRN: 109432W]

Place : Ahmedabad

Date : 04/07/2020

Sd/-
Malay Dalal
Partner
M. No. : 036776

**"ANNEXURE B" REFERRED TO IN THE INDEPENDENT AUDITORS' REPORT
of even date to The members of BAHUCHARAJI RAIL CORPORATION LIMITED on the
Financial Statements for the year ended 31st March, 2020.**

(Referred to in paragraph 2 under 'Report on other legal and regulatory requirement of our report of even date)

**Report under Section 143(5) of Companies Act, 2013 for the Financial Year
2019-20**

1. MAIN DIRECTION:

Sr. No.	Directions	Comments
1.	Whether the Company has system in place to process all the accounting transactions through IT system? If no, the implications of processing of accounting transactions outside IT system on the integrity of the accounts along with the financial implications, if any, may be stated.	Yes. All Accounting transactions are processed through IT Systems.
2.	Whether there is any restructuring of an existing loan or cases of waiver/write off of debts/loans/internet etc. made by a lender to the Company due to the Company's inability to repay the loan? If yes, the financial impact may be stated.	No waiver/write off is done during the period under Audit.
3.	Whether funds received/receivable for specific schemes from Central/State agencies were properly accounted for/ utilised as per its term and conditions? List the cases of deviation.	As per the information and explanation provided to us, the Company has not received any amount for specific scheme from Central/State agencies except share capital amount received from Gujarat Industrial Development Corporation and the same is accounted properly and deposited in bank account.

1. SECTOR SPECIFIC DIRECTIONS : INFRASTRUCTURE SECTOR

Sr. No.	Sub-Directions	Comments
1.	Whether the Company has taken adequate measures to prevent encroachment of idle land owned by it. Whether any land of the Company is encroached, under litigation, not put to use or declared surplus? Details may be provided.	As per the information and explanation provided to us, during the course of audit we have observed that the company has not acquired/own any land during the period under audit.
2.	Whether the system in vogue for identification of projects to be taken up under Public Private Partnership is in line with the guidelines/ policies of the Government? Comment on deviation if any.	Not Applicable.
3.	Whether system for monitoring the execution of works vis-à-vis thea-vis the milestones stipulated in the agreement is in existence and the impact of cost escalation, if any, revenues/ losses from contracts, etc., have been properly accounted for in the books.	As per the information and explanation provided to us, during the course of audit we have observed that company has awarded Tender for EPC for "Gauge Conversion of Katosan Road – Becharaji (26.6 KMs) Metre Gauge to Broad Gauge alongwith new MSIL BG Siding (Approx 3 KMs) at Becharaji with 25KV AC Electrification in Ahmedabad Division of Western Railway" in favour of M/s Kalpataru Power Transmission Limited. With reference to said EPC Contract, as informed to us, M/s Kalpataru Power Transmission Limited has not commenced the works activity and therefore this point is not applicable.

4.	Whether funds received/ receivable for specific schemes from central/ State agencies were properly accounted for/utilized? List the cases of deviations.	As per the information and explanation provided to us, the Company has not received any amount for specific scheme from Central/State agencies except share capital amount received from Gujarat Industrial Development Corporation and the same is accounted properly and deposited in bank account.
5.	Whether the bank guarantees have been revalidated in time?	As per the information and explanation provided to us, the company has not availed any Bank Guarantee during the year therefore this point is not applicable.
6.	Comment on the confirmation of balances of trade receivables, trade payables, term deposits, bank accounts and cash obtained.	We have obtained following Confirmations and all are in agreement with figures of Financial Statements: 1. Bank Balance Certificate from Yes Bank 2. Balance & Interest certificate of Deposit with GSFS. 3. Balance Confirmation of Gujarat Rail Infrastructure Development Limited There were no trade receivables as on Balance Sheet date.
7.	The cost incurred on abandoned projects may be quantified and the amount actually written-off shall be mentioned.	As per the information and explanation provided to us, there is no abandoned project therefore this point is not applicable.

For, Shah & Dalal
Chartered Accountants
[FRN: 109432W]

Sd/-

Malay Dalal

Partner

M. No. : 036776

Place : Ahmedabad

Date : 04/07/2020

ANNEXURE "C" TO THE INDEPENDENT AUDITOR'S REPORT

(Referred to in paragraph 3(f) under 'Report on other legal and regulatory requirement of our report of even date)

Report on the Internal Financial Controls over Financial Reporting under clause (i) of Sub section 3 of Section 143 of the companies Act, 2013 ('the Act').

We have audited the Internal financial controls over financial reporting of **BAHUCHARAJI RAIL CORPORATION LIMITED** ("the Company") as on 31st March, 2020 in conjunction with our audit of the standalone financial statements of the company for the year ended on that date.

MANAGEMENT'S RESPONSIBILITY FOR INTERNAL FINANCIAL CONTROLS

The Company's management is responsible for establishing and maintaining internal financial controls based on the internal control over financial reporting criteria established by the Company considering the essential component of internal control stated in the guidance note on audit of Internal Financial Controls over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India. These responsibility include the design implementation and maintenance of adequate internal financial controls that were operating effectively for ensuring the orderly and efficient conduct of its business, including adherence to company's policies, the safeguarding of its assets, the prevention and detection of frauds and errors, the accuracy and completeness of the accounting records, and the timely preparation of reliable financial information, as required under the Companies Act, 2013.

AUDITOR'S RESPONSIBILITY

Our responsibility is to express an opinion on the Company's Internal financial controls over financial reporting based on our audit. We conducted our audit in accordance with the guidance note on Audit of internal financial controls over financial reporting (the "Guidance Note") issued by the Institute of Chartered Accountants of India and the standards on auditing prescribed under Section 143(10) of the Companies Act, 2013, to the extent applicable to an audit of internal financial controls. Those standards and the guidance note require that we comply with ethical requirement and plan and perform the audit to obtain reasonable assurance about whether adequate financial controls over financial reporting was established and maintained and if such controls operated effectively in all material respects.

Our audit involves performing procedures to obtain audit evidence about the adequacy of the internal financial controls system over financial reporting and their operating effectiveness. Our audit of internal financial controls over financial reporting included obtaining an understanding of internal financial controls over financial reporting, assessing the risk that a material weakness exists, and testing and evaluating the design and operating effectiveness if internal control based on the assessed risk. The procedure selected depend on auditor's judgment, including the assessment of the risks of material misstatement of the financial statements, whether due of fraud or error.

We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion on the Company's internal financial controls system over financial reporting.

MEANING OF INTERNAL FINANCIAL CONTROLS OVER FINANCIAL REPORTING

A company's internal financial controls over financial reporting is a process designed to provide reasonable assurance regarding the reliability of financial reporting and the preparation for external purpose in accordance with generally accepted accounting principles. A company's internal financial control over financial reporting includes those policies and procedures that:

1. pertain to the maintenance of records that, in reasonable details, accurately and fairly reflect the transactions and dispositions of the assets of the company;
2. provide reasonable assurance that transaction are recorded as necessary to permit preparation of financial statement in accordance with generally accepted accounting principles, and that receipt and expenditures of the company are being made only in accordance with authorization of management and directors of the company; and
3. provide reasonable assurance regarding prevention or timely detection of unauthorized acquisition, use, or disposition of the company's assets that could have a material effect on the financial statements.

INHERENT LIMITATION OF INTERNAL FINANCIAL CONTROLS OVER FINANCIAL REPORTING

Because of the inherent limitation of internal financial controls over financial reporting, including the possibility of collusion or improper management override of controls, material misstatements due to error or fraud may occur and not be detected. Also, projection of any

evaluation of the internal financial controls over financial reporting to future periods are subject to the risk that the internal financial control over financial reporting may become inadequate because of changes in conditions, or that the degree of compliance with the policies or procedures may deteriorate.

OPINION

In our opinion, to the best of our information and according to the explanation given to us, the company has, in all material respects, an adequate internal financial controls system over financial reporting and such internal financial controls over financial reporting were operating effectively as at 31st March, 2020, based on the internal control over financial reporting criteria established by the Company considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls over Financial Reporting issued by the Institute of Chartered Accountant of India.

**For, Shah & Dalal
Chartered Accountants
[FRN: 109432W]**

Place : Ahmedabad

Date : 04/07/2020

**Sd/-
Malay Dalal
Partner
M. No. : 036776**

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
CIN:U45101GJ2018SGC105602
Balance Sheet as at March 31, 2020

(Amount in ₹)

Particulars	Note No.	As at March 31, 2020	As at March 31, 2019
I ASSETS			
NON-CURRENT ASSETS			
(a) Property, Plant and Equipment		--	--
(b) Capital Work-in-Progress	4	9 61 818	--
(c) Other Intangible Assets		--	--
(d) Intangible Assets Under Development		--	--
(e) Financial Assets			
(i) Investments		--	--
(ii) Trade Receivables		--	--
(iii) Loans		--	--
(iv) Other Financial Assets		--	--
(f) Deferred Tax Assets (Net)	5	--	--
(g) Other Non-current Assets	6	13 05 83 569	--
SUB-TOTAL		13 15 45 387	--
CURRENT ASSETS			
(a) Inventories		--	--
(b) Financial Assets			
(i) Investments		--	--
(ii) Trade Receivables		--	--
(iii) Cash and Cash Equivalents	7	13 90 076	74 08 400
(iv) Loans		--	--
(v) Other Financial Assets		--	--
(c) Current Tax Assets (Net)	8	--	--
(d) Other Current Assets	9	35 75 031	26 00 000
SUB-TOTAL		49 65 107	1 00 08 400
TOTAL ASSETS		13 65 10 494	1 00 08 400

II EQUITY AND LIABILITIES			
EQUITY			
(a) Equity share capital	10	1 00 00 000	--
(b) Other equity	11	(3 71 97 406)	(1 61 13 935)
SUB-TOTAL		(2 71 97 406)	(1 61 13 935)
LIABILITIES			
Share Application Money Pending for Allotment	12	--	1 00 00 000
NON-CURRENT LIABILITIES			
(a) Financial liabilities			
(i) Borrowings		--	--
(ii) Trade Payable		--	--
(iii) Other financial liabilities		--	--
(b) Provisions		--	--
(c) Deferred tax liabilities (net)		--	--
(d) Other non current liabilities		--	--
SUB-TOTAL		--	1 00 00 000
CURRENT LIABILITIES			
(a) Financial liabilities			
(i) Borrowings	13	14 31 27 855	--
(ii) Trade Payable	14	1 92 68 403	1 58 29 546
(b) Provisions	15	12 25 261	2 63 200
(c) Other current liabilities	16	86 381	29 589
(d) Current tax liabilities (net)	17	--	--
SUB-TOTAL		16 37 07 900	1 61 22 335
TOTAL EQUITY AND LIABILITIES		13 65 10 494	1 00 08 400

**Significant accounting policies & Notes forming part of 1, 2 & 3
Financial Statements**

Notes on accounts form integral part of the financial statements

As per our report of even date

For Shah & Dalal

Chartered Accountants

FRN. 109432W

Sd/-

(Malay Dalal)

Partner

Membership No. 036776

For and on behalf of the Board of Directors

Sd/-

(Santosh Kumar)

Director / CEO

DIN: 07854179

Sd/-

(B. C. WARLI)

Director

DIN: 07133942

Place: Ahmedabad

Date: July 04, 2020

Place: Gandhinagar

Date: July 04, 2020

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

CIN:U45101GJ2018SGC105602

Statement of Profit and Loss for the year ended on March 31, 2020

(Amount in ₹)

Particulars	Note No	For the period from April 01, 2019 to March 31, 2020	For the period from December 13, 2018 to March 31, 2019
Revenue			
I Revenue from operations		--	--
II Other Income	18	17 59 470	8 400
III Total Income (I+II)		17 59 470	8 400
IV Expenses			
Employee benefit expense, payment to contractors and consultants	19	6 35 003	29 474
Finance costs	20	--	--
Depreciation and amortisation expense	21	--	--
Other expenses	22	2 22 07 938	1 60 90 661
Total expenses (IV)		2 28 42 941	1 61 20 135
V Profit /(Loss) before exceptional item and taxes (III-IV)		(2 10 83 471)	(1 61 11 735)
VI Exceptional Item		--	--
VII Profit/(loss) before tax (V-VI)		(2 10 83 471)	(1 61 11 735)
VIII Tax expense			
Current tax		--	2 200
Deferred Tax		--	--
Total Tax Expenses		--	--
IX Profit/(loss) after tax for the period (VII-VIII)		(2 10 83 471)	(1 61 13 935)

X Other comprehensive income**A(i) Items that may not be reclassified to profit or loss**

(a) Changes in revaluation surplus	--	--
(b) Remeasurements of the defined benefit liabilities / (asset)	--	--
(c) Equity instruments through other comprehensive income	--	--
(d) Fair value changes relating to own credit risk	--	--
(e) Others (specify nature)	--	--
(ii) Income tax on items that will not be reclassified to profit or loss	--	--

B(i) Items that may be reclassified to profit or loss

(a) Exchange differences in translating the financial statements of foreign operations	--	--
(b) Debt instruments through other comprehensive income	--	--
(c) Effective portion of gains and loss on designated portion of hedging instruments in a cash flow hedge	--	--
(d) Share of other comprehensive income of equity accounted investees	--	--
(e) Others (specify nature)	--	--

(ii) Income tax on items that may be reclassified to profit or loss**SUB-TOTAL****XI Total comprehensive income for the period (IX + X)****(2 10 83 471)****(1 61 13 935)**

Earnings per equity share:	23	
Basic		(35.3)
Diluted		(35.3)

Significant accounting policies & Notes forming part of Financial Statements **1, 2 & 3****Notes on accounts form integral part of the financial statements****As per our report of even date****For Shah & Dalal
Chartered Accountants
FRN. 109432W****For and on behalf of the Board of Directors****Sd/-
(Malay Dalal)
Partner
Membership No. 036776****Sd/-
(Santosh Kumar)
Director / CEO
DIN: 07854179****Sd/-
(B. C. WARLI)
Director
DIN: 07133942****Place: Ahmedabad
Date: July 04, 2020****Place: Gandhinagar
Date: July 04, 2020**

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
CIN:U45101GJ2018SGC105602
Cash Flow Statement for the year ended March 31, 2020

Particulars	(Amount in ₹)	
	For the period from April 01, 2019 to March 31, 2020	For the period from December 13, 2018 to March 31, 2019
	1 Cash Flows from Operating Activities	
Loss before tax as per Statement of Profit & Loss	(2 10 83 471)	(1 61 11 735)
Adjusted for:-		
Interest Income	(4 61 165)	8 400
Finance Cost	-	
Operating Profit before Working Capital Changes	(2 15 44 636)	(1 61 03 335)
Adjusted for Movement in Working Capital:		
(AIncrease)/ Decrease in Other Current Assets	(35 75 031)	-
Increase/ (Decrease) in trade Payable	34 38 857	1 58 29 546
Increase/ (Decrease) in Provisions	9 62 061	2 63 200
Increase/ (Decrease) in Other current liabilities	56 792	29 589
Operating Profit after Working Capital Changes	8 82 679	1 61 22 335
Taxes Paid (Net of Refund)	-	(2 200)
Net cash flow from / (used in) operating activities (A)	(2 06 61 957)	16 800
2 Cash Flows from Investing Activities:		
Increase in Capital Work in Progress	(9 61 818)	-
Increase in Non Current Assets	(13 05 83 569)	-
Interest Income	4 61 165	(8 400)
Net cash flow from / (used in) investing activities (B)	(13 10 84 222)	(8 400)
3 Cash flow from financing activities :		
Proceeds From Share Capital	26 00 000	--
Proceeds from Application Money pending allotement	-	74 00 000
Proceeds from short term borrowing	14 31 27 855	--
Finance Cost	-	--
Net cash flow from / (used in) financing activities (C)	14 57 27 855	74 00 000
Net increase in cash and cash equivalents (A)+(B)+(C)	(60 18 324)	74 08 400
Cash and cash equivalents as at the beginning of the year	74 08 400	--
Cash and cash equivalents as at end of the year	13 90 076	74 08 400
Break up of cash and cash equivalents at the end of the year		
Balances with Banks-In Current/Saving Accounts	13 90 076	74 08 400
	13 90 076	74 08 400

Notes:

- 1 Cash and cash equivalent include cash and bank balances and deposits with the Bank (Maturity less than 3 months).
- 2 The above Cash Flow Statement has been prepared under the 'Indirect method' as set out in the Ind AS - 7 Statement of Cash Flow.
- 3 Previous year figures have been regrouped and reclassified wherever considered necessary to conform to the current year's figures.

As per our report of even date attached,

For Shah & Dalal
Chartered Accountants
FRN. 109432W

For and on behalf of the Board of Directors

Sd/-
(Malay Dalal)
Partner
Membership No. 036776

Sd/-
(Santosh Kumar)
Director / CEO
DIN: 07854179

Sd/-
(B. C. WARLI)
Director
DIN: 07133942

Place: Ahmedabad
Date: July 04, 2020

Place: Gandhinagar
Date: July 04, 2020

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED**CIN:U45101GJ2018SGC105602****STATEMENT OF CHANGES IN EQUITY**

(Amount in ₹)

A. EQUITY SHARE CAPITAL	
As at 13th December 2018	--
Changes in equity share capital	--
As at 31st March 2019	--
Changes in equity share capital	10000000
As at 31st March 2020	10000000
B. OTHER EQUITY	
As at 13th December 2018	--
Profit/(loss) for the year	(1 61 13 935)
Other Comprehensive Income	--
Total Comprehensive Income	--
Balance As at 31st March 2019	(1 61 13 935)
Profit/(loss) for the year	(2 10 83 471)
Other Comprehensive Income	--
Total Comprehensive Income	--
Balance As at 31st March 2020	(3 71 97 406)

The accompanying notes are an integral part of the Financial Statements

As per our report of even date attached,

**For Shah & Datal
Chartered Accountants
FRN. 109432W**

Sd/-
(Malay Dalal)
Partner
Membership No. 036776

For and on behalf of the Board of Directors

Sd/-
(Santosh Kumar)
Director / CEO
DIN: 07854179

Sd/-
(B. C. WARLI)
Director
DIN: 07133942

**Place: Ahmedabad
Date: July 04, 2020**

**Place: Gandhinagar
Date: July 04, 2020**

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED

Notes to Financial Statements for the year ending on March 31, 2020

1. Background

1. Corporate Information:

Bahucharaji Rail Corporation Limited, is a special purpose vehicle (SPV) for the Railway project of Bahucharaji - Katosan as per GR No.MIS-10-2017-1665-1-1 dated 05/02/2018 issued by Government of Gujarat to carry on the business of development, financing, planning and implementation of Guage Conversion of Katosan Road-Becharaji-Chanasma-Ranuj for 65 Kms line project in the state of Gujarat.

2. The financial statements were authorised for issue in accordance with the resolution of Board of Directors on 26th June 2020.

3 (A) Basis of Preparation

a. Statement of Compliance:

These financial statements have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS) as per the Companies (Indian Accounting Standards) Rules, 2016 notified under Section 133 of Companies Act, 2013. (the 'Act') and other relevant provisions of the Act.

The financial statements up to and for the year ended 31 March, 2019 were prepared in accordance with the Companies (Accounting Standards) Rules, 2006, notified under Section 133 and other relevant provisions of the Act.

As these are the Company's first financial statements prepared in accordance with Indian Accounting Standards (Ind AS), Ind AS 101, First-time Adoption of Indian Accounting Standards has been applied. An explanation of how the transition to Ind AS has affected the previously reported financial position, financial performance and cash flows of the Company is provided in Note 30.

Details of the Company's accounting policies are included in Note 3(B).

b. Functional and Presentation Currency:

These financial statements are presented in Indian Rupees (INR), which is also the Company's functional currency.

c. Use of Estimates and Judgements:

In preparing these financial statements, management has made judgements, estimates and assumptions that affect the application of accounting policies and the reported amounts of assets, liabilities, income and expenses. Actual results may differ from these estimates.

Critical Estimates and Judgments

This note provides an overview of the areas that involved a higher degree of judgment or complexity, and of items which are more likely to be materially adjusted due to estimates and assumptions turning out to be different than those originally assessed. Detailed information about each of these estimates and judgements is included in relevant notes together with information about the basis of calculation for each affected line item in the financial statements.

Areas involving critical estimates or judgements are:

- Other areas are as below:
 - Estimation of current tax expense and payable
 - Recognition and measurement of provisions and contingencies: key assumptions about the likelihood and magnitude of an outflow of resources
 - Impairment of Financial Assets

Estimates and underlying assumptions are reviewed on an ongoing basis. Revisions to accounting estimates are recognized prospectively.

d. Measurement of Fair Values:

A number of the Company's accounting policies and disclosures require measurement of fair values, for both financial and non-financial assets and liabilities.

Fair values are categorised into different levels in a fair value hierarchy based on the inputs used in the valuation techniques as follows.

- Level 1: quoted prices (unadjusted) in active markets for identical assets or liabilities.
- Level 2: inputs other than quoted prices included in Level 1 that are observable for the asset or liability, either directly (i.e. as prices) or indirectly (i.e. derived from prices).

- Level 3: inputs for the asset or liability that are not based on observable market data (unobservable-inputs).

When measuring the fair value of an asset or a liability, the Company uses observable market rate as far as possible. If the inputs used to measure the fair value of an asset or a liability fall into different levels of the fair value hierarchy, then the fair value measurement is categorised in its entirety in the same level of the fair value hierarchy as the lowest level input that is significant to the entire measurement.

The Company recognises transfers between levels of the fair value hierarchy at the end of the reporting period during which the change has occurred.

Further information about the assumptions made in measuring fair values is included in the following notes:

- Note 27-Financial Risk Management Objectives and Policies
- Note 29-Fair Value Measurement

3 (B) Significant Accounting Policies

The accounting policies set out below have been applied consistently to the period presented in these financial statements.

I. Financial Instruments:

Recognition and Initial Measurement

Trade receivables are initially recognised when they are originated. All other financial assets and financial liabilities are initially recognised when the Company becomes a party to the contractual provisions of the instrument.

A financial asset or financial liability is initially measured at fair value plus, for an item not at fair value through profit and loss (FVTPL), transaction costs that are directly attributable to its acquisition or issue.

Classification and Subsequent Measurement and Gain and Losses: Financial Assets

Financial Assets at amortised cost- These assets are subsequently measured at amortized cost using the effective interest method. The amortized cost is reduced by impairment losses. Interest income, foreign exchange gains and losses and impairment are recognized in profit or loss. Any gains or loss or derecognition is effected in profit or loss statement.

Financial Assets at Fair Value through Other Comprehensive Income (FVTOCI) – All equity investments are measured at fair values. Investments which are not held for trading purposes and where the Company has exercised the option to classify the investment as at FVTOCI, all fair value changes on the investment are recognized in Other Comprehensive Income (OCI). The accumulated gain or losses are recognized in OCI are reclassified to retained earnings on sale of such investment.

Financial assets at Fair Value through Profit and loss (FVTPL) - These assets are subsequently measured at fair value. Net gains and losses, including any interest or dividend income, are recognized in profit or loss.

Classification, Subsequent Measurement and Gains and Losses: Financial Liabilities

Financial liabilities are subsequently measured at amortised cost using effective interest method. For trade and other payable maturing within one year from the balance sheet date, the carrying value approximates fair value due to short maturity of these investments.

Derecognition: Financial Assets

The Company derecognises a financial asset when the contractual rights to the cash flows from the financial asset expire, or it transfers the rights to receive the contractual cash flows in a transaction in which substantially all of the risks and rewards of ownership of the financial asset are transferred or in which the company neither transfers nor retains substantially all of the risks and rewards of ownership and does not retain control of the financial asset.

If the Company enters into transactions whereby it transfers assets recognised on its balance sheet but retains either all or substantially all of the risks and rewards of the transferred assets, the transferred assets are not derecognised.

Derecognition: Financial Liabilities

The Company derecognises a financial liability when its contractual obligations are discharged or cancelled or expired.

The Company also derecognises a financial liability when its terms are modified and the cash flows under the modified terms are substantially different. In this case, a new financial liability based on the modified terms is recognised at fair value. The difference between the carrying amount of the financial liability extinguished and the new financial liability with

modified terms is recognised in profit or loss.

Offsetting

Financial assets and financial liabilities are offset and the net amount presented in the balance sheet when, and only when, the Company currently has a legally enforceable right to set off the amounts and it intends either to settle them on a net basis or to realise the asset and settle the liability simultaneously.

ii. Current versus Non-Current Classification:

The Company presents assets and liabilities in the balance sheet based on current/ non-current classification. An asset is treated as current when it is:

- (a) expected to be realised in, or is intended to be sold or consumed in Company's normal operating cycle;
- (b) held primarily for the purpose of being traded;
- (c) expected to be realised within 12 months after the reporting date; or
- (d) cash or cash equivalent unless restricted from being exchanged or used to settle a liability for at least 12 months after the reporting date.

All other assets are classified as non-current.

A Liability is current when:

- (a) it is expected to be settled in Company's normal operating cycle;
- (b) it is held primarily for the purpose of being traded;
- (c) it is due to be settled within 12 months after the reporting date; or
- (d) The Company does not have an unconditional right to defer settlement of the liability for at least 12 months after the reporting date.

All other liabilities are classified as non-current.

Operating Cycle

Operating cycle is the time between the acquisition of assets for processing and their realisation in cash or cash equivalents.

iii. Impairment:

Impairment of Financial Instruments

The Company recognises loss allowances for expected credit losses on financial assets measured at amortised cost.

At each reporting date, the Company assesses whether financial assets carried at amortised cost are credit-impaired. A financial asset is 'credit-impaired' when one or more events that have a detrimental impact on the estimated future cash flows of the financial asset have occurred.

The Company measures loss allowances at an amount equal to lifetime expected credit losses. Lifetime expected credit losses are the expected credit losses that result from all possible default events over the expected life of a financial instrument.

When determining whether the credit risk of a financial asset has increased significantly since initial recognition and when estimating expected credit losses, the Company considers reasonable and supportable information that is relevant and available without undue cost or effort. This includes both quantitative and qualitative information and analysis, based on the Company's historical experience and informed credit assessment and including forward-looking information.

Measurement of Expected Credit Losses

Expected credit losses are a probability-weighted estimate of credit losses. Credit losses are measured as the present value of all cash shortfalls (i.e. the difference between the cash flows due to the Company in accordance with the contract and the cash flows that the Company expects to receive.)

Presentation of Allowance for Expected Credit Losses in the Balance Sheet

Loss allowances for financial assets measured at amortised cost are deducted from the gross carrying amount of the assets.

Write-off

The gross carrying amount of a financial asset is written off (either partially or in full) to the extent that there is no realistic prospect of recovery. This is generally the case when the Company determines that the debtor does not have assets or sources of income that could

generate sufficient cash flows to repay the amounts subject to the write-off. However, financial assets that are written off could still be subject to enforcement activities in order to comply with the Company's procedures for recovery of amounts due.

Impairment of Non-Financial Assets

The Company's non-financial assets, other than inventories and deferred tax assets are reviewed at each reporting date to determine whether there is any indication of impairment. If any such indication exists, then the asset's recoverable amount is estimated.

iv. Borrowing Cost

Borrowing costs are interest and other costs (including exchange differences relating to foreign currency borrowings to the extent that they are regarded as an adjustment to interest costs) incurred in connection with the borrowing of funds. Borrowing costs directly attributable to acquisition or construction of an asset which necessarily take a substantial period of time to get ready for their intended use are capitalised as part of the cost of that asset. Other borrowing costs are recognised as an expense in the period in which they are incurred.

v. Borrowing

Borrowings are classified as current liabilities unless the Company has an unconditional right to defer settlement of the liability for at least 12 months after the reporting period. Where there is a breach of a material provision of a long term loan arrangement on or before the end of reporting period with the effect that the liability becomes payable on demand on the reporting date, the Company does not classify the liability as current, if the lender agreed, after the reporting period and before the approval of the financial statement for issue, not to demand payment as a consequence of the breach.

vi. Revenue Recognition:

Revenue is recognised when there is reasonable certainty of its ultimate collection/realization.

Interest income is recognized using the effective interest method and are accounted on accrual basis except, interest on mobilization advance is recognized on realisation basis.

All other item of income are accounted on accrual basis.

vii. Provisions (other than Employee Benefits):

A provision is recognized if, as a result of a past event, the Company has a present obligation that can be estimated reliably, and it is probable that an outflow of economic benefits will be required to settle the legal or contractual obligation. Provisions are determined by discounting the expected future cash flows (representing the best estimate of the expenditure required to settle the present obligation at the balance sheet date) at a pre-tax rate that reflects current market assessments of the time value of money and the risks specific to the liability. The unwinding of the discount is recognised as finance cost. Expected future operating losses are not provided for.

Contingencies

Provision in respect of loss contingencies relating to claims, litigation, assessment, fines, penalties, etc. are recognized when it is probable that a liability has been incurred and the amount can be estimated reliably.

viii. Contingent Liabilities:

Contingent liabilities are disclosed when there is a possible obligation arising from past events, the existence of which will be confirmed only by the occurrence or nonoccurrence of one or more uncertain future events not wholly within the control of the Company or a present obligation that arises from past events where it is either not probable that an outflow of resources will be required to settle or a reliable estimate of the amount cannot be made.

ix. Income Taxes:

Income tax comprises current and deferred tax. It is recognised in profit or loss except to the extent that it relates to an item recognised directly in equity or in other comprehensive income.

Current Tax

Current tax comprises the expected tax payable or receivable on the taxable income or loss for the year and any adjustment to the tax payable or receivable in respect of previous years. The amount of current tax reflects the best estimate of the tax amount expected to be paid or received after considering the uncertainty, if any, related to income taxes. It is measured

using tax rates (and tax laws) enacted or substantively enacted by the reporting date.

Current tax assets and current tax liabilities are offset only if there is a legally enforceable right to set off the recognised amounts, and it is intended to realise the asset and settle the liability on a net basis or simultaneously.

Tax benefits of deductions earned on exercise of employee stock options in excess of compensation charged to income are credited to other comprehensive income.

Deferred Tax

Deferred tax is recognised in respect of temporary differences between the carrying amounts of assets and liabilities for financial reporting purposes and the corresponding amounts used for taxation purposes. Deferred tax is also recognised in respect of carried forward tax losses and tax credits. Deferred tax is not recognised for:

- Temporary differences arising on the initial recognition of assets or liabilities in a transaction that affects neither accounting nor taxable profit/loss at the time of the transaction;
- Taxable Temporary differences arising on the initial recognition of goodwill.

Deferred tax assets are recognised to the extent that it is probable that future taxable profits will be available against which they can be used. The existence of unused tax losses is strong evidence that future taxable profit may not be available. Therefore, in case of a history of recent losses, the Company recognises a deferred tax asset only to the extent that it has sufficient taxable temporary differences or there is convincing other evidence that sufficient taxable profit will be available agianst which such deferred tax asset can be realised. Deferred tax assets – unrecognised or recognised, are reviewed at each reporting date and are recognised / reduced to the extent that it is probable / no longer probable respectively that the related tax benefit will be realised.

Deferred tax is measured at the tax rates that are expected to apply to the period when the asset is realised or the liability is settled, based on the laws that have been enacted or substantively enacted by the reporting date.

The measurement of deferred tax reflects the tax consequences that would follow from the

manner in which the Company expects, at the reporting date, to recover or settle the carrying amount of its assets and liabilities.

Deferred tax assets and liabilities are offset if there is a legally enforceable right to offset current tax liabilities and assets, and they relate to income taxes levied by the same tax authority on the same taxable entity, or on different tax entities, but they intend to settle current tax liabilities and assets on a net basis or their tax assets and liabilities will be realised simultaneously.

Deferred tax in respect of timing differences which reverse after the tax holiday period is recognized in the year in which the timing differences originate.

x. Earnings per Share:

Basic earnings / (loss) per share are calculated by dividing the net profit or loss for the year attributable to equity shareholders by the weighted average number of equity shares outstanding during the year. The weighted average numbers of equity shares outstanding during the year are adjusted for events of bonus issue and share split. For the purpose of calculating diluted earnings / (loss) per share, the net profit or loss for the year attributable to equity shareholders and the weighted average number of shares outstanding during the year are adjusted for the effects of all dilutive potential equity shares.

xi. Cash and Cash Equivalents:

Cash and cash equivalents in the balance sheet comprise cash at banks and on hand and short-term deposits with an original maturity of three months or less, which are subject to an insignificant risk of changes in value.

For the purpose of the statement of cash flows, cash and cash equivalents consist of cash and short term deposits, as defined above, net of outstanding bank overdrafts as they are considered an integral part of the Company's cash management.

xii. Events after the Reporting Period:

Adjusting events are events that provide further evidence of conditions that existed at the end of the reporting period. The financial statements are adjusted for such events before authorisation for issue. Non-adjusting events are events that are indicative of conditions that arose after the end of the reporting period. Non-adjusting events after the reporting date are not accounted, but disclosed.

xiii. Property, Plant and Equipment

Capital work in progress includes expenditure incurred on assets which are yet to be commissioned. All the directly identifiable and ascertainable expenditure, incidental and related to construction incurred during the period of construction on a project, till it is commissioned, is kept as Capital work in progress (CWIP) and after commissioning the same is transferred / allocated to the respective "fixed assets".

Further, advances paid towards the acquisition of property, plant and equipment outstanding at each balance sheet date are classified as capital advances under other non-current assets.

BAHUCHARAJI RAIL CORPORATION LIMITED
Notes to Financial Statements for the year ending on March 31, 2020

	(Amount in ₹)	
Particulars	As at March 31, 2020	As at March 31, 2019
4 Capital Work-in-Progress includes		
On account of Project Development Expenditure	9 61 818	--
	Total	9 61 818
5 Deferred tax asset relating to		
Deffered Tax Assets (Net)	--	--
Deferred tax Asset	--	--
Deferred tax Liability relating to	--	--
Net Deffered tax Asset	--	--
6 Other Non-current Assets		
<u>Advance made for Capital Asset Work in Progress</u> -Kalpataru Power Transmission Limited (KPTL)	13 05 83 569	--
	Total	13 05 83 569
7 Cash and Cash Equivalents		
Balances with banks		
Yes Bank Saving A/c 018694600001243	--	74 08 400
Yes Bank Current A/c 018685700000184	13 90 076	--
	Total	13 90 076
	74 08 400	
8 Current Tax Assets (Net)		
	Total	--
		--
9 Other Current Assets		
Share Capital Recivable from Gujarat Industiral Development Corp.	--	26 00 000
<u>Balances with Revenue Authorities receivable in Cash or kind</u>		
TDS receivable	42 481	--
GST receivable	35 32 550	--
	Total	35 75 031
		26 00 000
10 Equity Share Capital		
Authorised		
22,50,00,000 (previous year -10,00,000) equity shares of 10 each	225 00 00 000	1 00 00 000
	Total	225 00 00 000
	1 00 00 000	
Issued, subscribed		
10,00,000 equity shares of 10 each, fully paid up	1 00 00 000	1 00 00 000
	Total	1 00 00 000
	1 00 00 000	
Paid-up Capital:		
10,00,000 equity shares of 10 each, fully paid up	1 00 00 000	--
	Total	1 00 00 000
	1 00 00 000	

Notes:
(i) Reconciliation of the shares outstanding at the beginning and at the end of the period

Particulars	2019-20		2018-19	
	No of shares	Amount	No of shares	Amount
At the beginning of the year	--	--	--	--
Add: Issued during the year	10 00 000	1 00 00 000	--	--
Outstanding at the end of the year	10 00 000	1 00 00 000	--	--

(ii) Terms/rights attached to equity shares

- The Company has only one class of equity shares having a par value of 10 per share.
- Each holder of the equity shares is entitled to one vote per share.
- In the event of liquidation of the Company, the holders of the equity shares will be entitled to receive assets of the Company remaining after settlement of all liabilities. The distribution will be in proportion of the number of equity shares held by the shareholders.

(iii) Allotment of Shares

- During the year company has allotted 10,00,000 numbers of Equity Shares of Rs.10/- each to below promoters:
- Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE) 4,10,000 Equity Shares of Rs.10/-each
- Maruti Suzuki India Limited (MSIL) 3,30,000 Equity Shares of Rs.10/-each
- Gujarat Industrial Development Corporation (GIDC) 2,60,000 Equity Shares of Rs.10/-each

(iv) The details of shareholders holding more than 5 % of issued share capital is set out below:

Name of Shareholder	As at March 31, 2020		As at March 31, 2019	
	No. of shares	% holding	No. of shares	% holding
Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE)	4 10 000	41.00%	--	--
Maruti Suzuki India Limited (MSIL)	3 30 000	33.00%	--	--
Gujarat Industrial Development Corporation (GIDC)	2 60 000	26.00%	--	--

As per records of the Company, including its register of shareholders / members, the above shareholding represents legal and beneficial ownership of shares.

The Company has not issued any **Bonus Shares** during the year.

11 Other Equity
Retained Earnings

Opening Balance of retained earnings	(1 61 13 935)	--
Add/ Less Adjustments during the year	--	--
Net (Loss) / profit for the current year	(2 10 83 471)	(1 61 13 935)
Closing Balance	(3 71 97 406)	(1 61 13 935)
Total reserves and surplus	(3 71 97 406)	(1 61 13 935)

12 Share Application Money Pending for Allotment

Gujarat Industrial Development Corporation (GIDC)	--	26 00 000
Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE)	--	41 00 000
Maruti Suzuki India Limited (MSIL)	--	33 00 000
Total	--	1 00 00 000

13 Borrowings-Current
Short Term Borrowings

Loans and Advances From related parties-Unsecured	
-Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE)	14 31 27 855
Total	14 31 27 855

14 Trade Payable-Current

Total outstanding dues of micro enterprises and small enterprises	--	--
Total outstanding dues of other than micro enterprises and small enterprises	--	--
AB Enterprise	--	28 885
Gujarat Rail Infrastructure Development Corporation Limited	1 92 56 243	1 58 00 661
Ashish C Doshi	6 600	--
Fortune Inn Haveli	5 560	--
Total	1 92 68 403	1 58 29 546

The Company's exposure to currency and liquidity risks related to Trade Payables covered in Note 26

15 Provisions-Current

Accounting Fees Payable	2 77 875	1 35 000
Consultancy / Professional Charges Payable	27 000	--
Conveyance Expenses (Lumsum) Payable	5 400	--
Interest Payable	5 58 712	--
Internal Audit Fees Payable	40 500	81 000
Man Power Service Exp Payable	1 30 194	--
Statutory Audit Fees Payable	45 000	45 000
Vehice Hire Charges Payable	1 40 580	--
Provision for Income Tax FY 18-19	-	2 200
Total	12 25 261	2 63 200

16 Other current liabilities

Statutory Dues Payable		
TDS Payable	86 381	29 589
Total	86 381	29 589

17 Current tax liabilities (net)

Total	--	--
Total	--	-

18 Other income

Interest Received	4 61 165	8 400
Tender Processing Fee	12 98 305	--
Total	17 59 470	8 400

19 Employee benefit expense, payment to contractors and consultants

Man Power Services	6 35 003	29474
Total	6 35 003	29 474

20 Finance Cost

Finance Cost	--	--
Total	--	--

21 Depreciation and amortisation expense

Depreciation	--	--
Total	--	--

22 Other expenses

Bank Charges	59	--
Board Meeting Exp	24 481	--
Consultancy / Professional Charges	13 54 597	--
Feasibility Study Expenses	26 85 718	1 57 20 550
Incorporation Exp	--	3 15 111
Interest on payment of TDS	1 727	--
Interest for Income tax	10	--
Office Exp	5 099	--
Office Exps(Preliminary Expenses)	--	5 000
ROC & legal charges	1 72 67 800	--
Round Off	3	--
Stationery & Printing Exp	18 054	--
Statutory Audit Fees	50 000	50 000
Traveling & Conveyance Exp-Others	85 765	--
Vehicle Hire Charges	7 14 625	--
Total	2 22 07 938	1 60 90 661

Other Expenses includes:

*Auditors Remuneration:

Statutory Audit Fees	50 000	50 000
Total	50 000	50 000

Other Comprehensive Income (OCI)

There are no component of other comprehensive income that are required or to be disclosed.

23 Earnings per share ('EPS')

Earnings per share is calculated by dividing the net profit/ (loss) attributable to the equity shareholders by the weighted average number of equity shares of Rs.10 each outstanding during the year which is as under:

Particulars	2019-2020	2018-2019
Net Loss attributable to equity shareholders	(2 10 83 471)	(1 61 13 935)
Weighted Avg. No. of equity shares held during the year*	5 97 260	--
Face value per share in ₹	10	10
Basic and diluted* Earning Per share	-35.30	0.00

* There is no potential equity Shares so Basic and Diluted EPS are Same

24 Contingent liabilities and capital commitments

Particulars	2019-2020	2018-2019
Capital Commitment	250 46 16 431	-
Total	250 46 16 431	

25 Segment Information

In accordance with Ind-As 108, the operating segments used to present segment information are identified on the basis of internal reports used by the Company's Management to allocate resources to the segments and assess their performance.

The Board of Directors is collectively the Company's 'Chief Operating Decision Maker' or 'CODM' within the meaning of Ind AS 108. The indicators used for internal reporting purposes may evolve in connection with performance assessment measures put in place.

Information about geographical areas

The Company do not have any operations in economic environments with different set of risks and returns. Hence, it is considered to be operating in a single geographical segment.

26 Dues to Micro, Small and Medium Enterprises

There were no amounts payable to any Micro, Small & Medium Enterprises to whom the company over dues, which are outstanding for more than 45 days as at March 31, 2020.

27 Financial Risk Management Objectives and Policies

The Company is exposed to market risk, credit risk and liquidity risk. The Company's senior management oversees the management of these risks. The Company's senior management is supported by Finance Department that advises on financial risks and the appropriate financial risk governance framework for the Company. The Finance department provides assurance to the Company's senior management that the Company's financial risk activities are appropriately governed.

(a) Market Risk

Market Risk is the risk that the fair value of future cash flows of a financial instrument will fluctuate because of changes in market prices. Market prices comprises interest rate risk. The sensitivity analyses in the following sections relate to the position as at March 31, 2020. The analyses exclude the impact of movements in market variables on; the carrying values of gratuity and other postretirement obligations: provisions; and the non-financial assets and liabilities.

(i) Interest Rate Risk

Interest Rate Risk is the risk that the fair value or future cash flows of a financial instrument will fluctuate because of changes in market interest rates. The borrowings of the Company are interest free and therefore not subject to interest rate risk as defined in Ind AS 107.

(b) Liquidity Risk

Liquidity Risk is the risk that the Company may not be able to meet its present and future cash and collateral obligations without incurring unacceptable losses. The Company's objective is to, at all times maintain optimum levels of liquidity to meet its cash and

collateral requirements. The Company closely monitors its liquidity position and deploys a robust cash management system. It maintains adequate sources of financing including loans from banks at an optimised cost.

(I) The table below summarises the maturity profile of the Company's financial liabilities based on contractual undiscounted payments.

As at March 31, 2020	On demand	Less than 3 months	3 to 12 months	1-5 years	More than 5 years	Total
Borrowings	--	--	14 31 27 855	--	--	14 31 27 855
Trade Payable	--	--	1 92 68 403	--	--	1 92 68 403
Other Financial Liabilities	--	--	--	--	--	--
As at March 31, 2019						
Trade Payable	--	--	1 58 29 546	--	--	1 58 29 546
Other Financial Liabilities	--	--	--	--	--	--

(c) Credit Risk

Credit risk is the risk that counterparty will not meet its obligations under a financial instrument or customer contract, leading to a financial loss. The Company is exposed to credit risk from its operating activities (primarily trade receivables) and from its financing activities, including deposits with banks and financial institutions and other financial instruments.

(I) Trade Receivables

All outstanding customer receivables of the company are regularly monitored. This being first year of operation of the company, company has not witnessed any bad debts or long outstandins during the year. Furthermore, all outstanding customers receivables as on reporting date are less than 6 months. Accordingly, trade receivables are subject to extremely low credit risk and management has assessed that no impairment of trade receivables is required.

(ii) Financial Instruments and Cash Deposit

Credit risk from balances with bank and financial institutions is managed by the Company's finance department under the supervision of company's senior management. All balances with banks and financial institutions is subject to low credit risk due to good credit ratings assigned to the Company. This being under the supervision of regulatory authority.

28 Related Party Disclosures**(I) Related Parties and the nature of relationship :****Associate Entity**

Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE)

Gujarat Industrial Development Corporation (GIDC)

Maruti Suzuki India Limited (MSIL)

Entities over which key management personnel and their relatives are able to exercise significant

Gujarat Rail Infrastructure Development Corporation Limited (G-RIDE)

Key Management Personnel / Executive Director

Shri Santosh Kumar CEO / Director

Shri Ashwinikumar Yadav Chairman

Director Non-Executive

Shri Zaigham Ali Khan Director (upto 14th August, 2019)

Shri Bajrang Warli Director

Shri Dharmesh Brahmbhatt Director (upto 14th February, 2020)

Shri Batchu Venugopal Director

Shri Raj Swarup Kapoor Director

(ii) Transactions with Related Parties

Summary of transactions / Balances with Related Parties	Associate Entity		Entities over which key management personnel and their relatives are able to exercise significant influence		Key management personnel and relatives	
Transactions during the year	For the year ended March 31, 2020	For the year ended March 31, 2019	For the year ended March 31, 2020	For the year ended March 31, 2019	For the year ended March 31, 2020	For the year ended March 31, 2019
Loan received	14 31 27 855	--	--	--	--	--
Reim. of exp. (Capitalised-CWIP)	20 000	--	--	--	--	--
Other expenses	26 85 718	1 54 80 550	--	--	--	--
Interest Paid (Capitalised-CWIP)	6 20 791	--	--	--	--	--
Total	14 64 54 364	1 54 80 550	--	--	--	--

Balance as at year end	Associate Entity		Entities over which key management personnel and their relatives are able to exercise significant influence		Key management personnel and relatives	
	For the year ended March 31, 2020	For the year ended March 31, 2019	For the year ended March 31, 2020	For the year ended March 31, 2019	For the year ended March 31, 2020	For the year ended March 31, 2019
Amount Receivable	--	--	--	--	--	--
Amount Payable	16 30 04 889	1 58 00 661	--	--	--	--

29 Fair Value Measurements

Set out below, is a comparison by class of the carrying amounts and fair value of the Company's financial instruments:

Category	As at March 31, 2020		As at March 31, 2019	
	Carrying Value	Fair Value	Carrying Value	Fair Value
1) Financial assets at Amortized Cost				
Trade receivables (current / non current)	--	--	--	--
Cash and Cash equivalents	13 90 076	13 90 076	74 08 400	74 08 400
Other financial asset (current / non current)	--	--	--	--
Total	13 90 076	13 90 076	74 08 400	74 08 400
2) Financial Liabilities at Amortized Cost				
Borrowings	14 31 27 855	14 31 27 855	--	--
Trade payables	1 92 68 403	1 92 68 403	1 58 29 546	1 58 29 546
Other financial liabilities (current/non current)	--	--		
Total	16 23 96 258	16 23 96 258	1 58 29 546	1 58 29 546

The fair value of the financial assets and liabilities is included at the amount at which the instrument could be exchanged in a current transaction between willing parties, other than in a forced or liquidation sale. Management has assessed that trade receivables, cash and cash equivalents, other bank balances, other financial assets, borrowings, trade payables and other financial liabilities approximate their carrying amounts largely due to the short-term maturities of these instruments.

Fair Value Hierarchy

All financial instruments for which fair value is recognised or disclosed are categorised within the fair value hierarchy, described as follows, based on the lowest level input that is significant to the fair value measurement as a whole.

Level 1: Quoted (unadjusted) prices in active markets for identical assets or liabilities.

Level 2: Valuation techniques for which the lowest level input that has a significant effect on the fair value measurement are observable, either directly or indirectly.

Level 3: Valuation techniques for which the lowest level input that has a significant effect on the fair value measurement is not based on observable market data.

The following table provides the fair value measurement hierarchy of the Company's assets and liabilities.

Quantitative disclosures fair value measurement hierarchy for assets as at March 31, 2020 :

Particulars	Total (Carrying Value)	Quoted Price in Active Markets (Level 1)	Significant observable inputs (Level 2)	Significant unobservable inputs (Level 3)
Financial assets measured at amortised cost				
Trade receivables	--	--	--	--
Cash and Cash equivalents	13 90 076	--	--	--
Other financial asset (current/non current)	--	--	--	--
Total	13 90 076	--	--	--

Quantitative disclosures fair value measurement hierarchy for liabilities as at March 31, 2020:

Particulars	Total (Carrying Value)	Quoted Price in Active Markets (Level 1)	Significant observable inputs (Level 2)	Significant unobservable inputs (Level 3)
Financial Liabilities measured at amortised cost				
Borrowings	14 31 27 855	--	--	--
Trade Payables	1 92 68 403	--	--	--
Other financial Liabilities(current/non current)	--	--	--	--
Total	16 23 96 258	--	--	--

Quantitative disclosures fair value measurement hierarchy for assets as at March 31, 2019:

Particulars	Total (Carrying Value)	Quoted Price in Active Markets (Level 1)	Significant observable inputs (Level 2)	Significant unobservable inputs (Level 3)
Financial assets measured at amortised cost				
Trade receivables	--	--	--	--
Cash and Cash equivalents	74 08 400	--	--	--
Other financial asset (current/non current)	--	--	--	--
Total	74 08 400	--	--	--

Quantitative disclosures fair value measurement hierarchy for liabilities as at March 31, 2019:

Particulars	Total (Carrying Value)	Quoted Price in Active Markets (Level 1)	Significant observable inputs (Level 2)	Significant unobservable inputs (Level 3)
Financial Liabilities measured at amortised cost				
Borrowings	--	--	--	--
Trade Payables	1 58 29 546	--	--	--
Other financial Liabilities(current/non current)	--	--	--	--
Total	1 58 29 546	--	--	--

30 First time adoption of Ind AS

As stated in Note 3a. these financial statements for the year ended March 31, 2020, are the Company's first financial statements prepared in accordance with Ind AS. For the period ended as at March 31, 2019 (first financial statements for the company), the Company had prepared its financial statements in accordance with Accounting Standards notified under Section 133 of the Companies Act, 2013 and other relevant provisions of the Act ('previous GAAP')

Accordingly, the Company has prepared these financial statements which comply with Ind AS applicable for year ended on March 31, 2020, together with the comparative period data for the year ended March 31, 2019. Further, in presenting the comparative information, the Company has adjusted amounts reported previously in financial statements prepared in accordance with previous

GAAP. This note explains the principal adjustments made by the Company in restating its financial statements prepared in accordance with previous GAAP, and how the transition from previous GAAP to Ind As has affected the Company's financial position, financial performance and cash flows.

The accounting policies set out in Note 2b have been applied in preparing these financial statements for the year ended March 31, 2020 including the comparative information for the period ended March, 21, 2019.

Exemptions applicable and availed

Ind AS 101 allows first-time adopters certain exemptions from the retrospective application of certain requirements under Ind AS.

Comparative period i.e. December 13, 2018 to March 31, 2019 was the first financial year of the Company, hence transition date is not applicable on the Company. Accordingly, optional exemptions and mandatory exceptions as specified in IND-AS 101 do not apply to the Company and hence not disclosed.

(a) Reconciliation of Equity as at:		(Amount in Rs.)		
Particulars		As at March 31, 2019		
		Regrouped Indian GAAP	Ind As adjustments	Ind AS
I ASSETS				
Non Current Assets				
Property, plant and equipment		--	--	--
Capital work in progress		--	--	--
Deferred tax assets (net)		--	--	--
Current Assets				
Financial assets		--	--	--
Cash & cash equivalents		74 08 400	--	74 08 400
Other Current Assets		26 00 000	--	26 00 000
Bank balances other than those included under cash and cash equivalents				
Total Assets		1 00 08 400	--	1 00 08 400
II Equity and Liabilities				
Equity				
Equity and Share Capital		--	--	--
Other Equity		(1 61 13 935)	--	(1 61 13 935)
Liabilities				
Share Application Money Pending for Allotment		1 00 00 000	--	1 00 00 000
Non Current Liabilities				
Other financial liabilities		--	--	--
Government Grant		--	--	--
Current Liabilities				
Financial Liabilities		--	--	--
Trade Payables		--	--	--
-total outstanding dues of micro ent. and small ent.				
		--	--	--
-total outstanding dues of creditors				
other than micro ent. and small ent.		1 58 29 546	--	1 58 29 546
Other financial liabilities		--	--	--
Provisions		2 63 200	--	2 63 200
Other current liabilities		29 589	--	29 589
Current tax liabilities (net)		--	--	--
Total Equity and Liabilities		1 00 08 400	--	1 00 08 400
(b) Reconciliation of total comprehensive income for the year ended March 31, 2019				
Particulars		Regrouped Indian GAAP	Ind As adjustments	Ind AS
INCOME				
Other Income		8 400	--	8 400
Total Income		8 400	--	--

EXPENSES				
Employee Benefit Exp	29 474	--	--	29 474
Depreciation and Amortisation exp	--	--	--	--
Other Expenses	1 60 90 661	--	--	1 60 90 661
Total Expenses	1 61 20 135	--	--	1 61 20 135
(Loss) / Profit Before Tax	(1 61 11 735)	--	--	(1 61 11 735)
Tax Expense				
Current Tax	2 200	--	--	2 200
Deferred Tax Credit	--	--	--	--
Total Tax Expense	2 200	--	--	2 200
(Loss) / Profit for the year	(1 61 13 935)	--	--	(1 61 13 935)
Other Comprehensive Income (OCI)	--	--	--	--
Items that will not be reclassified to profit or loss	--	--	--	--
Other Comprehensive Income for the period	--	--	--	--
Total Comprehensive Income for the period	(1 61 13 935)	--	--	(1 61 13 935)

31 Cash Flow Statement

The transition from previous GAAP to Ind AS do not have a material impact on the statement of cash flows.

The notes referred to above form an integral part of the financial statements.

- 32** The financial statements of the Company for the current year ended March 31, 2020 has been prepared for the period of 12 months from April 01, 2019 to March 31, 2020. During the previous period, being the first year of operations, the Company has prepared its first financial statements for the period from December 13, 2018 to March 31, 2019. Therefore corresponding figures in the financial statements are for a period of 3.5 months and are not strictly comparable with those of the current year figures. Previous year's figures have been regrouped or reclassified wherever necessary to conform to the current period's presentation.
- 33** Due to outbreak of COVID-19 globally and in India, the company's management has made initial assessment of likely adverse impact on business and financial risk, and believes that the impact to be short term in nature. The management does not see any medium to long term risks in the company's ability to continue as going concern and meeting its liability as and when they fall due.

Signatories to Note 1 to 33

As per our report of even date attached,

For Shah & Dalal
Chartered Accountants
FRN. 109432W
Sd/-
(Malay Dalal)
Partner
Membership No. 036776

Place: Ahmedabad
Date: July 04, 2020

For and on behalf of the Board of Directors

Sd/-
(Santosh Kumar)
Director / CEO
DIN: 07854179

Place: Gandhinagar
Date: July 04, 2020

Sd/-
(B. C. WARLI)
Director
DIN: 07133942

